

॥ હરિ: ઓં ॥

પૂજ્ય શ્રીમોટા

વિરચિત

પ્રેમ

હરિ:ઓં આશ્રમ પ્રકાશન, સુરત

- પ્રકાશક : ટ્રસ્ટીમંડળ,
 હરિઓં આશ્રમ, સ્થાપના વર્ષ ૧૯૫૬
 કુલોન્દ્રા મહાઠેવના માણિરની બાજુમાં,
 જહાંગારપુરા, રાંદેર, સુરત-૩૮૫ ૦૦૪.
 ફોન : (૦૨૬૧) ૨૭૬૫૫૬૪
 Email : hariommota@gmail.com
 Website : www.hariommota.org
- © હરિઓં આશ્રમ, સુરત, નડિયાદ.
- આવૃત્તિ વર્ષ પ્રતિ
 પ્રથમ ૧૯૭૩ ૧૨૫૦
 બીજી ૨૦૧૨ ૧૦૦૦
- પૂછ : ૩૪ + ૩૩૪ = ૩૬૮
- કિમત : રૂ. ૨૫/-
- પ્રાપ્તિસ્થાન : હરિઓં આશ્રમ, સુરત-૩૮૫ ૦૦૪
 હરિઓં આશ્રમ, નડિયાદ-૩૮૭ ૦૦૧
- મુદ્રણશુદ્ધિ : જ્યંતીભાઈ જાની, ફોન : (૦૭૯) ૨૬૬૧૨૭૨૮
- ડિગ્રીનર : મધૂર જાની, મો. : ૮૪૨૮૪૦૪૪૪૩
- ટાઇપસેટિંગ : અર્થ કોમ્પ્યુટર,
 ૨૦૩, મૌખ કોમ્પ્લેક્સ, સી. યુ. શાહ કોલેજ સામે,
 ઈન્કમ્પ્લેક્સ, અમદાવાદ-૧૪, ફોન : (૦૭૯) ૨૭૫૪૩૬૮૮૮
- મુદ્રક : સાહિત્ય મુદ્રણાલય પ્રા. લિ.
 સિટી મિલ કંપાઉન્ડ, કંકરિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨
 ફોન : (૦૭૯) ૨૫૪૬૮૧૦૧

॥ હરિ:અઁ ॥

સમર્પણાંજલિ

(બીજી આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટા સાથે નહિયાદ આશ્રમના નિમિત્તે સંકળાયેલા અને શરૂઆતથી જ શ્રીદ્વા અને લાગણીની ભાવના થડી એકદિલ થઈને જીવનારા, જેઓ અંતઃરૂરણાના બળે પૂજ્યશ્રીનાં દર્શને નહિયાદ પહોંચે ત્યારે સામેથી પૂજ્યશ્રી કહેતા, ‘આવી ગયો ભરીલા, હું તારી જ રાહ જોતો હતો.’ જેઓ પૂજ્યશ્રીનાં દર્શન પામી સતત રહ્યા જ કરતા, પૂજ્યશ્રીનાં ચરણોમાં હાથખર્યાની રકમ પણ સમર્પિત કરી દેતા, અને પૂજ્યના શરીરની સેવા બાદ સીધા નોકરીએ જતા, પૂજ્યશ્રી જેનો ટિફિનનો ઉભો આશ્રમેથી ભરી આપતા, જેમના પૂજ્ય શ્રીમોટા સાથેના અનેરા સંબંધને ફક્ત મોટા પોતે જ જાણતા, એવા પૂજ્યશ્રીના પ્રેમી જીવ મંગલેશ્વર, જિ. ભરૂચ નિવાસી.

સદગત ગુમાનસિંહ બહેચરસિંહ રાજ

તથા તેમનાં ધર્મપત્ની

શ્રીમતી જ્યાબહેન ગુમાનસિંહ રાજને

‘પ્રેમ’ની આ બીજી આવૃત્તિનું પ્રકાશન પ્રેમભાવે સમર્પણ કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.

પૂજ્ય શ્રીમોટાનો ૧૧૫મો જન્મદિન

ટ્રસ્ટીમંડળ,

ભાદ્રવા વદ ચોથ, સં. ૨૦૬૮

હરિ:અઁ આશ્રમ, સુરત

તા. ૪-૧૦-૨૦૧૨

શ્રી વિષ્ણુપ્રસાદ એસ. પંડ્યા (સાહિત્ય મુક્ષાલય, અમદાવાદ)ને
સપ્રેમ સમર્પણાંજલિ

(પ્રથમ આવૃત્તિ)

(અનુષ્ઠાન)

વિષ્ણુનું નામ ધાર્યું છે, પાળવા પોખવાતણો
-મંડાયો જે કૃપાયજ્ઞ પ્રેમે તે ચલવ્યા જાઓ. ૧

નિપુણ, કર્મમાં મસ્ત શા વ્યવહારદક્ષ છો !
મળેલાં કર્મમાં કેવા ઊંડા ઉત્તરતા તમો ! ૨

ઉત્તમોત્તમ તો કર્મ થવા તત્પર ખંતીલા,
શૂન્યમાંથી તમે કેવી ઈમારત ચણી મહા. ૩

દીપાવ્યું કર્મને જેણે વિશ્વે તેવા દીપી ઉઠ્યા,
કર્મથી જે ઘડાયા છે, જીવે તે માગ કર્મમાં. ૪

સુતરું, સુતરું સર્વ જીવન વહી ના જતું,
વચ્ચે પ્રવાહ રોકાતો, બને જીવન પાંગળું,
સફાળા ઉછળી ત્યાંથી પાછા શા પુરુષાર્થી છો !

થયા ખમીરવંતા શા ! ઉભા કેવા ટટાર છો ! ૫-૬

ભયંકર દશામાં શા આવી પડેલ જીવને !
ત્યાંયે હામ ન હાર્યું જે, ધન્ય તે નરને જગે ! ૭

તમે જીવનનાં ઉચ્ચ તોફાનોમાં ભયંકર
-હાલી જતાં છતાં પાછા થયા ટટાર શા પથ ! ૮

પ્રોત્સાહિત કરી કેવી રૂડી સુહાય દીવેલ છે -
બોથડ મુજ જેવાને તમે નવાજુને હુદે. ૯

બદલો વાળવા જેવું મારી કને કશું ન છે,
તેથી ભાવથી અર્પું આ સમર્પણાંજલિ પદે. ૧૦

હરિઃઽં આશ્રમ, નાનિયાદ
તા. ૧-૫-૧૯૭૩

-મોટા

પ્રેમના પ્રેમીનો પ્રણય

પૂજ્ય શ્રીમોટા પોતાના સાધનાકાળ દરમિયાન એકવાર સ્વ. કવિ સાગર પાસે ગયેલા. આ યુવાન સાધકે પ્રભુના પાવનકારી પંથ પર વિકાસ કરતાં હૃદયની એવી કક્ષા પ્રાપ્ત કરેલી કે જ્યાં પરમ પ્રેમની જલકનો આદર્શ અંકિત થયો હતો. પ્રેમ વિશેના પોતાના એવા આદર્શને વ્યક્ત કરતી વાળી ગાજલ સ્વરૂપે એમણે ટપકાવી રાખી હતી. કવિ સાગર એ ગાજલો વાંચી મુજબ બનેલા. કવિ સાગરે એ સમયના આ યુવાન સાધકને કહ્યું, ‘તારા પ્રેમની આ વાત સંસારના લોકો ઊલટી રીતે સમજુને ગોટાળો ઊભો કરશે. તું એને સામેના તળાવમાં પદ્ધરાવી છે.’

એક પળના પણ વિલંબ વિના પૂજ્ય શ્રીમોટાએ ગાજલોની એ પોટલીને પાણીમાં પદ્ધરાવી દીધી. પોતાની રચનાઓ પ્રત્યે આટલી કક્ષાએ સધારેલું નિર્મભત્વ જોઈને કવિ સાગર એમને જેટી પડેલા.

પૂજ્ય શ્રીમોટાની એ કાળની સૂર્ઝી-ભક્તિ-રસથી છલકાતી રચનાઓ, સંસારી લોકો ના સમજે માટે વિલીન થઈ ગઈ, અને હવે સંસારીઓને સમજવો અને અનુભવવો દોહરાયો પ્રેમ અહીં માત્ર એના પ્રેમીના સંસારના જીવો પ્રત્યેના પ્રણયના એક પ્રતીકરૂપે અવતર્યો છે.

સંસારીઓ જે પ્રકારની લાગણીને, ઊર્મિને ‘પ્રેમ’ના નામથી ઓળખે છે - કે ઓળખાવે છે - એ પ્રેમની વાત અહીં નથી, પણ હૃદયની ભીતરમાં છેક ઊર્મિ સર્વવ્યાપક રહેલા સ્નેહસાગર મોજાંની એક પછી એક વાગતી છાલકો છે. ‘પ્રેમપંથ પાવકની જવાળા’માં પૂરેપૂરા ખપી જઈને, ‘માંહી પઢ્યા તે મહાસુખ’ માણે છે એવા પ્રેમીના પ્રણયની, સ્નેહ-છાલકનો સંસારીઓ ‘તીરે ઊભા તમાશો’ જુએ તો ભક્ત કવિ પ્રીતમદાસ કહે છે તેમ ‘તે કોડી’ પણ પામતા નથી.

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પાને પાને પરમ પ્રેમના અનુભવની જલક સૂચિત કરી છે. પ્રેમ એ પ્રેમ જ છે, એ સિવાયનું બીજું કઈ પણ ‘કશું નથી’. પ્રેમ પ્રભુનું બીજું નામ છે. પ્રેમ કરવાનું સંસારીનું ગજું નથી. પ્રભુ જ પ્રેમ કરવાને યોગ્ય છે. અથવા તો એ પ્રેમના પ્રેમી જ પ્રેમ કરી શકે. પૂજ્ય શ્રીમોટાએ ‘પ્રેમ’ વિશે ગજલ સ્વરૂપમાં જે વાણી અવતારી છે, એ પ્રભુ-પ્રેમના કૃપાપ્રસાદનું જેટલું પરિણામ છે, એટલું જ સંસારી સ્વજનો પ્રત્યેના એ પ્રભુ-પ્રેમના પ્રેમીના પ્રશયનું કારણ પણ છે. નહિતર આવા છેક જ ભાવાત્મક અને અમૂર્ત પરમ અનુભવનું અપૂર્વ નિરૂપણ કેવી રીતે શક્ય બનત ?

પૂજ્ય શ્રીમોટાએ સકળ બ્રહ્માંડમાં રહેલાં આકર્ષણ અને ગતિના કારણરૂપે એ પ્રેમને ગજાવ્યો છે. એ પ્રેમને હદ્યમાં અનુભવવા માટે પ્રેમભર્યું આકર્ષણ થવું જોઈએ. ‘પ્રેમપંથની પાવક જવાળા’ને ભાગીને પાછા ભાગી જતા સંસારીઓ આ માર્ગના સામર્થને પામી ના શકે. પૂજ્ય શ્રીમોટાએ આરંભમાં ચેતવણીનો જે સૂર સંભળાવ્યો છે એમાં વાસ્તવિકતાનો સ્પષ્ટ નિર્દેશ છે. પ્રેમને અનુભવવાનો માર્ગ કોક ‘વિરલા વીર’ જ ગ્રહી શકે છે. એકધારા ખંત, ઉમંગ, ઉત્સાહભર્યા પારમાર્થિક પુરુષાર્થ વડે, સતત સમર્પણ, ફનાગીરી અને ખુચારીપૂર્ણ આહૃતિ વડે, આ પ્રેમના માર્ગ વળી શકાય. ‘અભેદ’ અનુભવવાનું લક્ષ્ય ધારીને પ્રેમના માર્ગ જે ગતિ કરવાની છે, એમાં ક્યાંય પરિણામની કે પ્રાપ્તિની અપેક્ષા રાખવાની નથી, કેમ કે પ્રેમ અનાદિ છે, અનંત છે. પ્રેમના આવા અનંત સ્વરૂપના અને એની સર્વવ્યાપકતાના અનુભવ માટે હદ્યની કક્ષા સાધના દ્વારા ઉધ્વર્તમ દિવ્ય બનતી જવી જોઈએ. પૂજ્ય શ્રીમોટાની વાણીમાં ‘હદ્ય’ શબ્દ એ સ્થાનવાચક નથી, પણ અનુભવનો કક્ષાવાચક છે. આથી, એક જ પંક્તિમાં ‘હદ્ય’ શબ્દ ત્રણ વખત

વપરાય તો એ હદય એક હોવા છતાં ત્રણેય સ્થાને ‘હદય’ની તે તે અનુભવની કક્ષાની બિજ્ઞતા છે.

હદયની કક્ષા દિવ્ય બનાવવા માટેનો પુરુષાર્થ-પરમ પ્રેમને અનુભવવા કાજે-પૂરા પ્રેમથી થવો ઘટે. મમતા, લોલુપતા, આગ્રહ, માગણી કે અહેના બધા જ પ્રકારનાં વલણોના સમર્પીણ દ્વારા ખુલાર થવાની ખુમારી, ઉમળકાભરી અને રસભરી બની રહે છે. એ રસાર્ક્રિતા હદયની ગુણવત્તા બની રહે છે. હદય આ કક્ષાએ કેવો અપૂર્વ રસ અનુભવે છે, એનું નિરૂપણ રસછટાથી પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પાંચમા ખંડમાં કર્યું છે. પણ આ રસાનુભવ એ જ પ્રેમાનુભવ નથી. હજુ તો હદયે એની કક્ષાએથી અનેક ગૌરીશિખરો પર યાત્રા કરવાની છે. અને બધાં જ શિખરો પરના અનુભવોને પ્રતિષ્ઠિત કરવાનાં છે. સંસારી લોકોની કલ્પનામાં પણ ના આવી શકે એવા ભીષણ અને ભયંકર, ધોર અને ગહન અંધકારમાંથી એને પસાર થવાનું છે. સાવ જ શુષ્ણ અને વેરાન પ્રદેશમાં પણ એણે યાત્રા કરવાની છે. પ્રભુપ્રેમને પામવાની કસોટીરૂપ આ અંધકાર, પ્રેમી બની રહેલા સાધકને પ્રેમને પાત્ર બનાવે છે. આવો અનુભવ પણ એ પરમ પ્રેમીનો પ્રેમ છે, એવી પ્રતીતિમાં (અલબત્ત, અનુભવ જ) ટકવું એ અજોડ મર્દનગીભર્યું કાર્ય છે.

પ્રેમમાર્ગની આ યાત્રા પણી ‘ઝાંખી’ની એક અનુભવાવસ્થા આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાનની ઝાંખીનું ધણું જ માહાત્મ્ય છે, પણ એનું હાઈ પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકના છઢા ખંડ ‘ઝાંખી’માંથી આ લખનારને સમજાયું છે. ‘ઝાંખી’ એ પૂર્ણ અનુભવ નથી પણ એ અવસ્થાના આરંભના અંધાણ છે. એક ક્ષણ માટે પોહ ફાટતો હોય એવો ઉજાસ કળાય છે. એ ઉજાસનું દર્શન સ્થૂળ નયનોનું જ માત્ર દર્શન નથી પણ આ સાધનાભ્યાસ દ્વારા મનાદિ કરણોને તથા રોમેરોમને સૂક્ષ્માતિસૂક્ષ્મ નયનો પ્રગટેલાં હોય છે.

‘ઝાંખી’ના આવા અનુભવ પછી પ્રેમાનુભવ માટે તીવ્ર આકર્ષણ જાગે છે અને મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહં આદિ સર્વ કરણો પરમ પ્રેમના અખંડાનુભવ માટે દઈભર્યો તલસાટ અનુભવે છે, અને એ કરણો હરિ પ્રત્યે જ બેંચાયેલાં રહ્યા કરે છે. દિલ કેવા પ્રકારનું દઈ અનુભવનું હશે !-એ આપણાં કોઈ પણ કરણના પ્રદેશનો વિષય નથી. પૂજ્ય શ્રીમોટાએ ‘દિલ’ અને દઈ★ વિષયક કેટલીક રચનાઓમાં એ કક્ષાના અનુભવનો અણસાર કરાયો છે. ‘ઝાંખી’ની ધારણાનું દિલમાં સાતત્ય પ્રગટાં દઈ ઉચ્ચતમ કક્ષાએ પહોંચે છે. ‘ઝાંખી’ એ તો હરિનું એક લટકું છે. એની સંપૂર્ણ પ્રતિષ્ઠા દિલમાં થયા પછી પ્રેમાનુભવનો પ્રથમ સ્પર્શ અનુભવાય છે. અનુભવની જીવનમાં પ્રતિષ્ઠા થતાં પ્રકૃતિનું પૂર્ણ અસ્તિત્વ હોવા છતાં, ભાવ અખંડાકાર થયેલો હોવાથી, પ્રકૃતિનું કશું જ બળ અનુભવાનું નથી. પ્રેમ-સ્પર્શને લીધે જીવન નવો અવતાર ધારણ કરે છે. પૂજ્ય શ્રીમોટાએ મને એકવાર કહેલું કે અખંડાકાર ભાવાનુભવથીય આગળના પ્રદેશમાં હદ્યમાં પ્રેમાનુભવ થાય છે. એ પ્રેમ એ જ મ્લુ છે.

પૂજ્ય શ્રીમોટાએ હદ્યના આ પ્રેમની સાધના કરી, હદ્યને એ પ્રેમને પાત્ર બનાવીને, હદ્યમાં પરમ પ્રેમની પ્રતિષ્ઠા કરી છે. ‘પોતાની જાગેલી આવી પ્રેમસ્વરૂપ ચેતના દ્વારા’ પૂજ્ય શ્રીમોટાએ હવે આ જગત સાથે કેવા પ્રકારનો અને કેવી રીતનો પ્રેમસંબંધ જોડ્યો છે, એ સંપૂર્ણપણે કળવો મુશ્કેલ છે. આમ છતાં છેલ્લા બે ખંડોમાં આ પ્રેમના પ્રેમીની પ્રણયકીડાનો આહ્લાદ આપણે માણી શકીએ એવી રીતે નિરૂપાયો છે.

* દિલના દઈની અનિવાર્યતા અને એની સર્જનાત્મક કક્ષા વિશે ‘જીવન તપ’માં (પૃ. ૨૪૫ થી ૨૮૩) પૂજ્ય શ્રીમોટાની વિશેષ રચનાઓ જિજાસુ જોઈ શકે છે.

હદ્યના પ્રેમનો અનુભવ વાચાતીત અને શબ્દાતીત છે. એનો સ્પર્શ અહીં અક્ષર સ્વરૂપે અવતર્યો છે. એ દ્વારા પૂજ્ય શ્રીમોટાની પ્રેમકળાનો અંશ સ્પર્શ અનુભવી શકાય છે. પૂજ્ય શ્રીમોટા ઈશ્વરના સર્વ ગુણોનો-સાકાર તેમ જ નિરાકાર બંને સ્વરૂપે સાક્ષાત્કાર પામ્યા છે. અનુભવનો ‘શબ્દ’ એ નિરાકાર છે. એ માત્ર અમૃત ભાવાત્મક છે. એનું અક્ષર સ્વરૂપ ભલે સંપૂર્ણપણે એ જ વ્યક્ત ન કરતું હોય, પણ એ નિરાકાર અમૃતભાવને અંશરૂપે પણ સાકાર તો કરે જ છે. પૂજ્ય શ્રીમોટાનું આ પ્રકારનું સાહિત્ય આ અર્થમાં પણ એમનો અક્ષરદેહ છે. પૂજ્ય શ્રીમોટાના ‘અમૃત જીવન’નો આ પ્રસાદ આપણી સમક્ષ અક્ષર સ્વરૂપે છે, એ આપણને થતું એમનું સાક્ષરરૂપનું દર્શન છે અને એ શબ્દોમાં ગુજરી પૂજ્ય શ્રીમોટાની વાણી હદ્યમાં સતત ઉદ્ઘણતા પ્રેમસાગરનાં મોજાંનું રસ અને માધુર્યભર્યું સંગીત છે. આ લખનારને આ પુસ્તકનું માળખું તૈયાર કરતાં કરતાં ઘણે સ્થળે આવું અનુભવાયું છે.

પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકને એમાં પ્રયોજેલી ગજલ સ્વરૂપને કારણે આજ લગી પ્રગટ થયેલાં ‘જીવન અનુભવ ગીત’ની શ્રેષ્ઠીનાં ઓગણીસ પુસ્તકોની હરોળમાં મૂકી ના શકાય, પરંતુ ‘જિજ્ઞાસા’, ‘શ્રદ્ધા’, ‘નિમિત્ત’, ‘રાગદ્રોષ’, ‘કૃપા’, ‘કર્મઉપાસના’, ‘સ્વાર્થ’ અને હવે પ્રગટનાર ‘મોહ’ વગેરે શાસ્ત્રીય પુસ્તકોની કક્ષાનું આ પુસ્તક છે. ઉપરોક્ત પુસ્તકો પૂજ્ય શ્રીમોટાએ અનુષ્ટુપ છંદમાં રચ્યાં છે. તો પછી ‘પ્રેમ’ વિશે આ રચનાઓ ગજલ પ્રકારમાં શા માટે રજૂ કરી ? એવો પ્રશ્ન પણ થાય. સદ્ગત રામનારાયણ વિશ્વનાથ પાઠકના ‘બૃહદ પિંગળ’ ગ્રંથમાં કાવ્ય પ્રકાર ‘ગજલ’ વિશે લખતાં તેઓશ્રીએ સદ્ગત સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ જવેરીએ ગજલ વિશે લખેલું એક વાક્ય ઉતાર્યું છે, એ આ સંદર્ભમાં નોંધપાત્ર છે. ‘ગજલ’ એ છંદનું નામ નથી. ‘ગજલ’ એ કાવ્યનો

એક પ્રકાર છે. એ મૂળ અરબી શબ્દ છે. એનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્યરૂપે બોલવું એમ થાય છે.' પૂજ્ય શ્રીમોટા આ રચનાઓ દ્વારા પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્યરૂપે બોલે છે. ગજલના પ્રચલિત ઢાળમાં પૂજ્ય શ્રીમોટાની વાણી સહજ રીતે ઢળે છે. ગજલના પ્રચલિત ગેય રૂપમાં લય જળવાય એવું આ રચનાઓનું માણખું છે. એના બાબ્ય માળખાનો લય જળવાઈ રહે એવી સ્થૂળતા જોવામાં વાચક અટકે તો એમાં પ્રયોજયેલા શબ્દોના આંતરલયને માણવાનું એ અવશ્ય ચૂકે એવું પણ કેટલીક જગ્યાએ બન્યું છે. લયના સ્થૂળ માળખાને બેદીને એના આંતરભાવના લયનો સ્પર્શ માણવાથી વસ્તુતત્ત્વને યથાર્થ રૂપે સમજ્ઞ-માણી શકાશે. પૂજ્ય શ્રીમોટાનો હેતુ આ રચનાઓ દ્વારા કાવ્ય સિદ્ધ કરવાનો નથી. તેઓશ્રી આ રચનાઓને જોડકણાં કહે છે. એમાં જ રચનાસ્વરૂપનો સઘળો મર્મ આવી જાય છે. સુશ્રી વાચક વસ્તુને ત્યજીને વ્યાકરણમાં નહિ અટવાય એવી આશા રાખું છું.

પૂજ્ય શ્રીમોટાએ એમની આ રચનાઓને શીર્ષક આપી, શક્ય તેટલા યોગ્ય કમમાં ગોઠવવાનું કાર્ય સોંઘયું એમાં મારી લેશ પણ ક્ષમતા નથી, પરંતુ એ પ્રેમીના અકારણ પ્રેમને લીધે આ કામ થઈ શક્યું છે. વળી, આ પુસ્તક વિશે લખવાનું સૂચય્યું એથી આ લખી શકાયું છે. હવે પછીનાં પાનાંઓમાં જે પ્રણયપ્રસાદ છે એને આવા અણાધડ શબ્દો દ્વારા અજીઠો કરવાના મારા અપરાધની ક્ષમા ચાહીને હું વિરમું છું.

તા. ૨૦-૯-૧૯૭૩

રમેશ મ. ભડ્ક

● ● ●

લેખકના બે બોલ

(પ્રથમ આવૃત્તિ)

હું રોજ પોસ્ટકાર્ડમાં કેટલાંકને એક એક જોડકણું લખું. આજ સુધી તે બધાં ૨૫૦૦ ઉપરાંતની સંખ્યામાં થાય, એટલે જેમને લખતો હોઉં તે છપાવી આપે, અને કેટલાંક તો તે પુસ્તક વેચી પણ આપે. આમ, તે બધી રકમ હરિઃઝેં આશ્રમના ચોપડે જમા થઈ જાય. આમ, હું રોજ પોસ્ટકાર્ડમાં કેટલાંકને કાવ્ય લખતો હોઉં છું, તે ઘણાંખરાંને તો ખબર. મારાં કર્માના સંગાથી, અનેક રીતે મને મદદ કરનાર, અને બીજી અનેક રીતે અનેક હકીકતમાં જે ખડે પગે ઊભા રહેનાર, એવા શ્રી હંદુભાઈ શેરદલાલે મને એકવાર કહ્યું, ‘મોટા ! તમો રોજ જ્યશ્રીને એક એક કાવ્ય લખો તો સાંદું, તેની ઘણી જ ઈચ્છા છે.’-પ્રેમનું આ ઉદ્ભબવસ્થાન. તે મુજબ રોજ જ્યશ્રીને એક એક કાવ્ય લખતો, અને તે ઘણી બધી સંખ્યામાં થયાં. તે કાગળોનાં જોડકણાંને ઉતારી આપવાનું કામ મારા સ્નેહી શ્રી પ્રતાપભાઈનાં દીકરી અચ્યલાબહેને કરી આપ્યું.

આ બધાં જોડકણાં લખાતાં હતાં ત્યારે કોઈ હરિનો લાલ આ બધું છપાવવાને મળી રહેશે તેવી શ્રદ્ધા તો હતી જ, અને થયું પણ તેમ જ.

મારી સાથે સંબંધ રાખનારાં ભાઈબહેનો, મારા માટે લાગણી રાખનારાં જે બીજાં ભાઈબહેનો છે, તે બધાં આવાં છપાયેલાં પુસ્તકો વેચી આપવામાં મદદ કરે એવી મારી તેમને વિનંતી છે. ભાઈશ્રી હંદુભાઈ શેરદલાલને ત્યાં મારાં આવાં છપાયેલાં પુસ્તકોએ કેટલી મોટી જગા રોકી છે, એ તો જાતે

જોણે જોયું હોય તેને સમજણ પડે. નાદિયાદ આશ્રમમાં આટલાં બધાં પુસ્તકો રાખવાની કોઈ સગવડ નથી. આવી સગવડ સરળતાથી ઓચિતી આપમેળે મળી છે, તેને હું ભગવાનના પ્રસાદરૂપે અનુભવું છું. ભાઈશ્રી હૃદુ અને જ્યશ્રીનો ઉપકાર તો કેટલો માનું ? અને કેવી રીતે માનું ? પૂજ્ય બાને તો વીસરાય જ કેમ ? આવાં બધાં જે જીવો ભગવાનની કૃપાથી મળ્યાં છે, તે તે જીવોની મારા પરત્વેની શુભેચ્છાઓ, સહાનુભૂતિ, ઓથ, અને મને ખપમાં લાગવાની એમના દિલની તત્પરતા, તે બધાના બળ વડે કરીને મારા ભાંગેલા શરીરમાં પ્રાણ પ્રગટે છે, અને જિવાય છે પણ તેને જ કારણે.

અમદાવાદમાં જ્યારે હોઈએ છીએ ત્યારે ભાઈ હૃદુ અને જ્યશ્રી તો સેવામાં હાજર જ, તેમનું બધું જ કામકાજ પડતું મૂકીને. તેવી જ રીતે નાદિયાદમાં ભાઈ રાજુ અને તેમનાં પત્ની રેણુકાબહેન. રેણુકા તો સુરત આશ્રમમાં પણ મારા શરીરની સેવા માટે આવે છે. આ બધાં જીવોનો કંઈ રીતે બદલો વાળી શકું ? મારામાં તો તેવી કોઈ શક્તિ નથી. બદલો વાળનારો તો હજાર હાથવાળો મારો ભગવાન જ છે.

માનું શરીર ઘણા રોગોથી પીડાયેલું રહે છે, તે ઘણાં બધાં જાણે છે. મુસાફરીથી હવે શરીરને થાક લાગે છે, જે પહેલાં લાગતો ન હતો. મુસાફરીમાં મોટરમાં ફરવાનું બને છે, પૂરતો આરામ પણ મળે છે, તેમ છતાં બહુ બધા રોગોનાં કારણે શરીરની સહેવાની શક્તિ મર્યાદાની બહાર પહોંચી ગયેલી છે. જે કંઈ સહેવાનું હોય છે તે શારીરિક શક્તિથી નથી બનતું, એટલી વાત મારે મન નિશ્ચિત હકીકત છે. તેથી,

મળેલાં સ્વજનોને અને અન્ય જીવોને પ્રાર્થના છે, કે પરમાર્થનાં કર્મમાં મદદ કરે અને આ છપાયેલાં પુસ્તકોને વેચવાનું કામ, મારી સાથે સંકળાયેલાં દરેક જીવ ઉપાડી લે અને વેચી આપે. ભાઈ હૃદુભાઈને ત્યાં ઘડી જગ્યા રોકાઈ ગઈ છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારાઈ હતી, તેમ મળેલાં તમે બધાં આ કામ પાર ઉતારી દો એવી મારી તમને દિલની, દિલથી વારંવાર વિનંતી અને પ્રાર્થના છે.

આ બધાં જોડકણાં ‘પ્રેમ’ ઉપરનાં છે. અત્યાર સુધી એના ઉપર મારાથી કશું લખાયું ન હતું. પ્રેમનાં તો ઘણાં પાસાં છે. ભક્ત હૃદયવાળા જીવને પ્રેમના ભાવ વડે કરીને જ જિવાતું હોય છે. એવાં પ્રેમનાં તો ઘણાં પાસાં. સામાન્ય માણસને સમજણ પડે એવાં જ પાસાં વિશે મેં લાયું છે. પ્રેમના રહસ્યનાં પાસાં વિશે લખવાનું જાણી જોઈને ટાયું છે. પ્રેમમાં, પ્રેમની ભાવનામાં વિકાસ થવાને કાજે, ઝાંખી, રૂપર્શ અને દિલ ઉપર પણ ભગવાનની કૃપાથી લખાયું છે ખરું. ભક્તિમાં ઝાંખીનું રહસ્ય કોઈ અનોખા પ્રકારનું છે. ઝાંખીથી ભક્તહૃદયને, ભક્તિમાં એકરાગ અને શ્રીભગવાનના ભાવમાં અંડપણું અનુભવવાને કાજે, શ્રીહરિની ઝાંખી, એ એક અનોખું, અણમોલ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અવર્ણનીય એવું એક ભાવાત્મક તે છતાં પ્રત્યક્ષ એવી ઝાંખીનું શ્રીહરિ કૃપાથી જે દર્શન થયું છે, તેનું મેં આ જોડકણાંમાં બધું સ્પષ્ટતાથી અને સરળતાથી વર્ણન કરેલું છે. ઝાંખી એ તો શ્રીભગવાનની કૃપાનો કોઈ અગોચર, અગમ્ય, ગૂઢમાં ગૂઢ અને પાછો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી એક શ્રીહરિ લીલાના દિવ્ય ભાવનો પ્રત્યક્ષ હકીકતયુક્ત અને ભક્તનાં

મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમૂ, અને એ બધાંનીય ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે હૃદય છે, એવાં બધાંય કરણોને જાંખીનું દર્શન તેમને તેમને પ્રકૃતિમાંથી ઊંચકીને શ્રીભગવાનની ભક્તિમાં અદ્ભુત, દિવ્ય રસમાં તેમને તેમને પલાળીને, તે તે કરણોને એવા તો રસમય બનાવી ટે છે, અને ઉત્કટમાં ઉત્કટ ઉન્માદભર્યું, કોઈ અનોખા પ્રકારનું આકર્ષણ પેલા પલળતા જતા ભક્તના દિલમાં પ્રગટાવે છે. તે દિવ્ય આકર્ષણો આનંદ, શરીરનાં રોમેરોમમાં, આશુએ આશુમાં, નસેનસમાં અને રગેરગમાં ઓતપ્રોત થઈને ફેલાઈ જતો હોય છે. જોકે જાંખી એ તો પ્રાણના સૂક્ષ્મ અને દિવ્ય પ્રદેશની હકીકત છે, પરંતુ આ જાંખી અને તેનું દર્શન એ તો પ્રાણના કરણને થતાં જતાં, ભક્તની ભૂમિકાને ક્યાંયે ઉર્ધ્વમાં લઈ જાય છે, અને તે પ્રાણના કરણની સાથે મન, ચિત્ત, બુદ્ધિ, પ્રાણ અને અહમૂ પણ સંકળાયેલાં રહ્યા કરે છે. ગમે તેટલું લખીએ તોપણ જાંખીનાં દર્શનનું વર્ણન શર્દ્ધાતીત અને ભાવાતીત પણ છે. તેમ છતાં તેની થોડી ઘણી સમજણ પડે અને પ્રભુકૃપાથી તે ભૂમિકામાં જે જે, જેવો જેવો અનુભવ થયો હતો, તેની આદ્ધી પાતળી હકીકત આ જાંખીનાં જોડકળાંમાં લખી છે. જાંખીનું હાઈ અનોખું છે. જાંખીનું રહસ્ય ભક્તને દિલમાંની દિલની એક વાસ્તવિકતાવાળી હકીકત છે. સામાન્ય જીવને માટે તે જાંખી જરૂર રહસ્યવાળી છે. જે જીવને ભક્તના પ્રદેશની કશી સમજણ કે ગતાગમ નથી, તેવાને જાંખી વિશે કશી સમજણ પડી ના શકે. એ તો એમ પણ કહે કે એ તો માનવીના મનના ખાલી તરંગો છે, અથવા તો તે એક નવરા પડેલા

માણસના મનની ઉદ્ઘયનશીલ કલ્યનામાત્ર છે, પરંતુ આવા પ્રકારની ઉદ્ઘયનશીલ કલ્યનામાત્રમાં પણ રમવું કોને ગમે છે ?

‘સ્પર્શ’ અને ‘દિલ’ વિશે કંઈ હું લખતો નથી.

ધણાં વર્ષો ઉપર મારા એક સ્વજનને ‘પ્રેમ’ ઉપર એક પત્ર લખ્યો હતો. પ્રેમ પરત્યેની સમજણ પ્રગતાવવાને માટે તે આખોયે કાગળ આ ‘લેખકના બે બોલ’માં મેં આવરી લીધો છે, અને તે નીચે મુજબ છે :-

‘સર્વ ખલ્વિદં બ્રહ્મ’ એવું શ્રુતિવચન જેટલું સાચું છે તેટલું જ સાચું સર્વ ખલ્વિદં પ્રેમ એ કથન છે. અંગ્રેજીમાં તો ‘પ્રલુબ એ જ પ્રેમ છે’ એવી ઉક્તિ છે પણ ખરી. સ્થૂળમાં સ્થૂળથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રેમ પ્રવર્તી રહેલો છે. એને જ લીધે સૃષ્ટિનું ધારણ થાય છે, પોષણ થાય છે. એને જ લીધે માનવી અને પણ તથા પ્રાણીમાત્રમાં જિજીવિધાની અદભ્ય પ્રેરણા રહેલી છે, કેમ કે જિજીવિધા ત્યારે જ હોય કે જ્યારે જીવવામાં રસ રહેલો હોય. એકલા સચેતન નહિ પણ અલ્યાચેતન અથવા આપણો જેને જડ કહીએ છીએ તેવા પદાર્થો પણ પ્રેમબદ્ધ છે. આ કંઈ કોઈ તરંગી કવિનો કલ્યનાવિહાર નથી, પણ શુદ્ધ સત્ય હડીકત છે. પૃથ્વી અને બીજા ગ્રહો પરસ્પરના અને સૂર્યના આકર્ષણથી અને તારાઓ એકબીજાના આકર્ષણથી સ્વર્થાન અને સ્વમાર્ગથી ચ્યુત નથી થતા અને તેથી સૃષ્ટિનો કમ ચાલ્યા કરે છે. પૃથ્વી ઉપર પણ દરેક જડ પદાર્થને પૃથ્વીનું આકર્ષણ છે, તેથી જ તે પૃથ્વી ઉપર રહી શકે છે. આખું વિશ્વ કોઈ નિગૂઢ, અદદ્દ સાંકળથી એકબીજા સાથે જોડાઈ રહ્યું છે. પછી તેને સાપેક્ષવાદનો નિયમ (Law of Relativity) કહો કે બીજું કોઈ નામ આપો. એ

નિયમ, નિયમ હોવાથી સૂક્ષ્મ છે, પણ તેથી જ તે એટલો શક્તિશાળી છે, કે સમસ્ત વિશ્વમાં તે વ્યાપ્ત છે. આ નિયમ પણ પ્રેમનું જ સ્વરૂપ છે, કેમ કે પ્રેમ એટલે એકબીજાને જોડનારી સૂક્ષ્મ સાંકળ નહિ તો બીજું શું છે? આ પ્રેમ જ્યારે દેખીતી રીતે એવા પ્રાથમિક સ્વરૂપમાં પ્રગટે છે, કે તેમાં પ્રાણ ના હોય એમ આપણાને લાગે ત્યારે આપણે એને જડ પદાર્થનું નામ આપીએ છીએ. એને સજ્જવ ભલે વૈજ્ઞાનિકો ના કહેતા હોય, પણ એ શક્તિનું સ્વરૂપ છે એમ તો તેઓ પણ કહે છે. કોઈ પણ જડ પદાર્થનું પૃથક્કરણ કરતાં કરતાં વૈજ્ઞાનિકો જ્યાં સુધી પરમાણુ- Atom સુધી પહોંચ્યા ત્યાં સુધી તો ટીક હતું, પણ સૂર્યમાળામાં શ્રીકૃષ્ણરૂપી સૂર્ય અને આસપાસ ગ્રહોરૂપી ગોપ-ગોપીઓની જે સનાતન રાસકીડા થયા કરે છે, તેવી જ સનાતન રાસકીડા પેલા અણોસપિ અણીયાન્ જેવા પરમાણુમાં પણ થાય છે, એવી જ્યારે શોધ થઈ ત્યારે તો પછી જડ પદાર્થનું જડપણું ના રહ્યું, અથવા રહ્યું ગણીએ તોપણ ત્યાં કંઈક એવું આકર્ષણનું તત્ત્વ માલૂમ પડ્યું કે જેને ‘પ્રેમશક્તિ’ એવું નામ તાત્ત્વિક રીતે તો આપી શકાય, પછી ભલે એ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્ર અનુસાર નામ ના અપાયું હોય.

સૃષ્ટિનું ધારણ અને પોષણ જેમ પ્રેમથી થાય છે, તેમ તેની ઉત્પત્તિ પણ પ્રેમથી જ થઈ છે. રસરાજ ભગવાનને લીલા કરવાની, રસ ભોગવવાની ઈચ્છા થઈ અને એકોડહેં બહુસ્યામની વૃત્તિ ઉત્પન્ન થતાં જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. અને સૃષ્ટિના ધારણ પોષણ દરમિયાન પણ સતત ઉત્પત્તિની જે કિયાઓ થયા કરે છે તેનું કારણ પણ પ્રેમ કે રસ જ છે, એ હકીકતનો ઈન્કાર કોણ કરી શકશે?

આમ, પ્રેમ વિશ્વવ્યાપી છે. ૪૩ પદાર્થોમાં તે આકર્ષણના નિયમ તરીકે ઓળખાય છે, અને જીવંત પ્રાણીઓમાં તે વિષયવાસના, અને તેના ઉચ્ચતર સ્વરૂપમાં પ્રેમ તરીકે ઓળખાય છે.

માનવીમાં પશુત્વના અવશેષ અને પ્રભુત્વનાં બીજ છે, એ તો સર્વસ્વીકृત સત્ય છે. માનવીમાત્ર, (માનવી શું, પ્રાણીમાત્ર-ચેતનમાત્ર) અંતે તો પ્રભુમય થવાનો છે, તેથી જો એણે પોતાના સહજ વિકાસની ગતિ ત્વરિત કરવી હોય અને તે દ્વારા કેટલાંય નિવાર્ય દુઃખો કે ચિત્તા કે કર્મવિપાકમાંથી બચવું હોય કે તેને હળવાં કરી નાખવાં હોય તો અને આજકાલ જેનો સૂર પ્રધાનપણે વાગી રહ્યો છે, એવી માનવસેવા તેના સાચા અર્થમાં કરવી હોય તોપણ, તેણે આ વિરાટ તત્ત્વ-પ્રભુત્વ-પ્રેમને દિવ્ય અને દિવ્યતર બનાવવા પડશે.

એ પ્રેમ ‘દિવ્યતર’ ક્યારે બન્યો કહેવાય ? જ્યારે પ્રેમનાં બંને લક્ષણો-દૈત અને અદૈત-તેના પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થાય ત્યારે. કંઈ પણ ‘બે’ના અસ્તિત્વ વિના, નથી સૂચિનું અસ્તિત્વ-કે નથી પ્રેમનું. અધમમાં અધમ સ્વાર્થી માનવી પણ પોતાના શરીરને કે મનને એટલું ચાહે છે, કે તેને સુખસગવડો મળે તે હેતુથી અનેક નીચ કૃત્યો કરે છે. આમ, શરીર, મન, સ્વભાવ વગેરે પ્રકૃતિનો આવિભવ અને ‘હું’ એ બેને તે જાણેઅજાણે જુદાં ગણે જ છે. સોઝહમ્ કે સર્વ ખલ્ચિદં બ્રહ્મ એ સત્ય સમજવા માટે કંઈ નહિ તો બુદ્ધિથી ‘અહું’ અને ‘સઃ’ નો કે ‘સર્વ’ ઈદ’ અને ‘બ્રહ્મ’નો બેદ પાણ્યો એટલે પડ્યો. સોઝહમનો અનુભવ તેને જ થાય છે, કે જેને સઃ ઉપર પ્રેમ ઊપજે છે.

પ્રેમ ત્યાં જ હોઈ શકે કે જ્યાં પ્રેમી હોય અને પ્રેમપાત્ર હોય. એટલે કંઈક બીજું પણ હોય. પણ પ્રેમ એ પ્રભુનું તત્ત્વ હોવાથી તેમાં ઉર્ધ્વગતિ સાહજિક છે. તેથી જ એ દૈતમાં પણ અદૈતનો આદર્શ તે પ્રતિ વેગવાળું કે ધીમું, ભાનપૂર્વક કે સ્વભાવવશ થઈને થતું પ્રયાણ અને અદૈતમાં લય કે સંમિલન-એ બધું જ પ્રેમમાં નિગૂઢ રીતે કે આવિર્ભૂત સ્વરૂપમાં રહેલું છે. આમ, પ્રેમ એ જેડનાર-બાંધનાર-સાંકળ પણ છે અને મુક્તિ અપાવનાર સાધન પણ છે. ખરી રીતે સાચો પ્રેમ એવી સાંકળ છે, કે જે સાંકળ જ નથી પણ મુક્તિનું જ લક્ષણ છે, કે મુક્તિનું જ સ્વરૂપ છે. માનવી કોની સાથે ખૂબ ‘ઘૂટ’થી વર્તી શકે છે ? જેની સાથે તે પ્રેમની સર્વશક્તિમાન સાંકળથી બંધાયો હોય તેની સાથે. પરમ ચૈતન્યતત્ત્વ સાથે બંધાયેલો દેહધારી એટલે જીવન્મુક્ત, એટલે જ જે પ્રેમ દૈત વગર અશક્ય છે, તે જ દૈત તેના જીવન્મુક્ત શુદ્ધતમ રૂપમાં અદૈત જ છે.

પ્રેમની આ સાહજિક ઉર્ધ્વગતિને જેટલે અંશે માનવ ભાનપૂર્વક સ્વપ્રયત્નથી વેગ આપશે, તેટલે અંશે તેને લાભ થશે, કેમ કે સાચો પ્રેમ મેળવવામાં અને તેના પ્રયાસમાં તથા મેળવાતાં થતી મન, પ્રાણ, હૃદય, બુદ્ધિ વગેરેની કિયા પ્રક્રિયામાં જ માનવી આપોઆપ વધારે ને વધારે શક્તિ કેળવતો અને મેળવતો જાય છે. પ્રેમ પ્રભુનું તત્ત્વ હોવાથી તે આપણને આપણી પ્રકૃતિના, જન્મોથી પડેલા સંસ્કારો ઉપર, આપણાં કર્મ અને પ્રારબ્ધ ઉપર, આપણી સરસાઈ અને આપણું નિયંત્રણ કરવા પ્રેર્ણા કરતો હોય છે. પ્રેમ આપણને શુદ્ધ કરે છે, કેમ કે પ્રિયજનને ખાતર આપણી સર્વ મનીષાઓ અને

માન્યતાઓનો ત્યાગ તે માગી લે છે. પ્રેમ હોય ત્યાં ‘હું’ અને ‘મારું’ રહેતું નથી. જેટલે અંશો ‘હું’ અને ‘મારું’ હોય તેટલે અંશો પ્રિયજન ઉપર પ્રીતિ ઓછી જ હોય, કારણ પ્રેમ એટલે જ મારાપણું નહિ પણ પ્રિયજનપણું. ‘પ્રિયજનને ગમે તે જ મને ગમે.’ એવી જ્યાં ભાવના અને તદ્દનુસાર વર્તન નથી હોતાં અથવા ઓછાં હોય છે ત્યાં એ પ્રેમ કહેવાય જ કેવી રીતે ? ત્યાં તો કેવળ સ્વાર્થ જ ગણાય. પ્રિયજનને ગમતું જ કરવાની હોંશ જ્યારે હોય ત્યારે જ પ્રિયજન માટે સર્વસ્વનું સમર્પણ આનંદપૂર્વક થઈ શકે અને ત્યારે જ માનવી જેવા માટીના દેહવાળાથી પણ પરાકરમ, દુઃખસહન વગેરે પ્રભુમય કે અતિમાનવ લક્ષ્યથો પ્રાપ્ત કરી શકાય. બાળકની અનેક જાતની ગ્રાસ કે ઘૃણા ઉપજાવનારી કરણીને માતા આનંદથી ભોગવી લે છે, તેનું કારણ પ્રેમ. સાચો પ્રેમ પ્રિયજન પાસેથી કશાની અપેક્ષા રાખતો નથી. પ્રિયજન પાસેથી પ્રેમની પણ અપેક્ષા રખાય તો તેટલે અંશો એ પ્રેમ કાચો છે. અલબત્ત, આવા કેવળ નિરપેક્ષ પ્રેમનું પરિણામ મોહું વહેલું સામા પક્ષ તરફથી પ્રેમમાં પરિણામ પામ્યા વિના રહેતું જ નથી. તેમ છતાં સાચો પ્રેમ તો એવા કોઈ પણ જાતનાં પરિણામની ઈચ્છા કે આશા રાખતો નથી.

ઉદાર માનસ એ તો પ્રેમનું પહેલું પગથિયું માત્ર છે. પરિસ્થિતિ અનુસાર સંબંધમાં આવતી અનેક પ્રકારના સ્વભાવવાળી વ્યક્તિઓને સહન કરી લેવી એ તો પ્રેમનો પ્રારંભ કહેવાય. અને ગેરસમજૂત, મર્મછેદી વાક્યોના ધા, અન્યાયી વર્તન, કેવળ તુમાખીભર્યો કે કેવળ નીરસ કે

ઉદાસીન અથવા વિરોધી વૃત્તિવાળો ભાવ, અનેક જાતના ખોટા આક્ષેપો, દુઃખ દેવા ફેંકાયેલાં લોહબાણથી પણ કઠણ ગણાતાં વાગ્બાણ-એ બધું જ મૂંગે મોઢે સહી લેવું એટલે માનસિક ઉદારતા, પણ માનસિક ઉદારતામાં પણ થોડું ઘણું દુઃખ અંતર્ગત રહેલું હોય છે. સાચા પ્રેમને તો એવું દુઃખ નથી. અનેક શારીરિક કે માનસિક અડયાળો પ્રેમ એક રુંવાહું પણ ફરકવા દીધા વિના શાંતિથી સ્વીકારી લે છે. એ કદી પોતે કરેલી કરણીને ગાઈ વગાડી જાણતો નથી.

પોતાના સર્વપણાની અને સ્વાર્પણાની બાબતમાં પ્રેમ જેટલો મૌન રહે છે તેટલો જ નિરભિમાની રહે છે. અહંકાર-મદ અને પ્રેમ એ બે વચ્ચે કદી મેળ ખાઈ શકે નહિ. તે સાથે પ્રેમને અને મોહને પણ તેજ-તિમિર જેવો સંબંધ છે. જેટલે અંશે મોહ તેટલે અંશે પ્રેમનો અભાવ. મોહ આંધળો છે, પ્રેમ વિરાટ સ્વરૂપ ભગવાનનું લક્ષ્યાણ હોઈ અસંખ્ય આંખોવાળો છે. પોતાના પ્રિયજન પ્રત્યે તેના કલ્યાણના હેતુનો સતત ઝ્યાલ રાખીને તે દેખીતી રીતે અત્યંત કઠણ થઈ શકે છે, કેમ કે પ્રેમ કંઈ વેવલાપણું કે કેવળ કુમળી કુમળી, પોચી પોચી, લાગણી નથી. પ્રેમ પ્રિયજન પ્રત્યેના વર્તનની બાબતમાં હંમેશ એક ઝ્યાલ રાખે છે : પ્રિયજનનું કેવી રીતે શ્રેય થાય. એને પ્રિય લાગે એવું જ કરવું એ કાંઈ પ્રેમ નથી, એ તો કાં તો કાયરતા છે કે ખુશામત. આવા એકમાત્ર કલ્યાણ પ્રતિ દાખિ રાખીને કરેલા વર્તનથી ઘણી વાર પેલું પ્રિયજન ઊંધું સમજે, ગુસ્સે થાય, દ્વેષ પણ રાખે. અહિત કરવા તત્પર થાય અને સાચેસાચ અહિત કરે પણ ખરું, તેમ છતાં પ્રેમ તો એની પ્રત્યે દેખીતી

રીતે ભલે કઠોર વર્તન કરે તોપણ અંદરથી તો પોતાનું હૈયું સદાય ભીજાયેલું રાખશે. પ્રિયજનના આધાતોનો પ્રત્યાધાત હૃદયના ઊંડા પ્રેમભાવથી જ આપશે અને બધી વિટંબણા પ્રભુની પ્રસાદી તરીકે સ્વીકારી અને વધાવી લેશે, અને પોતાનું કલ્યાણ જ કરાવવા આધાતો તેને મળે છે એમ જ સમજશે. આવી રીતે સહિષ્ણુતામાંથી વિકસતાં વિકસતાં દ્વેષનો બદલો પ્રેમમાં પરિણામ પામે છે અને પછી એવું પ્રેમમય વર્તન એકાદ બે વક્તિ કે અમુક સમૂહ પ્રતિ નહિ પણ મ્રાણીમાત્ર પ્રતિ થતાં, પ્રેમ ભગવાન બની જાય છે.

આવો પ્રેમ ગ્રાપ્ત કરવાની ઉત્સુકતા ધરાવનારને જગતના સર્વ કોઈ પ્રસંગો, પોતાના કર્મવશાત્ર સંબંધમાં આવેલાં સર્વ કોઈ પ્રાણીઓ, પ્રેમનો પાઠ શિખવાડનાર થઈ પડે છે, પણ તે પોતાનું પ્રત્યેક વર્તન ભાનપૂર્વક, જ્ઞાનપૂર્વક, પોતાના આત્મશ્રેયનો હેતુ સતત લક્ષમાં રાખીને કરતો હોય તો. કેવળ પ્રકૃતિને વશ થઈને પ્રેમાળ વર્તન થતું હોય તો વિકાસ ઓછો થાય છે અને કેટલીક વાર પછિયાવાનું પણ બને.

આનું પણ કારણ છે. સાચો પ્રેમ પૂરેપૂરો અનાસક્ત છે. આસક્તિ અને પ્રેમ વચ્ચેનું અતિ સૂક્ષ્મ અંતરપટ તો કેવળ સંતો જ પારખી શકે એવું કશું નથી. સાધારણ રીતે પ્રેમ તરીકે જે ઓળખાય છે, તે ઘણી વાર આસક્ત હોય છે, કેમ કે પ્રેમ એ એકાએક ઉછાળો મારતો અને પછી શમી જતો આવેગ નથી, પણ એ તો શાંત, ગંભીર, ઊંડા જલનિધિ માફક સતત નિશ્ચલપણે વહેતો ભાવ છે. એમાં વિસ્તાર પણ છે અને ઊંડાણ પણ છે. એને સમુદ્ર કરતાં પણ બોમની

ઉપમા વધારે યોગ્ય રીતે આપી શકાય, કેમ કે બ્યોમ સમસ્ત સૂચિમાં વ્યાપક છે, છતાં અલિપ્ત છે, અને સૂચિની પાર પણ જો કોઈ પ્રકૃતિનું તત્ત્વ રહેતું હોય તો તે આકાશતત્ત્વ છે. આસક્તિ માણસને પદ્ધતિ છે, પ્રેમ ઉઠાડે છે. એવો અનાસક્ત પ્રેમ કેળવવો અને મેળવવો એટલે જ સાધના. એને સાધનાનું એક મહત્વાનું અંગ ગાજાવામાં આવે તો તે પણ અલ્યોક્તિ છે. જેમ એ સાધના છે, તેમ એ સિદ્ધિ પણ છે. કુશળ વર્તન અનાસક્તિથી પ્રાપ્ત થતી કેવળ નિર્લેપ દાણિ વગર અશક્ય છે અને પ્રેમ, પ્રેમપાત્રાનું કલ્યાણ જ વાંછતો હોવાથી, કુશળ વર્તન તેને માટે અનિવાર્ય છે. યોગ્ય સમયે યોગ્ય હાર્દિક વલણ પણ એણે રાખવું જ જોઈએ. એવાં યોગ્ય વલણ અને વર્તનની ગમ હોવી, સૂજ પડવી એ કંઈ પુસ્તક વાંચનથી કે સંતોનાં એક રૂઢિનિયમ તરીકે પાસાં સેવ્યાથી કદી પ્રાપ્ત થતી નથી. સંસારમાં કાર્યદક્ષ ગાજાતી બુદ્ધિથી પણ એવી સૂજ મળતી નથી. એ તો અંતરાયરૂપ પણ થઈ પડે, જો એ સંસારી કાર્યદક્ષતાની પ્રાપ્તિ કે ઉપયોગ પાછળ સાધનાની દાણિ રાખ્યા કરી ના હોય તો. એ સૂજ તો સતત, એકધારું કેવળ શુદ્ધ પ્રેમપ્રાપ્તિનું લક્ષ્ય રાખીને તદનુસાર વર્તન કરવાથી ધીમે ધીમે વધારે ને વધારે પડતી જાય છે. વળી, સૂજ પડવી એ એક વાત છે અને તે જીવનમાં ઉતારવી, તેને સાકાર રૂપ આપવું તે બીજી વાત છે. આપણે ઘણાયે એવા પંડિતો જાઇઓએ છીએ કે જેઓ વેદવેદાંતમાં ખરેખર નિષ્ગાત હોય, વાત કરવા બેસે ત્યારે પૂર્ખી ઉપર પગ જ ના રહે, પણ એમનું જીવન વર્તન તો કંઈક બીજું જ બતાવતું હોય. મળેલી સૂજને વર્તનમાં

ઉતારવાનો ખંતપૂર્વક, સાચી નિષાથી પ્રયાસ થાય તો જ નવી નવી સમજણ ઊગતી જાય, અને પેલી નવી સૂજ પ્રમાણેનું જીવન ઘડાતું જાય. આ દણિએ જોતાં પ્રેમપ્રાપ્તિનો આદર્શ કદ્દી પણ પૂરેપૂરો તો વર્તનમાં ઉતારી શકાય નહિ, અથવા એમ કહો કે તે આદર્શની ફલસિદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે માનવી પ્રભુનું કેવળ સર્વ ભાવે યંત્ર બની જાય. આવો માણસ જ સાચો પ્રેમ શું તે સમજે છે અને તેવો ભાવ ધારણ કરી શકે છે. સામાન્ય રીતે આપણે જેને પ્રેમ કહીએ છીએ અને જે ઉત્કટ પણ દેખાય તેમાં અનેક સેળભેળ તત્ત્વો ભળી ગયેલાં હોય છે. સ્થૂળ વાસનાથી માંડીને પ્રિયજન ઉપર પોતાનો સૂક્ષ્મ પણ જોરદાર કાબૂ રહે એવી ઉંડી ઈચ્છા જેવી કંઈ કંઈ વૃત્તિઓથી ભગેલો પ્રેમ સાચો પ્રેમ નથી. મનુષ્યનું આંતરમાનસ એવી ગૂઢ રીતે વર્તે છે, કે તે મનુષ્યને પોતાની તેની કલ્યાના પણ ઘણી વાર હોતી નથી. જેણે આંતર નિરીક્ષણ સંપૂર્ણ તટસ્થભાવે કરવાની જીવતી ટેવ પાડી હોય તેને જ તે દેખાતું જાય છે. પોતાની સર્વ સુખસગવડોનો ત્યાગ કરતી માતાના ઉત્કટ પ્રેમમાં પણ એ બાળક ‘પોતાનું જ લોહી છે, પોતાનું સર્જન છે’ એવો ઊંડો ભાવ સદાય છૂપી રીતે વત્યા કરતો હોય છે, તેટલે અંશો તે શુદ્ધ નથી, સંકુચિત છે. જગતની ઘણીખરી માતાઓ વાત્સલ્ય પ્રેમમાંથી વિશ્વપ્રેમ પોતાનામાં પ્રગટાવી શકતી નથી, તેનું કારણ આ જ છે. પોતાના જ દેશ કે અમુક સામાજિક આદર્શ માટે પ્રાણપર્ણ કરવા તૈયાર થનારામાં ઉચ્ચ કોટીનો પ્રેમ નથી એમ તો કેમ કહેવાય ? તેમ છતાં એમાં પણ ઘણી વાર વિસ્તૃત અહંભાવ અને પાર્થિવ

માપથી જ અન્ય જનને સમજવાની વૃત્તિ અને દણ્ણિ રહેલી હોય છે અને તેથી ત્યાં રાગદ્રેષની માત્રા પણ ઘડી હોય છે. શુદ્ધ પ્રેમ તો આત્મસ્વરૂપ, પ્રભુસ્વરૂપ છે. એટલે એમાં ક્યાંય આવી પક્ષાપક્ષી ના હોઈ શકે. સંત નરસિંહ મહેતાએ સાચું જ ગાયું છે, કે ‘પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર.’

સાચો પ્રેમ એટલે શુદ્ધતમ વિવેક. સંત કે પ્રભુ સમદદ્ધ છે, તેનો અર્થ એવો છે, કે પેલા સંતના મિત્ર કે શત્રુ ગણાતા હરકોઈ પરત્વે સંત કશી પણ અંતર્ગત રાગદ્રેષની લાગણી વગર તે તેને યોગ્ય ભાવે રાખે. ‘શત્રુ’નું શત્રુત્વ સંતને ક્ષોભ પમાડી શકતું નથી, કેમ કે સંતનો ભાવ આવા આધાત સામે પ્રકૃતિને વશ રહેનારથી થતા પ્રત્યાધાતવાળો નથી, પણ પોતાના જે રીતના વર્તનથી સામા માણસનું આત્મંતિક શ્રેય થાય તે રીતનો ભાવ સંત આવા આધાતો પ્રત્યે રાખે છે. ‘યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજાય્યહમ्’નો અર્થ મારી દણ્ણિએ આ છે. તેથી જ સંત, સંસારમાં રચીપચી રહેલા તરફ જે ભાવ રાખે છે તેના કરતાં અનેકગણો વધારે ભાવ તે, સાધક પ્રત્યે રાખે છે. સમદદ્ધિ એટલે નિર્લિપ દણ્ણિ. આવી વિવેકભરી સમદદ્ધિ સાચા પ્રેમને જ સૂજે છે, અને એ જ રાખી શકે છે. સામા માણસના આંતરસત્ત્વ (Inner Being)ને પારખીને જેમ વૈદ્ય પ્રત્યેક દરદીને તેની તેની પ્રકૃતિ અનુસાર જુદી જુદી દવા આપે છે, તેમ તેની પ્રત્યે તે કલ્યાણ માર્ગ કંઈક તો પ્રગતિ કરે એવો શુભાશય સદાય રહે અને તે પ્રમાણો વર્તન થાય, એ તો સાચો પ્રેમ જ કરી શકે. એ શક્તિ કંઈ જટ મળી જાય એવી

નથી, એને માટે પોતાના આંતરમાનસની સંપૂર્ણ શુદ્ધિની જરૂર છે. પ્રેમ વિકસનો જાય છે તેમ તેમ આ શુદ્ધિ થતી જાય છે.

આંતરશુદ્ધિને માટે કદાચ ઉત્તમમાં ઉત્તમ સાધન પ્રેમની ઉપાસના છે, કેમ કે પ્રેમ જેટલી સમજણ આપે છે, એટલે કે પ્રેમથી જેટલી જ્ઞાનપ્રાપ્તિ થાય છે, તેટલી બીજા કશાથી નથી થતી. માત્ર એ પ્રેમભાવ ભાનપૂર્વક, હેતુપૂર્વક કેળવવો જોઈએ અને એ ભાવ અને લાગણી કે આવેગ વચ્ચે શો ભેદ છે, તેનો ખ્યાલ આંતરનિરીક્ષણ કરી કરીને મેળવતા રહેવું જોઈએ. બાળકને મા કે પતિને પત્ની જેટલાં સમજ શકે છે તેટલું કોઈ અન્ય જન નથી સમજ શકતું એનું કારણ પ્રેમ જ છે. કોઈ પણ વિષય, ભૌતિક કે આધ્યાત્મિક, હસ્તગત કરવો હોય તો પ્રથમ જરૂરિયાત તો એ વિષયમાં રસ હોવો જોઈએ. આ ‘રસ’ એટલે પ્રેમ નહિ તો બીજું શું ?

આથી, પ્રેમ એટલે જ્ઞાન. પ્રભુનું જ્ઞાન મેળવવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ અનિવાર્ય સાધન છે, અને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ જ્ઞાન એ તો પર્યાયવાચક શર્ષ્ટો થઈ રહે છે. સૂક્ષ્મ દેહમાં અને તે પછી સ્થૂળ દેહમાં શિરાએ શિરામાં શુદ્ધ પ્રેમનું તત્ત્વ વસે નહિ, ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન પણ ના થાય, અથવા પ્રેમના સંપૂર્ણ આવિર્ભાવ માટે તો જીવન પ્રેમમય થાય એવો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે પ્રત્યેક કર્મ-મન, વાણી, દેહનું-એ પ્રેમને ખાતર થવું જોઈએ. આમ, કર્મયોગ પણ જ્ઞાનયોગની માફક પ્રેમયોગ કે ભક્તિયોગનો પર્યાયવાચક શર્ષ્ટ થઈ રહે છે. તેવી જ રીતે કોઈ પણ વિષયમાં રસ ઉત્પન્ન થાય તો તેમાં આપણું ચિત્ત આપોઆપ એકાગ્ર થાય છે. તેથી પ્રેમયોગ,

ધ્યાનયોગ પણ છે. આમ, શાસ્ત્રમાં વર્ણવાયેલા ચારે માર્ગો આ દણિએ જોતાં એક જ છે.

જ્યારે આવો પ્રેમ પ્રગટે છે ત્યારે આપોઆપ સમર્પણ થયા જ કરે છે, પણ તે આનંદથી. પોતે કંઈ ત્યાગ કે બલિદાન કરે છે, એ વૃત્તિ પણ પ્રેમની કચ્ચાશ બતાવે છે. આનંદપૂર્વકનું સમર્પણ એ તો પ્રેમનો સ્વભાવ છે, પણ સાચો પ્રેમી તો એના સ્વભાવનો ઉપયોગ પણ જ્ઞાનપૂર્વક, ભાનપૂર્વક કરે છે, તો જ તે પ્રિયજનનું અને પોતાનું કલ્યાણ કરી શકશે. પછી તો ‘પ્રિયજન’ અને ‘પોતે’ એમ જુદાં પણ રહેતાં નથી.

ધરણા લોકો એમ માને છે, કે સાચો પ્રેમ તો પોતાના આત્મકલ્યાણની દણિ પણ ના રાખે અને કેવળ પોતાના પ્રેમપાત્રના જ ભલાની વૃત્તિ રાખે. આ માન્યતા દેખીતી રીતે ઘણી ઉચ્ચ ભાવનાવાળી લાગે છે, પણ જરા ઊંડો અનુભવ કરતાં માલૂમ પડશે કે જેનામાં આત્મકલ્યાણની દણિ હોતી નથી, તેને અન્યનું કલ્યાણ કરવાની દણિ નથી. તે અન્યનું કલ્યાણ કરવાની વૃત્તિ જ સદાય રાખે છે એમ પોતે ભલે માને, પણ બરી રીતે તો કોઈ ઊંડો સ્વાર્થ, ખૂબ ઊંડો-એટલે કે ઝટ ના દેખાય એવો-પણ જરા વિસ્તૃત અહંકારથી જ તે પ્રેરાતો હોય છે. કયા વર્તનથી કે ભાવથી સાચી સેવા થશે એ સૂજવું કંઈ બાળકના ખેલ નથી. એમાં તો સર્વતોમુખી અને નિર્વિષ્ટ દણિની જરૂર છે. નહિ તો જેને આપણે અન્યનું કલ્યાણ માનતા હોઈએ તે તેનું અકલ્યાણ પણ હોય. આવી દણિ કેળવવા અને મેળવવા માનવીએ આંતરનિરીક્ષણ વગેરે સાધનોથી પોતાની આંતરશુદ્ધિ માટે પ્રયાસ કર્યા કરવો જ

પડશે. એટલે કે ચિત્તશુદ્ધિ કે આત્મકલ્યાણના હેતુથી જ પ્રેરાઈને સર્વ કર્મો કરે તો જ આવી દાખિ પ્રાપ્ત થાય.

આવી જ રીતે ઘણા એમ માને છે, કે ‘બીજાની સેવા’ એ જ માનવી જીવનનો ઉત્તમોત્તમ આદર્શ છે અને આત્મકલ્યાણ તરફ વૃત્તિ રાખવી તે ઉત્તરતા પ્રકારનો આદર્શ છે. એમાં પણ પોતે જેને સેવા માને છે તે જ જગતની સેવા, તે સેવા, બીજી નહિએવી જ્ઞાણી અજ્ઞાણી અપૂર્ણ સત્યવાળી પણ દૃઢપણે ટેવાયેલી માન્યતા જ કારણભૂત છે. સાચા સ્વાનુભવમાં જેમ સર્વાનુભવ આવી જ જાય છે, તેમ સ્વકલ્યાણની પ્રવૃત્તિમાં સર્વકલ્યાણની પ્રવૃત્તિ આપોઆપ થયા કરે છે. આમ, સ્વકલ્યાણની પ્રવૃત્તિ કરનારમાં વિશ્વપ્રેમ નથી એટલે કે તે સાચો પ્રેમ નથી એવી માન્યતા ભૂલભરેલી છે. સ્વકલ્યાણની પ્રવૃત્તિ એ એક જતના સ્વાર્થની પ્રવૃત્તિ છે એમ જે કોઈ કહે છે, તેમને આવી જતના નિઃસ્વાર્થ પ્રેમના તત્ત્વજ્ઞાનની કે તેના અનુભવની કશી જ ગતાગમ હોતી નથી.

આમ, પ્રેમ એ તો પ્રલુનો પયગંબર પણ છે અને પ્રલુ જાતે જ છે. સાધના છે અને સિદ્ધિ છે. દૈત છે, અદૈત છે અને તેથી પર પણ છે. સંપૂર્ણ બંધન તથા સંપૂર્ણ મુક્તિ એટલે પ્રેમ. આખું વિશ્વ એમાં સમાયેલું છે. તેની ઉત્પત્તિ પ્રેમથી થઈ છે, તે પોષણ પામે છે પણ પ્રેમથી અને તેનો લય પણ પ્રેમમાં જ થાય છે. એવું કશું જ તત્ત્વ સૂચિમાં નથી કે જેમાં પ્રેમનો અંશ પણ ના હોય અને જેને પ્રેમ પોતાનામાં સ્વીકારી લેતો ના હોય. વિકૃત સ્વરૂપમાં ભલે હોય, પણ જ્યાં ત્યાં પ્રેમ જ છે. વિકારવૃત્તિ પણ માનવીમાં ત્યારે જ ઉદ્ભવે છે, કે જ્યારે

કોઈ પ્રિયજન કે પોતાની સંસ્થા એને અણગમતી રીતે વર્તે,
એટલે એ તો કેવળ પ્રેમની વિકૃત દશા જ છે.

સર્વત્ર છાયેલી આ પ્રેમની ‘જલક’ કે જેથી ગગન, પર્વતો,
નદીઓ આદિ છવાઈ રહેલાં છે, એ પ્રેમની ભવ્ય જલક આ
કાગળથી અણુમાત્ર પડા વધારે છવાય એ જ પ્રાર્થના છે.’*

હાર્દિક આશ્રમ,

- મોટા

અમરેન્દ્રપુરમું અગ્રાહરમું

મેલે-કાવેરી, કુંભકોણમું (દક્ષિણ ભારત)

તા. ૨-૮-૧૯૭૩

॥ હરિ:ઊ ॥

નિવેદન

(પહેલી આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટાનું ‘પ્રેમ’ પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ થાય છે. પૂજ્ય શ્રીમોટાએ એમનાં સ્વજનોને પત્રોરૂપે પદમાં પ્રેમ વિશે ધણું સમજાવેલું છે. ‘પુનિત પ્રેમગાથા’ એ નામથી એ બધું લખાશ ગ્રંથસ્વરૂપે સંવત ૨૦૦૭ના ગુરુપૂર્ણિમાના શુભ દિને પ્રગટ થયેલું, પરંતુ આ પુસ્તકમાં ‘પ્રેમ’ વિષયક સીધું અને સરળ નિરૂપણ સૌ પ્રથમ વાર જ થયું છે. એથી આ પુસ્તકનું મૂલ્યાંકન પૂજ્ય શ્રીમોટાએ રચેલાં ‘જિજ્ઞાસા’, ‘શ્રદ્ધા’ વગેરે પુસ્તકોની શ્રેષ્ઠીમાં થઈ શકે. પૂજ્ય શ્રીમોટાની આ રચનાઓ શ્રેયસાધકને પ્રેમમાર્ગની વાસ્તવિકતાનો સચોટ પરિચય કરાવશે એની અમને ખાતરી છે.

આ પુસ્તક છપાવી પ્રકાશન કરવાનો બધો ખર્ચ ડોક્ટર સુવર્ણાબહેન એસ. કાપડિયાએ અને શ્રી શાંતિલાલ કાપડિયા પરિવારે આપ્યો છે. એટલે આ પુસ્તક પ્રકાશનમાં નિમિત્ત બનવા માટે તેઓ સૌનો હરિ:ઊં આશ્રમ તરફથી ધણો ધણો હાર્દિક આભાર માનીએ છીએ.

પૂજ્ય શ્રીમોટાએ આ રચનાઓ પોસ્ટકાર્ડમાં લખેલી. એની નકલ કુમારી અચ્યલાબહેન પ્રતાપભાઈ ઉપાધ્યાયે કરેલી. આ ગજલોને કમમાં ગોઠવવાનું તથા એને શીર્ષક આપવાનું કાર્ય શ્રી રમેશભાઈ ભાડે કરી આપ્યું છે. શ્રી પુષ્પાબહેન દલાલે સુવાચ્ય અક્ષરે આ પુસ્તકની પ્રેસકોપી તૈયાર કરી આપી છે. આ સર્વ આશ્રમની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હોવાથી એમનો આભાર માનવાની ઔપચારિકતા

કરતા નથી, પણ એમના સદ્ગુરૂભાવભર્યા સહકારની સહર્ષ નોંધ લઈએ છીએ.

પૂજ્ય શ્રીમોટાનાં અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તક પણ પૂરી કાળજી અને ચીવટ છીતાં ત્વરાથી છાપી આપવા બદલ અમે મેં એલેક્ટ્રિક પ્રેસ, વડોદરાના ઘણા જ આભારી છીએ.

જિજ્ઞાસુઓ તથા અન્ય વાચકો પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકો ખરીદીને વાંચે એવી વિનંતી છે. પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તક વેચાણની સંપૂર્ણ આવક લોકકલ્યાણનાં કાર્યો પાછળ જ ખરચાય છે.

અમને શ્રદ્ધા છે, કે પૂજ્ય શ્રીમોટાનાં અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તકના વેચાણમાં વેગ આવશે.

નાના

૨૫ સપ્ટેમ્બર, ૧૯૭૩

નંદુભાઈ

વ્યવસ્થાપક ટ્રસ્ટી,
હરિઃઉં આશ્રમ, નાના

નિવેદન (બીજ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટા વિરચિત સાહિત્યમાં ગદ અને પદ બંને પ્રકારનો સમાવેશ થાય છે. પદમાં પણ અનુષ્ઠપ ઇંદની રચનાઓ સવિશેષ. પૂજ્યશ્રીએ પોતે જણાયું છે, કે પદ લખવાનું તેઓને વિશેષ ફાવે છે, કારણ કે તેમાં આખી વાતનો મર્મ સહેલાઈથી સમજાવી શકાય છે. આ પુસ્તકના અભ્યાસની શરૂઆતમાં વાચકને પૂજ્ય શ્રીમોટાએ લખેલ ‘લેખકના બે બોલ’ વાંચી જવા અત્યંત નમ્ર વિનંતી છે. અહીં પ્રેમ તત્ત્વની સરળ સાઢી ભાષામાં સમજ પૂજ્યશ્રીએ આપી છે. જેને આપણે પ્રેમ ગણીએ છીએ તે આપણો ભ્રમ અને ગેરસમજ હોઈ શકે. પૂજ્ય શ્રીમોટાની આ રચના આપડી આંખ ઉઘાડનારી છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય શ્રી જયંતીભાઈ જનીએ પૂરા સદ્ગ્રાવથી, ખંતથી અને ચોકસાઈપૂર્વક કર્યું છે, તે બદલ અમો તેમના ખૂબ આભારી છીએ.

સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિજ્ઞુપ્રસાદ પંડ્યાએ પૂજ્ય શ્રીમોટા પ્રત્યેના ભક્તિભાવથી આ પુસ્તકનું મુદ્રણ કરી આપ્યું છે. તેઓશ્રીના આવા અમૂલ્ય અને ઉદારતાભર્યા સહયોગના કારણે જ પૂજ્ય શ્રીમોટાનો અક્ષરદેહ ધડી ઓછી કિંમતે સમાજચરણે મૂકી શકીએ છીએ. શ્રી શ્રેયસભાઈ પંડ્યાના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

પૂજ્ય શ્રીમોટાનો ૧૧૫મો જન્મદિન
ભાદ્રવા વદ ચોથ, સં. ૨૦૬૮
તા. ૪-૧૦-૨૦૧૨

દ્રસ્ટીમંડળ,
હરિઓં આશ્રમ, સુરત

હરિ:ઓ

અનુક્રમણિકા

ક્રમ ખંડ		પૃષ્ઠ નંબર
૧.	પ્રેમનો પ્રદેશ	૧
૨.	પ્રેમપ્રવેશ	૧૧
૩.	પ્રેમની કળા	૪૫
૪.	પ્રેમરૂપ	૧૦૫
૫.	પ્રેમરસ	૧૫૦
૬.	જાંખી	૧૭૪
૭.	દિલ	૧૮૮
૮.	દંડ	૨૩૩
૯.	સ્પર્શ	૨૪૩
૧૦.	પ્રેમલીલા	૨૪૯
૧૧.	હરિદર્શિન	૩૦૦

પ્રેમ
□
પૂજય શ્રીમોટા

‘હું સર્વત્ર વિદ્યમાન છું.’

‘જીવન દર્શન’, ૧૧મી આ., પૃ. ૪૩૧

- શ્રીમોટા

કાર્યાલય

ખંડ - ૧

પ્રેમનો પ્રદેશ

પૂરી ધરખમ ખુવારીનો પ્રદેશ જ પ્રેમનો શો તે !
પળેપળ ત્યાં જ ખુવારી, ખુવારી મસ્ત ઝળકે છે.

કારિઃકુ

પળેપળ ત્યાં જ ખુવારી

અરે ! સંસારી ઓ લોકો ! કરો કાં પ્રેમની વાતો ?
હદ્ય ઉત્સાહ ધસમસતો કહી છે મસ્ત ઊછળતો ?

નયાં સંસારના કાદવ વિશે ગરકાવ પૂરાં છો,
પછી શું ખાલી ખાલી તે કરો વાતો નકામી શા !

પૂરા સંસારના સ્વાર્થે રચેલાં ને પચેલાં છો,
પછી કાં ઠોકતાં રહો છો, નરી ઊંફાસ પ્રેમની તો !

પૂરી ધરખમ ખુવારીનો પ્રદેશ જ પ્રેમનો શો તે !
પળેપળ ત્યાં જ ખુવારી, ખુવારી મસ્ત ઝળકે છે.

હરિઃકુ

તપશ્ચર્યા ખચીત ત્યાં છે !

અરે ! સંસારી ઓ લોકો ! કરો કાં પ્રેમની વાતો ?
ઉછળતા ને ધબકતા દમ વિનાનું કાં તમે હાંકો ?

સમર્પજા ને ફનાગીરી, પૂરું હોમાઈ જવાનું જે
-પળેપળનું જીવનમાં જો, તહીં શો પ્રેમ શોભે છે !

હદ્યનો પ્રેમ ને ત્યાગ સહજ દિલભાવથી જે છે,
પૂરી ભરપૂર રસથી શી તપશ્ચર્યા ખચીત ત્યાં છે !

હદ્યનો પ્રેમ ઓગળીને પૂરેપૂરો થઈ શૂન્ય
-મળી, ભળી ને ગળી જઈને થતો છે આપ શો ધન્ય !

હરિઃકુ

બધું જે તે હરિકેરું

ઉપરનો સર્વ વ્યવહાર જીવનમાં ચાલતો જે છે,
‘હરિ જાણે ન તેમાં હો’, બધું તે તેમ લાગે છે.

ઇતાં જે થાય વ્યવહાર હરિની શક્તિ પાછળ છે,
ન એને કોઈ જાણે છે, ઇતાં પોતે રહ્યો ત્યાં છે.

બધા વ્યવહારમાં બુદ્ધિ, મનાદિ જે પ્રવર્તે છે,
બધાં તે ઉપજાવેલાં કઢી ના માનવીથી જે.

બધું જે તે હરિકેરું, હરિ વિના કશું ના છે,
ઇતાં જાણે ન હો પોતે, નિરાળો તેમ વર્તે છે.

કારિઃઅં

કળા તે દિવ્ય ને સૂક્ષ્મ

સકળ બ્રહ્માંડમાં અદ્ભુત શું આકર્ષણ ગજબનું છે !
પરસ્પરમાં, પરસ્પરથી પરસ્પરનું ખરેખર છે !

કળા તે દિવ્ય ને સૂક્ષ્મ અદીઠ શી જે હરિની છે !
શું જડ ચેતન બધાં સાથે હૃદય સંકળાવી રાખે છે !

સકળ બ્રહ્માંડ પ્રત્યક્ષ શું આકર્ષણથી તેવા તે
-ગતિશીલ ભવ્ય સક્રિય જીવંતું સર્જનાત્મક છે !

શી આકર્ષક કળાથી તે થતાં સર્જન જતું છે તે !
હરિની તે જ પ્રત્યક્ષ જીવંતી હાજરી શી છે !

કારિ: ઊં

હરિ પ્રત્યક્ષ પોતે છે

અખંડિત ભાવ મદજરતો સહજમેળે વહેતો જે,
સ્વરૂપ શું સૂક્ષ્મ ભાવાત્મક હદ્યનું તે જ સાચું છે !

હદ્ય ના સ્થૂળવાચક છે, હદ્ય તો ભાવવાચક છે,
હદ્ય દરબાર હરિનો છે, કચેરી શ્રીહરિની તે.

નિરાકાર હદ્ય પોતે છતાં જ્યારે અખંડિત તે,
સહજ જ્યાં ભાવ જીવંતો, હદ્ય સાકાર પ્રત્યક્ષે.

નિરંતરનો અનુભવમાં સહજ જ્યાં ભાવ જીવતો છે,
બિરાજેલો હદ્ય ત્યારે, હરિ પ્રત્યક્ષ પોતે છે.

કારિઃકું

અખંડિત પ્રેમનું જરણું

હદ્ય પાસે, હદ્યથી થઈ, હદ્યમાં તે શમાવાને,
હદ્યની સૌ રમત તે છે, હદ્યની શી કળા તે છે !

હદ્ય પ્રવેશવા કાજે, હદ્યભાવ મહત્વે જે,
જીવન વ્યવહારમાં સર્વ રહે જ્યાં મોખરે નિત્યે.

અખંડિત ભાવ જ્યારે તે નિરંતરનો વહેતો છે,
હદ્ય ત્યારે જડી આવે, મળેલું અનુભવાયે છે.

અખંડિત પ્રેમનું જરણું સહજ ને જે સતત વહે છે,
ખરેખર ભાવ એવો જે ‘હદ્ય’ સાચું પ્રમાણે તે.

કારિ: ઊં

નગદ રોકડ શું પુરુષાર્થ !

મહત્ત્વાયુક્ત છે કેવા નગદ રોકડ શું પુરુષાર્થ !
પુરુષાર્થ થકી કેવા ચહેલા કેટલા લોક જ !

પુરુષાર્થ થવાકેરી રહેલી શક્તિ છે દિલમાં,
વિના લાગ્યા પરંતુ દિલ ન શક્તિ કામ આવે ત્યાં.

જીવન પ્રત્યેનો દિલ પ્રેમ ખરેખર જ્યાં ભભૂકે છે,
સમગ્ર શક્તિ પુરુષાર્થે શું જોડાવી જ તે દે છે !

ખુમારી ને ફનારીરી, સમર્પણ ને બલિદાન
-સહજ ફોર્યા કરે તે તે હદ્યની પ્રેમશક્તિથી.

બિયાબાંમાંથી જીવનને બગીયો સ્વર્ગ બનવે છે,
હદ્યના પ્રેમની શક્તિ અનુપમ બેનમૂન શી તે !

કારિ: ઊં

ઇડી તો પ્રેમ પોકારે

સમર્પણ ને બહિદાન વળી તપ, ત્યાગથી જીવને
-જીવનની લાગતાં ભક્તિ, ફૂટી શો પ્રેમ નીકળે છે !

ખરેખર પ્રેમનાં દ્વાર ઉઘાડેચોક ખૂલ્લાં છે,
કશી ના રોકટોક જ છે, કશીક જે હોય, નિજની છે.

જતો છે આરપાર જ તે, કશે અટકી પડે ના તે,
જવું સંસરવું ધારેલા નિશાને, પ્રેમ જાણે છે.

ખૂલ્યા દરભારની કેવી ઇડી તો પ્રેમ પોકારે !
નવાજે છે લળી લળીને હૃદય તે મસ્ત તત્પર છે.

કારિઃઅં

પચવશે પ્રેમ હરિનો તે

જીવનમાં પ્રેમનો રંગ કદીક કો'ને જ લાગે છે,
ખરા બડભાગી સજ્જન તે હરિના લાડીલા શા છે !

હરિને જે વરેલા છે, હદ્યનો પ્રેમ મહાવે તે,
જગતનો પ્રેમ ગરબદિયો, ન જેનો અર્થ કેં પણ છે.

હરિની પ્રેમરંગતને સમજુ શકવા જ સંસારી
-કદી ના યોગ્ય પાત્ર જ છે, વરે કો ભક્ત વિરલા જે.

હરિ દરબારનો પ્રેમ અતીત સંસારથી જે છે,
ખરેખર માત્ર જે એવો પચવશે પ્રેમ હરિનો તે.

કાર્યાલય

ખંડ - ૨

પ્રેમપ્રવેશ

સમજવા પ્રેમ દિલનો તે ન ગુજરાત બધાંની છે,
નય્ય સંસારના જીવ ન અધિકારી સમજવાને.

કારિઃકું

સતત ચિંતવન વિશે રસ છે

સમજવા પ્રેમ દિલનો તે ન ગુંજાશ બધાંની છે,
નર્ય સંસારના જીવ ન અધિકારી સમજવાને.

પળેપળ દિલ સમર્પણ છે, ચરણ ન્યોદ્ધાવરી પણ છે,
જઈને વારી વારી દિલ, સતત ચિંતવન વિશે રસ છે.

ન પળ વાર વિખૂટોયે થઈ શકતો હૃદયથી તે,
સહજ સંલગ્ન દિલમાં છે, શું એકાકાર આધારે !

સતત બસ ગાંડપણ એને હૃદયમાં મસ્ત લાગ્યું છે,
નશે ચકચૂર ભરપૂર તે હૃદયના પ્રેમમાં જે છે.

કારિઃઅં

ચમત્કારિક રસામૃત તે

જીવનમાં પ્રેમ જામે જ્યાં હદ્ય લારે જ પીગળે છે,
પિગાળીને ભીતરનું જે, ચમત્કારિક રસામૃત તે.

જીવનના પ્રેમના માર્ગી ઘવાયાં કેટલાંકેયે,
સીમા સ્તંભ થઈ જઈને દટાઈ શાં ગયેલાં છે !

ભયંકર શાં ઘવાયાં છે ! છતાં ના છંદ છૂટ્યા છે,
ચઢ્યાં શાં કોસ પર તેવાં ! છતાં છેડો ન ફાડ્યો છે.

રખડી એવાં પડેલાં શાં ! કંઈક લટક્યાં જ અધવચ્ચે,
ચઢેલાં ફાંસી પર કૈ કૈ, છતાં ના પંથ મૂક્યો છે.

શહૂર, મર્દાનગી, સાહસ, ધીરજ, હિંમત, ખમીર દિલ જે,
પરીક્ષા સૌ ગુણોની ત્યાં થતી રહેતાં, ખીલે છે તે.

કારિ: ઊં

હદ્ય રસ પ્રેમ પીવાને

હદ્ય ઉત્કર્ષ જબ્બર છે, અગન જેવી પિપાસા છે,
મિલાવી દિલને દિલથી, હદ્ય રસ પ્રેમ પીવાને.

હદ્ય આતુરતા એની સહજ જવાળામુખી સમ છે,
શી તડપન આગ લાગી છે, રૂવે રૂવે જલંતી છે !

સતત બસ પ્રેમની માત્ર હદ્ય શી ઝંખના એને !
ન કંઈ તે ઝંખના માત્ર, હદ્ય સાકાર લેતી છે.

થતાં તે ઝંખના ગાઢ, નિરંતરની થતી રહેતાં
-શિખર તે ઉચ્ચમાં ઉચ્ચ ચઢી, દિલ એક બનતી ત્યાં.

કારિ: ઊં

બધું નિજરૂપ ઠરવે છે

જીવનમાં લગની લાગી છે, જલન અજીની પેઠે જે,
કદી ના ઓલવાતી છે, સતત ભડભડતી જલતી છે.

ખૂણેખૂણા પ્રકાશીને કરી અજવાળું તે દે છે,
કશો કંઈ અંધકાર જ ના જરા સરખોય રહેવા દે.

સફાયટ સર્વે જે તે-ને બરાબર સ્વચ્છ બનવે છે,
જલાવીને, જલાવીને બધું નિજરૂપ ઠરવે છે.

બધે જ્યાં ત્યાં જ પ્રસરીને પૂરું પકવ બનાવી દે,
ભીનું ભીનું બધું રસથી નર્ધુ તરબોળ કરી દે છે.

કારિ: ઊં

હદ્યનો પ્રેમ પ્રસરે છે

હદ્યના પ્રેમના જેવું બીજું કોઈ ન જાડુ છે,
કશું કોઈ ન આકર્ષણ, હદ્યના પ્રેમ તોલે છે.

ભયંકર કેવું આકર્ષણ હદ્ય જીવલોણ નીવડે છે !
જીવનના તે સકળ બંધ કરી ભૂકો જ નાખે છે.

થયા વિશ્વ નગન સંપૂર્ણ ન હૂંકડે પ્રેમ આવે છે,
હદ્યનો પ્રેમ તો ખુલ્લું બધી રીતે કરાવે છે.

જીવનનાં રોમરોમે શો હદ્યનો પ્રેમ પ્રસરે છે !
પ્રસરતાં નિજનો ઉંડો પ્રભાવ જ પાડતો રહે તે.

કારિઃકું

હદ્યના પ્રેમની પ્રાપ્તિ

સ્મરણ કરતાં, સ્મરણ કરતાં, સ્મરણ લેવાનું બનિયું છે,
સ્મરણ લેવાથી તેનો શો સહજ સંબંધ દિલથી છે !

હદ્ય સંબંધ એવા તે હરિહરના હદ્ય ગમ ત્યાં
-જવાને યજ્ઞ માંડ્યો છે, પૂરું હોમાઈ જવા શું ત્યાં !

પળેપળનું જ હોમાવું કૂપાથી તે થયેલું છે,
ભયંકર તે મુસીબતથી બચાવી, માર્ગ ચીંઘ્યો છે.

ધળી ધીગો હરિ માથે સદા ગર્જત બેઠો છે,
હદ્ય વિશ્વાસ એવાથી શું યજ્ઞ આદરેલો છે !

ચીંઘેલાં કર્મમાં તેઓ વફાદારીની દાનતથી,
દટાઈ તે જતાં પૂરાં ખરેખર ધન્ય તેવાં છે !

હદ્યના પ્રેમની પ્રાપ્તિ થયેલા યજ્ઞ એવાથી,
કૂપાથી જે જીવન થઈ છે, જીવનની ખુશનસીબી શી !

કારિઃઊં

સ્વરૂપ સાચું ખરેખર તે

સ્મરણ લેતાં, સ્મરણ લેતાં, ચડસ ધૂન મસ્ત લાગ્યાં છે,
હદ્યની ધૂનથી તેવી ચરણનું લક્ષ્ય લાધ્યું છે.

ચરણ ના સ્થૂળવાચક છે, ચરણ તો ભાવવાચક છે,
હરિના ભાવનું કેવું પ્રતીક પોતે ચરણ શાં છે !

ચરણની લગનીથી ભક્તિ જીવનમાં તે ફૂટેલી છે,
અને તેને લીધે ભાવ જીવનમાં ઊળી નીકળ્યો છે.

સતત તે ભાવ ફૂલમાંનો પરાગ જે ઝરંતો છે,
હદ્યના પ્રેમનું વ્યક્ત સ્વરૂપ સાચું ખરેખર તે.

કારિ: ઊં

નશીલી શી મજા ન્યારી !

જીવનનો સ્વાદ જાણ્યો છે, જીવનનો સ્વાદ માણ્યો છે,
જીવનનો સ્વાદ ચાખ્યો છે, જીવનનો સ્વાદ મહાલ્યો છે.

રસામૃત એ જ જીવન છે, ખરેખર પદ્કમળનું જે,
અગીરથ તપ, તપશ્ચર્યા થકી પણ કેવું દુર્લભ તે !

ભજન, કીર્તન થતાં ભાવે જીવન અખંડતા જેની
-પ્રવર્તી જ્યાં ગયેલી જે, નશીલી શી મજા ન્યારી !

હદ્યનાં પ્રેમ મહોબતની લહેજત ત્યારની જે છે,
રસીલો પાત્ર જે કો'ક ચરણ બડભાગી મહાલે તે.

કારિ: ઊં

ગજું બાકી બીજાંનું ના

હરિનો ભક્ત તે પ્રેમ હદ્ય પકવી જ જાણે છે,
ગજું બાકી બીજાંનું ના, બીજાં શાં છેરી નાખે છે.

હદ્યના પ્રેમના ભક્ત, જીવનમાં કેટલી વાર
-ચઢીને ફાંસીએ ગરદન કપાવી નાખતા પદ પર.

થતાં ખુવાર સંપૂર્ણ નશો મદભર ચઢે જેને,
હદ્યથી પ્રેમની ભક્તિ શૂરી તેને વરેલી છે.

પળેપળની ખુવારીમાં, ખુમારીનો નશો એને
-ચઢે કેવો અનુપમ જે ન સંસારી કદી જાણે !

કારિઃકું

અમે તે પ્રેમ ગાયો છે

જીવનમાં કેટલી કેવી કસોટી આવી આવીને,
મથામણ શી કરાવીને, પરીક્ષા તો અપાવી છે !

જીવન વિકસાવવા અર્થે હદ્ય નિશ્ચય થયેલો જે,
ફલિત તેમાંથી નીપજેલો શું તે પ્રેમ જીવન પરનો !

થતો કેવો રહેલો છે, જીવનનો પ્રેમ વિકસિત જે !
ચઢેલો ઉતારોતાર શો પગથિયે છેક તે ઊધર્એ.

ગાગનાતીત શો પ્રેમ ! અમે તે પ્રેમ ગાયો છે,
જીવનના પ્રેમના કેવા હદ્ય મસ્તાન અવધૂત જે !

કારિઃકું

હદ્યના પ્રેમને કાજે

હદ્યનાં મોકળાં દ્વાર, હદ્યના પ્રેમને કાજે,
થવા ખુલ્લું જીવનમાં તો, હદ્ય મથવું પડેલું છે.

હદ્ય મોજલી તત્પરતા ચૂકવવા શી જીવનની છે !
જીવનમાં ચેતનાત્મક તે જણાયા વિજ્ઞા શેં રહેશે !

હદ્ય ન્યોછાવરી ભાવે, સમર્પજા હર્ષ ઉમળકે
-થવાનું પદ પળેપળ છે, ‘જીવનનો ભસ્ત લહાવો તે.’

થતા રહેતા સદા એવા અનુભવમાંથી જીવન તે,
ફળ્યા કરતું નૂતન, નૂતન, વળી મૌલિકતા વિશે.

કારિ: ઊં

ઇલોછલ દિલ ઇવાયું છે

ટપકતો ભાવ હૈયાનો જીવનની લક્ષ્મી સાચી તે,
સતત દિલ લક્ષ્યધારી તે, હદ્ય મથવાનું રાખ્યું જે.

સ્મરણ, કીર્તન, ભજનભાવ, નિવેદન ને સમર્પણ તે
-હદ્યની પ્રાર્થનાદિથી સ્રુતંતો ભાવ લાગ્યો છે.

સ્રુતેલાં ગૂઠ સાધનમાં મચેલો સાધનાભ્યાસે,
હરિપદના રસામૃતથી, ઇલોછલ દિલ ઇવાયું છે.

હદ્યથી વહાલ કરવાને હરિને, કર્મ મુજ જે તે
-પ્રભુપ્રીત્યર્થનાં સઘળાં, સમર્પણ પુષ્પ હરિપદ છે.

કારિ: ઊં

શું સર્વોત્તમ રસીલું છે !

હદ્ય અનુરાગ દઢ બનતાં ઊંડી આસક્તિ લાગી છે,
હદ્ય આસક્તિ દઢ થાતાં વ્યસન તેમાંથી જન્મ્યું છે.

વ્યસન દિલ લાગતાં પૂર્ણ વ્યસન વિના ન ચાલે છે,
વ્યસનની મસ્ત બલિહારી, વિરલ કો ભક્ત પીછે છે !

વ્યસનનો ભક્ત એવો જે, ગુલામ ના વ્યસનનો છે,
વ્યસન તો પ્રેમભક્તિનું શું લક્ષણ ઉત્તમોત્તમ છે !

વ્યસનનો સ્વામી જે માત્ર, વ્યસન ઉપયોગ કરી શકશે,
બીજા જીવો વ્યસન હાઈ કદી સમજ ન દિલ શકશે.

હદ્યનો પ્રેમનો ભાવ જીવન જગત થતો જ્યાં છે,
બધું પરિણામ પ્રેમનું તે શું સર્વોત્તમ રસીલું છે !

કારિ: ઊં

હદ્ય પદ બૂમ પાડે છે

લગાડી પ્રીત દિલ ઊંડી મનાદિને પલાળીને
-હદ્ય તારે ઠરાવ્યાં છે, થઈ જઈ મુંઘ તુજ ચરણે.

ભરોંસો દિલ હતો મુજને ‘થવાતાં મુંઘ ત્યાં ચરણે
-હદ્ય આહૂલાદ પામીને શું મળશે સુખ સૂવાને જે !’

લગન ઊંડી ઊંડી તારી હદ્ય ભારે લગાડીને,
હવે તલસાટ પ્રગટાવ્યો હદ્ય અજિન સમો કાં તૈં ?

ન જરવાયે, ન સહેવાયે, સતત આકર્ષણે તુજ તે
-હદ્ય ભાંગી થતું ભૂકો, હદ્ય પદ બૂમ પાડે છે.

કારિઃઅં

હરિ દરબારનો રાજા

હદ્યના પ્રેમને ચરણે, બધું જે તે નિવેદીને
-સમર્પા સૌ કરીને, થતાં ખુલ્લાં શીખ્યાં છીએ.

બધાએ આગ્રહો જે તે શી સમજણ, ટેવ સઘળુંયે !
મડાગાંઠો, મતો જે તે ચરણમાં ઠાલવેલું છે.

હદ્યનો પ્રેમ ખાલી તે રહે ખાલી જ હરદમ જે,
હરિ દરબારનો રાજા, ખરેખર પ્રેમ પોતે છે.

હદ્યના પ્રેમમાં ઉત્કટ ઊંડો તલસાટ સળગો છે,
જરા સરખીય તે વિશે ન સંસારી જ વૃત્તિ છે.

હદ્યના પ્રેમને કાંઈ ન સારું કે ન નરસું છે,
હદ્યના પ્રેમમાં ઐક્ય હદ્યથી માત્ર નીતરે છે.

કરિ: ઊં

મનન, ચિંતવન સતત હૈયે

તવાઈને, તવાઈ શા જીવનના હાલહેવાલ
-ધણા તંગ જ થયેલા છે, નસોમાં લોહી થંભું છે.

હદ્દયના પ્રેમને કારણ હદ્દય તલસાટ જન્મ્યો જે,
નિરાંતે ઊંઘવા ના દે, ન વળવા જંપ પણ દે છે.

મનન, ચિંતવન સતત હૈયે, શું એકનું એક જીવતું છે !
ઠરીઠામ જ બીજામાં તો જરા ના થઈ શકતું છે.

નયનની મીટ ને હૈયું, સતત ખેંચાઈને તીવ્ર
-હદ્દય દિલ દિલ મિલાવીને, થવા શી ઐક્યની નેમ !

કારિ: ઊં

કલાશકિત જ અદ્ભુત છે !

હદ્યના પ્રેમની મસ્ત નરી મદ્દનગી શી તે !
ભયંકર આફિતો સંકટ સહી કેવાં જ લે છે તે !

હદ્ય મળવાતણો કેવો ઉમળકો તો ઉછળતો છે !
હદ્ય ઉત્સાહ, આનંદતણી સેરો શી ઝૂટતી છે !

હદ્ય મળવાની ઉત્કટ જે તમના આગમાં શો તે !
-જલી જલીને જીવન સધણું ખરેખર રાખ બનવે છે !

અને એ ભસ્મમાંથી શો નવો અવતાર જીવન લે !
હદ્યના પ્રેમની એવી કલાશકિત જ અદ્ભુત છે !

કારિ: ઊં

હદ્ય તે ખાતરીમાં છું

હદ્યના પ્રેમને ચરણો જીવન સધળું સમર્પિને,
હદ્યના પ્રેમને પૂરો હદ્ય સંતોષ દેવો છે.

હદ્ય તે રાજી રાજી રહે, જીવનને તે રીતે જીવી,
પળેપળ પ્રેમને પૂરો ખુશાલીમાં જ ધરવો છે.

બધુંયે નામનિશાન જ સમૂળગુંયે ખુદીકેરું
-ભૂંસાઈ તે જવાનું છે, હદ્ય તે ખાતરીમાં છું.

અનુભવી પ્રેમને દિલમાં થવાનું પ્રેમ સ્વરૂપે છે,
જીવનમાં એમ ધારી તે ચરણ પડતું જ મેલ્યું છે.

કારિઃકુ

મહોબતની ગોઠડી

જવનમાં પ્રેમ મહોબતની થયેલી ગોઠડી શી તે !
વખા કેવા પડાવીને શી તોબા પોકરાવે છે !

‘ઉડે ઉડે જવાકેરી જવનમાં તક મળેલી તે’,
કંઈક વેળા જતાં નિષ્ફળ, છતાં તેમાંથી ઊગ્યું જે.

કળા ઉપયોગની જેમાં અને તેમાંથી ગૃહવાની,
મથંતાં ખૂબ, તે ચાવી કૃપાથી હાથ લાગી શી !

ગમે તેવી પરિસ્થિતિ, પછીથી તો ભલે આવે,
છતાં તેમાંથીયે શિક્ષણ મળ્યા કરવાનું અમને છે.

કારિઃઊં

તપશ્ચર્યા જીવનની તે

અમારે દિલ સહેવાનું નિરંતર કેવું આવ્યું છે !
કશી ફરિયાદ કરવાની ન તે વિશે હરિ ! તુજને.

સહેવાનું થતાં હદયે હરિ તુજ યાદ જળકે છે,
સ્કુરાવે તે હદયયાદ અભોલી પ્રેરણા શી જે !

સહેવાનું થતું ભાવે તપશ્ચર્યા જીવનની તે,
સહેવામાં હદય હેતુ કૃપાથી જીવતો રહે છે.

સહેવાનું ઉમળકાથી થતું તે તપ ખરેખર છે,
તવાઈને જીવન તેમાં થતું છે શુદ્ધ સાચું જે.

કારિઃકું

જીવન વ્યવહાર તેથી તો

બનવવા પકવ જીવનમાં, પૂરેપૂરા બધી રીતે
-પ્રસંગો તે પ્રમાણેના, દીધા શા તેં ઘડાવાને !

કૃપાથી ભાન તેનું તો પરત્વે તેની તે રીતે.
-રખાયા તો કરાયું છે, તમન્નાનું જ લક્ષણ તે.

જીવન ચેતાવવા હરિને લગન દિલ તેં લગાડી છે,
હરિ તુજ પ્રેમની તોલે, જગતનો પ્રેમ નહિવતૂ છે.

અમારે જીવવું મરવું જગતની સાથ નિત્યે છે,
જીવન વ્યવહાર તેથી તો હરિભાવે કૃપાથી છે.

કારિઃઅં

હદ્યના પ્રેમને ખાતર

શૂળીએ કેટલી વાર લટકવું તો પડેલું છે,
શી અપરંપાર ધીરજની કસોટી તો થયેલી છે !

થતાં કુરબાન સંપૂર્ણ, જીવનનું ધન્ય બનવું તે,
પ્રસંગો કંઈક જીવનમાં કૃપાથી સાંપડેલા છે.

જીવનમાં કારમી વેળા ભયંકર કેવી પ્રગાઠી છે !
છતાં ના દિલ થડક્યું છે, કૃપા એ શી હરિની તે !

હદ્યના પ્રેમને ખાતર જીવન સઘળું સમર્થું છે,
હવે ફરિયાદ કરવાનો ન અમને તો કશો છક્ક છે.

કારિ: ઊં

હદ્ય કેવું તલસતું છે !

નર્યાં શાં આવરણ વચ્ચે નડયાં કરતાં જ પ્રગટે છે !
ખરેખર તેથી સંપૂર્ણ અનુભવી ના શકાયે તે.

હદ્ય કેવું તલસતું છે ! હદ્ય કેવું તડપતું છે !
શું આકર્ષાઈ ગયું દિલ તે ! હવે તરફડતું કેવું તે !

અગાન દિલમાં શી જલતી છે ! બળે ભડભડ શું ભડભડતું !
શું એના એ જ ચિંતવનમાં હદ્ય જંઘ્યા જ બસ કરતું !

ભયંકરમાં ભયંકર શો હદ્ય તલસાટ વ્યાપ્યો છે !
જવનમાં એકમાં એક, થઈને એક જવતું છે.

કારિ: ઊં

સહનની અવધિ આવી છે

સહન કરતાં, સહન કરતાં, સહનની અવધિ આવી છે,
પ્રભુપ્રીત્યર્થ સહેતાં સૌ થયો દિલ ભાવ જીવતો તે.

હરિનો ભાવ જરવતાં જીવન આ ચેતનાત્મક છે,
હદ્યના પ્રેમનો ભાવ તહીં સૌ ઝૂટી નીકળે છે.

અમે બિનતારી સંદેશા, હદ્યના પ્રેમની દ્વારા
-સદા મોકલતા શા રહીએ ! છતાં જાણે જગત કંઈ ના.

જાણવવાની અમારે તો પડી ના કોઈને કંઈયે,
હદ્યના પ્રેમના ભાવે હદ્ય મસ્તાન વિચરીએ.

કારિઃકુ

અમે તે ભોગવેલું છે

જીવનના પ્રેમના શિખરતણી ટોચે પહોંચીને,
અહાલેક શી જગાવી છે ! મરીને જીવવાનું છે.

થયા વિના પૂરૈપૂરું જીવનમાં યોગ્ય તે રીતે,
હરિની વાત ખાલી તે પછી કરવી નકામી છે.

ભયંકર કેવી મુશ્કેલીમહીથી આ જીવનને તે
-જતાં ઓળંગવા એને ! નવું શિક્ષણ મળેલું છે.

હદ્યનો પ્રેમ તે કાંઈ મળે ના એમ ને એમ,
થઈ કેવું જવું પડતું અને તેથે ઉમળકાથી !

અનુભવવા હદ્યપ્રેમ થયું શું શું અમોથી જે !
તપશ્ચર્યા જીવન સમજ અમે તે ભોગવેલું છે.

કારિઃકું

બધુંયે કામ સીધે છે

પૂરૈપૂરી થયા વિના કસોટી સર્વ બાજુથી,
જવનનો પ્રેમ મેળવવો ન હાંસીખેલ કો રીતથી.

કૃપા જ્યારે હરિવરની જીવન પર તે થયેલી છે,
હૃદયનો પ્રેમ ત્યારે તો શો અણાઓલ વરી રહેશે !

કૃપાશક્તિ હરિકેરી હરિના ભક્ત પર વરસે,
હરિભક્ત થવા કાજે જીવન ઓગાળી નાખ્યું છે.

હરિ જ્યારે થતો રાજુ બધુંયે કામ સીધે છે,
હરિનો પ્રેમ શો બારે પછીથી મેઘ વરસે છે !

કારિઃકુ

જીવનનો પ્રેમ રાજ છે

જીવન વિકસાવવાને મેં કૃપાથી તો મુસીબતને
-સ્વીકારીને પૂરો તેનો, જીવન ઉપયોગ કીધો છે.

મુસીબતને, મુસીબત ના હદ્યથી મેં ગણેલી છે,
હદ્યના પ્રેમના હાઈતણી શી તે કસોટી છે !

હવે તો જીવનું મરવું હદ્યના પ્રેમને કર છે,
પરંતુ આ શરીર કેવું ખરેખર દોદળું તે છે !

જીવનનો પ્રેમ રાજ છે, જીવનનો પ્રેમ હરિ પણ છે,
હદ્યનો પ્રેમ દરબાર શું સચરાચર બિરાજે છે !

કારિઃઊં

અખંડિત રસની સમતુલા

ભયંકર શા કળજામાંથી, ચરણ આકર્ષણો મારા
-ગ્રહી કર બેંચીને બહાર, મને શો તાણી કાઢ્યો છે !

સ્મરણના ભાવથી મુજને ચરણ કેવાં જડેલાં છે !
ચરણના સ્વાદની ભક્તિ થકી દિલ ભાવ જાગ્યો છે.

અખંડિત ભાવની જ્યોતિ જીવન જલતી થયેલીએ
-જીવનમાં શો જગાડ્યો છે, હરિનો પ્રેમ ઉંડો તે !

થતાં એકાગ્ર હરિપ્રેમ, પછી કેંદ્રિત થયેલો જે,
થતાં કેંદ્રિત સંપૂર્ણ, પછી વિસ્તરવા લાગે છે.

બધે જેમાં અને તેમાં થતું રસનું જ દર્શન છે,
પછી સમતુલા રસની જે થતી ખંડિત કદી નવ તે.

કારિ: ઊં

લીલા એની શી ન્યારી છે !

નિરંતરના સતત એવા સતત અભ્યાસને લીધે
-હદ્દયનો પ્રેમ જાગે છે, જીવંતો ચેતનાત્મક તે.

જીવન તે વેળ પોતાનું જૂનું પાસું શું બદલે છે !
નવો અવતાર ધારે જ્યાં લીલા એની શી ન્યારી છે !

જીવનનો મર્મ અદ્ભુત શો ! અનુભવમાં ન આવ્યો જે,
શું એનું એ જ તે હોવા છતાં જુદું રસીલું છે !

જૂનું ખોખું ઉપરનું તો રહે અકબંધ એનું એ,
પરંતુ માંહાલું એનું કલેવર પૂર્ણ જુદું છે.

કારિઃઅં

હદ્ય ચક્કૂર ત્યાં મદમાં

બહુ ઉત્કટ અભિલાષા હદ્યદર્શનની શી રહે છે !
વિના દર્શન મજા દિલની કશી ના ફોરતી રહે છે !

થતાં દર્શન ખુમારીનાં, નશો મસ્તીનો ચઢતો છે,
બધું પોતાનું સર્વસ્વ તહીં ભાન જ ભુલાયે છે.

હદ્યના પ્રેમના ભાવ વિશે તદ્વપ સંપૂર્જન
-થઈ થઈને હદ્યરસની, સતત હેલી જ વર્ષે છે.

હદ્યના પ્રેમના ભાવતણું ઉત્કટપણું બઢતાં,
થવાતાં પ્રેમમાં મસ્ત હદ્ય ચક્કૂર ત્યાં મદમાં.

તહીં તલસાટ દર્શનનો ભભૂકતો ભવ્ય પ્રગટે છે,
શરમ, સંકોચ, મર્યાદા, ફગાવી સર્વ તે દે છે.

કારિ: ઊં

મથાવે શો હદ્ય પ્રેમ !

વરી ચૂકેલાની કેવી વફાદારી હદ્યની તે !
ભલે રખડ્યા, છતાં દિલ તો જીવંતું પ્રેમની પ્રત્યે.

અનંત જ કાળનો કેવો પડેલો દિલ અભ્યાસ !
જીટે તે એકદમ કેમ ? મથાવે શો હદ્ય પ્રેમ !

વફાદારી, પ્રમાણિકતા, હદ્યની નેક દાનત જે,
જીવનના નિમ્ન ઢાંચાને વળાવી દે બરાબર તે.

વફાદારીથી દિલ ભાવ બઢ્યા કેવો કરેલો છે !
પછી શો પ્રેમની પ્રત્યે હું આકર્ષણી ગયેલો જે !

કરિ: ઊં

જીવનનાં દ્વાર ખોલ્યાં છે

હદ્યનો પ્રેમ જો છે તો વર્ફાદારીની નિષા છે,
પ્રમાણિકતા સમા એવા બીજા ગુણો જ સાથે છે.

ફનાગીરી સમર્પણની હૃતાશન ભવ્ય પ્રગટે છે,
બલિદાનોતણી કેવી તહીંયે પરંપરાઓ છે !

વર્ફાદારીની નિષાની જીવનમાં ઓર સૌરભ છે,
પુરુખાર્થે મથામણના જીવનમાં ફાલ મોર્યો છે.

વિપત્તિ, ગૂંચ જેથી સૌ ઉકેલાવા હદ્યપ્રેમે,
ધીરજ, ધરપત, હદ્ય હિંમત, જવાંમર્દી શું બક્ષ્યાં છે !

મહેનત, ખંત, ઉઘમથી જીવનને ખેલવા અર્થે
-મથાવીને હદ્યપ્રેમે જીવનનાં દ્વાર ખોલ્યાં છે.

કારિઃકું

જીવન જીવવાની શી લિજજત !

સમરણ અવિચલ થયામાંથી, હદ્યમાં ભાવ ભીલ્યો છે,
અસ્ખલિત ભાવમાંથી જે, ફૂટેલું પ્રેમ ઝરણું છે.

હદ્યના પ્રેમના ગૂઢ, પ્રભાવે ને પ્રતાપે તે,
જીવન મહોરી થયું નૂતન, વળી નવપલ્લવિત પોતે.

જીવન તેવાની અંતરની, અહાહા ! ખુશબો શી જે !
શું નંદનવન જીવનને તો, ખરેખર તે બનાવે છે !

બહાલી ઓર ખીલે છે, જીવનની તે પળે અદ્ભુત !
-રસીલું ને છબીલું તે, જીવન જીવવાની શી લિજજત !

અરિઃઅં

ખંડ - ૩

પ્રેમની કળા

હદ્યનો પ્રેમ લાગેલો કદી છાનો ન રહે છે તે,
વિના બોલ્યો જ બોલે તે, હદ્ય પરખાઈ આવે છે.

હરિઓ

કળા શી પ્રેમની તે છે !

અરે ! સંસારી ઓ લોકો ! કરો કાં પ્રેમની વાતો ?
સજીવન પ્રેમની ઊંડી લગન ભડકે બળો કાં છે ?

વિના લક્ષણ કશું કંઈ પણ કશું વદવું જ મિથ્યા છે,
ન જેની વાસ્તવિકતા છે, ઝૂઝ્યા શા લોક કરતા છે !

હદ્યનો પ્રેમ લાગેલો કદી છાનો ન રહે છે તે,
વિના બોલ્યો જ બોલે તે, હદ્ય પરખાઈ આવે છે.

નયન, વાચા, મનોમનથી પરસ્પરનાં શું વર્તનમાં !
ન પરખાયા વિના રહે તે, કળા શી પ્રેમની તે છે !

કારિ: ઊં

ચલિત કેમે થતો ના તે

નયો સંસારમાં પ્રેમ શું ધૂતકારાઈ જતો છે તે !
ન તેને મૂળ સ્વરૂપે તો હદ્ય ઓળખતું કોઈ છે.

છતાં નિજ ધર્મ પોતાનો સહજ મૂળ તો રહેલો જે
-જીવનમાં તે પ્રમાણે તે સતત શો વર્તતો રહે છે.

‘ભલે કોઈ તે માને કે ન માને’ દિલ ન પરવા છે,
છતાં નિજની ગતિમાંથી ચલિત કેમે થતો ના તે.

સ્વયંભૂ સહજ ગતિનો શો સ્વધર્મ ને સ્વભાવે તે !
અનોખો ઓર સંપૂર્ણ ખરેખર એ અલખ રૂપ છે.

કારિઃકું

હદ્યનો પ્રેમ

હદ્યના પ્રેમને કોણ જગતમાં પ્રીષ્ઠવાનું છે ?
પ્રણયનો દર્દી તે માત્ર હદ્યનું દર્દ જાણો છે !

જગત સંસાર વ્યવહારે નર્દી શો મોહ પ્રસરે છે !
ન એવા કોઈને પણ તે ગતાગમ પ્રેમની તે છે.

હદ્યનો પ્રેમ તો ત્યાગ, સમર્પણ સૌ કરી દે છે,
જતો હોમાઈ સંપૂર્ણમણી પૂરો પ્રવેશે છે.

ફનારી જીવનકેરી, જીવન ન્યોધાવરી કરતાં
-હદ્યના પ્રેમને કેવો ઉમળકો હર્ષ ઉદ્ઘાટને ત્યાં !

કારિ: ઊં

ન કોઈથી જ પરખાયે !

હૃદયના પ્રેમને જ્યાં ત્યાં શું જાકારો જ સાંપડતો !
સ્વીકાર કોઈથી ભાગ્યે થતો લાગે જવનમાં તો.

ઇતાં ના પ્રેમ તરછોડે, તિરસ્કારે ન કોઈને,
ન હડસેલી કદી મૂકે હૃદયનો પ્રેમ એવો છે.

ન ધિક્કારે, ન છોડી દે, કદી ના સાથ મૂકી દે,
શું સાથે ને રહે સાથે, ઇતાં ના કોઈ જાણો તે !

ભલે સ્વીકાર સત્કાર થતો ના છે ઇતાં પણ શો !
-અજાણ્યો સાવ તે રહેતો, ન કોઈથી જ પરખાયે.

કારિ: ઊં

સદા અદ્વૈતનો ધંધો

સકળ દુનિયાતણો રસ પણ હદ્યના પ્રેમ આગળ તે
-કશા હિસાબમાં ના છે, હદ્યનો પ્રેમ ન્યારો છે !

હદ્યના પ્રેમનું માગ ખરે કર્તવ્ય એક જ છે,
મળી, ભળી ને ગળી જઈને થવાનું એક જાણો તે.

સદા અદ્વૈતનો ધંધો હદ્યના પ્રેમનો શો છે !
મળોલાં પ્રેમ હૈયાથી હદ્યનો પ્રેમ જીતે છે.

હદ્ય સત્કાર દેવાને રસીલાં દિલ તત્પર છે,
હદ્યના પ્રેમનો રસ તે અખંડાનંદ કેવો છે !

હારિઃઅં

હદ્યનો પ્રેમ એવો છે

હદ્ય ઉષા શું પ્રગટાવે, સ્હુરાવે પ્રેરણા શી તે !
જવન રસધેલું બનવે છે, ખરેખર પ્રેમ એવો છે.

અનંતાનંત દિશાઓતણી બારી ઉઘાડે છે,
બધું ખુલ્લું કરાવી હે, હદ્યનો પ્રેમ એવો છે.

બધાયે ભેદ ભાંગો છે, તુકાવટ ના કશી રહે છે,
બધું એકમેક આધારે કરી હે પ્રેમ, એવો છે.

હદ્ય આનંદ મસ્તીની શી છાલક તે ઉરાડે છે !
રસીલા પ્રેમની દુનિયા અજાયબ શી નશીલી છે !

હારિઃ અં

હદ્યના પ્રેમને લીધે

હદ્યના પ્રેમને લીધે હદ્ય સાંકળ જડાઈ છે,
છૂટો કેમે કરીને તો હવે છૂટી પડે ના તે.

કશું વેંદારવું પડતું હદ્યના પ્રેમને ના છે,
ન કંટાળો કશાનો છે, ન ધૂતકાર કશા પ્રત્યે.

બધાંને દિલની ઉઘા મથે પ્રેરાવવા સહજે,
બધો સ્વૈચ્છિક સ્વીકાર અને સત્કાર એને છે.

થવું ખાખ પૂરેપૂરું હદ્યનો પ્રેમ જાણો છે,
સમૂળો ત્યાગ દિલ ભાવે સમર્પણથી થતો રહે છે.

હારિઃઅં

હદ્યનો પ્રેમ તત્પર છે

હદ્ય સત્કારવાને શો હદ્યનો પ્રેમ તત્પર છે !
પકડમાં આવવા કોઈ ન તૈયાર છતાં પણ છે.

હદ્યનો પ્રેમ તો પૂર્ણ સ્વતંત્રતા શી બક્ષો છે !
વળી માલિકીનો હક્ક કશો ના પ્રેમ રાખે છે.

સરળતા પ્રેમની અદ્ભુત બધી રીતે સહજ શી છે !
હદ્યથી બાથ ભરવાને હદ્યનો પ્રેમ આગળ છે.

જતું સર્વસ્વ કરી દેવા હદ્યનો પ્રેમ રાજ છે,
શરણ રહેવા ખુશાલી છે, છતાં સર્વોપરી શો તે !

હારિઃ ઊં

મુલાયમ પ્રેમ એવો છે

હદ્યના પ્રેમનાં સગપણ બધાં જે તે-ની સાથે છે,
કશી જુદાઈ કોઈથી જરા સરખી ન ત્યાં રહે છે.

કશો ભય પ્રેમમાં ના છે, કશી તડ પ્રેમમાં ના છે,
ન રકાક પ્રેમમાં કેં છે, મમત્વ પ્રેમમાં ના છે.

કશા આગ્રહ ન કેં પણ છે, ન કોઈ ભત્તમતાંતર છે,
ન કોઈ પક્ષ એને છે, દિલાવર પ્રેમ એવો છે.

થતું જે જેમ કંઈ પણ છે, થવા તે તેમ દે છે તે,
ન વચ્ચે આવતો તે છે, મુલાયમ પ્રેમ એવો છે.

કારિઃકુ

વફાદારીની નિષા જે

હદ્યના પ્રેમને મહોબત થતી કોઈ જીવ સાથે જે
જીવનની ખુશનસીભીની ખરેખર ધન્ય પળ શી તે !

હદ્યનો પ્રેમ કોઈને કદી મૂકી ન દેતો છે,
હદ્યના પ્રેમના જેવું ન કોઈ પૂર્ણ ખુલ્લું છે.

વફાદારીની નિષા જે હદ્યના પ્રેમની તે છે,
ન તેવી કોઈની પણ છે, શું અદ્વિતીય ન્યારો તે !

શું સાથોસાથ જીવનની હદ્યનો પ્રેમ શો રહે છે !
જીવનમાં પ્રેમની ઉઘા અનુપમ હૂંફ બક્ષો છે.

હારિ: ઊં

હદ્યના પ્રેમનો સ્પર્શ

ન નિસ્બત પ્રેમને કંઈ છે, છતાં નિસ્બત બધી શી છે !
બધાંમાં તે ભણેલો છે, છતાં તે નિઃસ્પૃહી પૂર્ણ.

હદ્યના પ્રેમનો ગુણ ભળી શો દિલ જવાનો છે !
ભણ્યા વિના હદ્યને એને જરા પણ ચાલતું ના છે.

કળા, કૌશલ્ય ભળવાનાં હદ્યનો પ્રેમ જાણો છે,
થતાં એક જ રૂવે રૂવે લહર આનંદ મોરે છે.

ગુણે નિમ્નેય અવતરતાં હદ્યનો પ્રેમ નાચે છે !
હદ્યના પ્રેમનો સ્પર્શ કૂપાથી શો થતો રહે છે !

હારિઃઅં

શી રમજાટ દિલ એને છે !

મહાગાંઠો કશી પણ ના, પરસ્પર કંઈ હદ્ય વચ્ચે,
હદ્ય તો તે હદ્યથી કંઈ ન કોઈ વાત જુદું છે !

અગોચર ને અનિર્દેશ્ય, હદ્યનો દેશ જુદો છે,
હદ્યના દેશની તે શી ભૂમિકા ઈદિયાતીત છે.

ઈદ્રિયો નિભન રસ લેતી સમૂળગી બંધ થાયે છે,
પછીથી ઈદ્રિયો પોતે હદ્યરસ જંખતી રહે છે.

વિષય સંપૂર્ણ તેઓનો જતો બદલાઈ મૂળથી છે,
ગમે ત્યાંથી પછી રસની શી રમજાટ દિલ એને છે !

હરિઃકુ

હદ્યનો પ્રેમ અદ્વૈત

નજીક પાસે, હજી પાસે, હજી તેનાથીયે પાસે,
પરસ્પરથી પરસ્પરમાં થવા એક પ્રેમ ઝંખે છે.

હદ્યનો પ્રેમ તાદ્યાત્મ્ય હદ્યની ભાવનાથી તે,
ચહી ચહીને શું તલસાટે હદ્યથી તે થવા તલસે !

હદ્યના પ્રેમનો ધર્મ સતત ચાહવાતણો શો છે !
હદ્યના ચાહવામાં તો હદ્ય ઔક્ય વસેલું છે.

હદ્યનો પ્રેમ અદ્વૈત જીવનઆદર્શ સ્વીકારે,
વિના ઔક્ય બીજું કાંઈ ન ખપનું પ્રેમને તે છે.

હરિ:અં

પૂરેપૂરો શું જુદો છે !

રડાકૂટ કું જ ના એને, કશી જંજાળ ના એને,
ન માથાકૂટ કશી એને, પળેપળ તે પ્રસન્ન જ છે !

બધાંનો સંગ એને છે, છતાંથે સંગ નિજ એને,
બળેલો છે બધાંમાં તે વળી સહૃથી અનોખો છે.

ભળે ત્યાં એક રસ શો તે ! છતાં તે તે પળો પોતે
-ભળેલાંથી જ સંપૂર્ણ, પૂરેપૂરો શું જુદો છે !

વિરોધો કેટલા આડા ઉભેલા એની સામે છે,
છતાં કેવી લગન એને સતત ભળવાની દિલમાં છે !

હારિઃ ઊં

ચઢે શો પ્રેમનો રંગ !

અપવિત્ર કે પવિત્ર જ કંઈ કશું એવું ન એને છે,
બધાંને ચાહવાનો શો સહજ મૂળનો સ્વભાવ જ છે !

ઇતાં જે ભક્ત એના છે, હદ્યથી પ્રાણપ્યારા તે,
અનોખા ભાવથી શો તે બધાંને તો નવાજે છે !

હદ્યમાં ભાવ નિજ માટે તલસતો મસ્ત નીરખે છે,
ન છાનુંમાનું તેનાથી પડી રહેવાનું બનતું છે.

વટાઈ ત્યાં જતાં પૂર્ણ, ચઢે શો પ્રેમનો રંગ !
હદ્યથી શા પછી બનતા ખરેખર મસ્ત અલમસ્ત !

હારિઃઅં

ઝૂટી તે આપ નીકળે છે

હદ્યના પ્રેમનો ભાવ ઉછળી ઉછળી ઉછળતો છે,
નસેનસ ને રગેરગમાં બધે શો મસ્ત પ્રસરે છે !

જીવનમાં પ્રેમનો ભાવ ખુમારી ને નશો શો તે !
લહર, લહરો શું પ્રગટાવી હદ્ય બહુલાવી તે દે છે !

જીવનમાં મસ્તી પ્રગટે છે, ટટારી ઓર ખીલે છે,
જીવનમાં મસ્તીની તેવી ખબરદારી અનેરી છે !

જીવનનું સર્વ કૌવત ને બધી શક્તિ મળેલી જે,
ઝૂટી તે આપ નીકળે છે, પ્રસાદી પ્રેમની શી તે !

કારિઃ ઊં

ન એને કોઈ મર્યાદા

જીવનને તરબતર કરી દે જીવનને પુરબહારે તે
-રસે ભરપૂર ખીલવે છે, હદ્યનો પ્રેમ એવો છે !

હદ્યનો પ્રેમ તત્પર શો ! જીવન ઉન્નત કરી દઈને
-પૂરેપૂરો જ ગળવાને, ખુશાલી પ્રેમની શી તે !

હદ્યના પ્રેમની ખુશબો સચેતન શી સદા રહે છે !
શી ફોરી ફોરી મોરે છે ! સતત વિસ્તાર પામે તે.

ન એને કોઈ મર્યાદા ગરુડપાંખે ચઢીને તે
-ગગનની પાર પહોંચીને, ઉડે આકાશ પારે તે.

હારિઃઅં

સમર્પણ, ત્યાગ, કુરબાની

બધું પાતાળ ફોડીને હદ્યનો પ્રેમ પહોંચે છે,
ન એને છે કશું નડતર, ન નડતર પ્રેમ જાણો છે.

હદ્યનો પ્રેમ તો કેવું ઊથલપાથલ કરી દે છે !
ભૂમિકા પ્રેમ પ્રગટાવે નવું સર્જન થવા કાજે.

સમર્પણ, ત્યાગ, કુરબાની હદ્યપ્રેમ કરાવે છે,
હદ્યના પ્રેમનો એવો સહજ શો ગુણ ધર્મ જ છે !

સમાઈ સાવ સંપૂર્ણ જવાને પ્રેમ તત્પર છે,
થવા રસબસ પૂરેપૂરો હદ્યનો પ્રેમ તત્પર છે.

હારિઃઅঁ

રસામૃત દિલ પીવાને

હદ્યનો પ્રેમ ન્યોછાવર થવા શો થનગને છે તે !
વહોરંતાં ફનાળીરી હદ્યથી તાન લાગે છે.

હદ્યનો પ્રેમ તો ત્યાગ બધું જે તે જ કરવાને,
પૂરૈપૂરો જ હોંશીલો શું ખંતીલો ખરેખર છે !

સતત બલિદાન દેવા તે, જવા હોમાઈ યજો તે,
હદ્યના પ્રેમને કોડ નૂતન કેવા જ પ્રગટે છે !

બધું સ્વીકારીને લઈને ગ્રહી નવનીત લેવાને,
રસામૃત દિલ પીવાને અધીરો પ્રેમ કેવો છે !

હારિઃઅં

સ્વભાવ જ પ્રેમનો શો તે !

પ્રવેશે છે હદ્ય પ્રેમ થવા નિજરૂપ જ્યાં ત્યાં તે,
કઠણ ભૂમિકા ભલે પથ્થર સમી છો હોય તોયે જે.

ન મુશ્કેલી જ ગણકારે, ભલે અવરોધ છો હોયે,
હદ્યનો પ્રેમ તો કેવું બધું ઉડાડી તે દે છે !

હદ્યના પ્રેમનો ધર્મ થવા નિજરૂપ જીવનમાં
-સતત તે લક્ષ્ય ધારીને, ભજે શો પ્રેમ જે તે-માં !

થવા તરૂપ પ્રત્યક્ષ હદ્યનો પ્રેમ તલસે છે,
શું એકાકાર દિલ બનવા સ્વભાવ જ પ્રેમનો શો તે !

હારિઃ ઊં

શી બક્ષિસ પ્રેમની તે છે !

જરા અળગું થવા દિલથી હદ્યનો પ્રેમ ના ઈચ્છે,
અડોઅડ સાવ દિલ દિલથી થવા એક, પ્રેમ જંખે છે.

શી તલભરની જુદાઈને સહી ના પ્રેમ કંઈ લે છે !
જરા તલ જેટલું છેટું કરોડો ગાઉ લાગે છે.

સતત બસ એકનું એક જ રટણ દિલ પ્રેમને શું છે !
સમાવાને હદ્ય ભીતર હજ ઊરે જ ઈચ્છે છે.

હદ્યનો ભાવ મહોબતને ઊજાળો પ્રેમ બક્ષે છે,
તડપતું ને તલસતું દિલ શી બક્ષિસ પ્રેમની તે છે !

હરિ: ઊં

મિટાવી દેવું જંખે તે

જરા કે દૂરપણું પ્રેમ કદી પણ તે ન સાંખે છે,
જવનને સાવ સંપૂર્ણ મિટાવી દેવું જંખે તે.

સરકી સરકી હદ્યપ્રેમ હદ્યની પાસ નજીદીક તે,
થઈ નજીદીકથી નજીદીક હદ્ય પ્રત્યક્ષ શો ત્યાં છે !

પછી ના કંઈ જુદાઈ છે, પરસ્પર એકમેક જ છે,
પરસ્પર ભાવનું ઐક્ય જીવન પાંગરતું આવે છે.

હદ્યના પ્રેમનું ઐક્ય પરસ્પરનું શું અદ્ભુત છે !
ચમત્કારિક, મૌલિક તે જીવનમાં જે પ્રકાશે છે.

હંદિ:ઝો

સહજ રસપાન કરવું છે

જરા સરખું છૂટા પડવું કદી ના પ્રેમ જાણો છે,
થઈ એકમેક દિલ દિલથી થવું રસબસ શું જાણો તે !

ઇલોછલ રસથી ઊભરાઈ સહજ રસપાન કરવું છે,
ન કરવું માગ કિંતુ તે સહજ અભ્યાસ એનો છે.

હદ્ય રસની જ રામાયણ જવનમાં કેવી ચાલે છે !
જવનમાં એક પળ પજા ના વિના રસ જીવી શકતો તે.

શું આંતરબાધ્ય રસ રસ છે ! બધું રસથી ભરેલું છે,
વિના રસની કશી દુનિયાનું અસ્તિત્વ ન એને છે.

કારિઃકુ

હદ્યના પ્રેમની દુનિયા

શું મન ફંફોળવામાંથી બીજાનાં પોટલાંને તે
-પડતું નહોતું જ નવરું જે, હવે ધામે પડેલું છે.

હદ્યના પ્રેમનો ભક્તિનશો દિલ જ્યાં ચઢેલો છે,
પ્રક્રિયા સૌ મનાદિની જતી બદલાઈ લાગે છે.

હદ્યના પ્રેમનો કેવો ચમતકાર ગજબનો છે !
જીવનમાં ફેરપલટા શા હદ્ય પ્રેમે કરાવ્યા છે !

હદ્યના પ્રેમની દુનિયા બધી કેવી નિરાળી છે !
બીજું ના પ્રેમને કોઈ છે, બધું જે તે ખરેખર તે.

કારિ: ઊં

મનાદિ સર્વ કરણોયે

હદ્યનો પ્રેમ બીજાનું કશું જોવા ન નવરો છે,
સદા અલમસ્ત શો નિજમાં પરોવાઈ રહેલો તે !

કદી પણ નિજ વિના તેની ન ક્યાંયે વૃત્તિ ઠરતી છે,
હદ્યરસને વિશે કેવી સતત તરબોળ વહેતી છે.

હદ્યના પ્રેમનું યોગ્ય હદ્યરસ માત્ર ભોજન છે,
જવન એનું ભર્યું ભરપૂર રસે કેવું ઉછળતું છે !

રગેરગમાં ભરેલી છે, હદ્યરસ મસ્તી ન્યારી તે,
નસેનસ થનગની કૂદતાં જવંતાં થઈ ગયેલાં છે.

મનાદિ સર્વ કરણોયે, વળેલાં ને ઢળેલાં છે,
હદ્યપ્રેમ પરતે શાં તલસતાં પ્રેમ અર્થે છે !

હારિઃઅં

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો જતો જ્યાં હોય છે ત્યારે,
જુદાં જુદાં બધાં લક્ષણ જીવન પ્રત્યક્ષ વર્તે છે.

શરીરની જડ સમી નિદ્રા, લઘણ ખોરાકની, તનની,
હદ્યમાં ભાવ પ્રગટાતાં, થતાં ઓછાં જ લાગે છે.

ગમે તેટલુંય હો કર્મ છતાં ના બોજ તેનો છે,
બધું આટોપવામાં તે હદ્ય તૈયાર તત્પર છે.

જવાનું હારી મન, દિલથી કશાથીયે ન બનતું છે,
ટટારી ને ખબરદારી નશીલી દિલ પ્રવર્તે છે.

કારિઃ અં

છતાં રસ, રંગ જુદા છે

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો જતો જ્યાં હોય છે ત્યારે,
જુદાં જુદાં બધાં લક્ષણ જીવન પ્રત્યક્ષ વર્તે છે.

બહિરૂમુખતા જીવનમાંથી શી અંતરૂમુખ વળતી છે !
મનાદિ સર્વ ઈંદ્રિયો, વળે છે ભાવ પ્રત્યે તે.

પહેલાં જેમ લોભાતાં જતાં મોહાઈ કેવાં તે !
હવે તેમાં ભવે પેસે છતાં રસ, રંગ જુદા છે.

જૂનું છો એનું એ લાગે, છતાં તેમાંથી નવનીત જે
-અનોખું તારવી લેતાં, મનાદિ મસ્ત તત્પર છે.

કારિ: ઊં

સુદૂરે છે સૌ સ્વયંમેળે

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો જતો જ્યાં હોય છે ત્યારે
-જુદાં જુદાં બધાં લક્ષણ જીવન પ્રત્યક્ષ વર્તે છે.

હતા જે પૂર્વગ્રહ ઉંડા, મતાગ્રહ જે પડેલા તે,
બધી સમજણ વળી ટેવો, જતું હઠતું શું લાગે છે !

જૂની જૂની બધી આદત લઠણ સૌ જીવદશાનીયે,
ન તે તે રીત અસ્તિત્વ હવે તો તેમનું કંઈ છે.

બધી વિચારવાનીયે હતી જે પ્રક્રિયા તે તે,
દલીલ, તર્ક હવે ના છે, સુદૂરે છે સૌ સ્વયંમેળે.

કારિઃઅં

જુદાં જુદાં બધાં લક્ષણ

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો જતો જ્યાં હોય છે ત્યારે
-જુદાં જુદાં બધાં લક્ષણ જીવન પ્રત્યક્ષ વર્તે છે.

કશા કંઈની જ માથાજીક ન ઉદ્ભવતી કદી રહે છે,
ફિકર, ચિંતા, કશો બોજો કશા કંઈનો ન લાગે છે.

કશામાં ભેરવાયેલા, ગૂંચાયેલા ન લાગે છે,
હદ્ય ફૂલની સમા હળવા પ્રસન્ન, શાંત લાગે છે.

વિપત્તિ, વિધન, મુશ્કેલી ભલે ગર્જતી માથે હો,
છતાં નિશ્ચિંતતા કેવી ટકોરાબંધ જીવતી છે !

કારિઃકુ

બધાંમાંથી જ નીકળવું

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો જતો જ્યાં હોય છે ત્યારે
-જુદાં જુદાં બધાં લક્ષણ જીવન પ્રત્યક્ષ વર્તે છે.

જુદી જે એકબીજાથી નવી નવી શી ભૂમિકાઓ
-પ્રગટતી જે જતી લાગે ! તટસ્થ ત્યાં પ્રવત્તિયે.

કંઈક જે ભૂમિકા વિશે પડી રહેવાનું આવે છે,
છતાં તેની ગતાગમની બધી સમજણ જીવંતી છે.

બધાંમાંથી જ નીકળવું પૂરું સોંસરવું પાર જ તે,
જીવનના ધ્યેયમાં ઠરવાતણી ચાવી ખરેખર જે !

કારિઃઊં

નૂતન અનુભવ કરાવે છે

હદ્યનો પ્રેમ જ્યાં ફળતો જતો જ્યાં હોય છે ત્યારે
-જુદાં જુદાં બધાં લક્ષણ જીવન પ્રત્યક્ષ વર્તે છે.

નવીન અદ્ભુત ઉત્સાહતણો ઉન્મેષ જગવે છે,
ઉડે પાંગરતો શો જઈને નૂતન અનુભવ કરાવે છે !

પહેલાં જે ન જાણ્યું'તું પહેલાં ના સમજતો જે,
હવે પ્રત્યક્ષ સૌ તે તે હદ્ય પ્રેમે કરાવ્યું છે.

લપાયેલું છુપાયેલું કદી નજરે ન પડતું જે,
થતાં ખુલ્ખું હદ્યમાં શો મહા આનંદ ઉછણે છે !

કારિઃઅં

હદ્યના પ્રેમનું યૌવન

હદ્યના પ્રેમનું યૌવન ઊછળતું ને ધબકતું છે,
સહજ નિત નિત ખીલાંતું તે, ભર્યુ અલમસ્ત રસથી છે.

હદ્ય રસથી શું છલકાતું, બધું અંતરનું જરણું તે !
નયન, મુખ પર શી છાયાથી, કદીક પરખાઈ આવે છે !

કદીક વાણી વિશે કેવો સહજ રણકાર વ્યાપે છે !
કદી છાનો ન રહી શકતો, રસીલો પ્રેમ એવો છે.

ભર્યો ભરપૂર રસથી છે, ન વત્તિયે છતાં રસ તે,
કંઈક ગાંડા થઈ, એના પરે વારી ગયેલા છે.

કારિઃકું

પ્રણાયનો ગુણધર્મ જ છે

પ્રણાયનો ગુણધર્મ જ છે, સતત પાછળ શું પડવાનો !
મનન ચિંતવન સહજ એનું થયા કરતું જ રહેવાનો.

હદ્યના પ્રેમની બોલી કદીક બરછટ ખરેખર છે,
છતાં તેમાં સમાયેલું વદાયેલું શું તથ્ય જ છે !

કદીક તે તોછિંદું લાગે, વિનય જેમાં કશો ના છે,
કશું વિવેકનું ભાન ન જળવાયેલ લાગે છે.

છતાં શો તે સ્વયંભૂ છે ! ભલે પરખાઈ ના'વે છે,
જવન એનાથી સ્પર્શિતાં જીવનના લાભ નક્કર છે.

કારિઃઅં

હદ્ય બસ મસ્તીમાં મસ્ત

હદ્યમાં પ્રેમની ધૂન જરવવી ખૂબ અઘરી છે,
પચાવી જે શકેલા છે, કદર તે માત્ર બૂજે છે.

હદ્યનો પ્રેમ દીવાનો સતત મશગૂલ નિજમાં છે,
પણેપળની રમત એની જુદી જુદી નિરાળી છે.

શરમ કે લાજ એને ના, ન સંકોચ કશો પણ છે,
ખરેખર મસ્ત બેતાજ જવનનો બાદશાહ જ તે.

જવનમાં મહાલવા વિના કશો ધંધો ન એને છે,
હદ્ય બસ મસ્તીમાં મસ્ત સદા ગુલતાન શો રહે છે !

જવનની સ્થૂળ ભૂમિકા વિશે પણ તે રમત રમતો,
પ્રવેશાવાતણો એનો મૂળે છે ગુણધર્મ જ શો !

કારિઃકું

અગન શી જંખના એને

હદ્યનો પ્રેમ તો કેવો પરસ્પરને હદ્ય સાથે !
હદ્યમાં એક સંપૂર્ણ કર્યા કેઢે જ જંપે છે.

તલસતો ભાવ હૈયાનો સમાતો જે ન નિજ વિશે,
સતત ઊભરાઈ, ઊભરાઈ પ્રસરતો શો બધે રહે છે !

સહજ શી ઉડ્યનશીલ છે, અમયાદિત પાંખો તે !
હદ્ય તલસાટ, ઉન્માદ, અગન શી જંખના એને !

શરીર દ્વારા હદ્યભાવ અનુભવવા હદ્યમાં તે,
શરીર તો માત્ર માધ્યમ છે, હદ્યના પ્રેમને શું તે !

કારિઃકું

અનુપમ પ્રેમ એવો છે

હદ્યના પ્રેમને નિસ્બત કશા વિશે કશી ના છે,
હદ્યનો મસ્ત રંગીલો અનુપમ પ્રેમ એવો છે.

સતત ઢળવાતણો દિલથી હદ્ય પ્રતિ પ્રેમનો ગુણ તે
-મળી, ઢળીને ઝર્ટો શો હદ્ય અદ્ભુત વહે રસ જે !

રસામૃત દિલ તે પીવા નસીબવંતું જીવનમાં જે,
ખરેખર વિરલો કોઈ હશે સદ્ભાગી તરસ્યો જે.

જીવનમાં પ્રેમના ભક્ત થયેલા ખાક સંપૂર્ણ,
કશું કયાંયે રહેલું છે, ન જેનું નામનિશાન !

કારિઃકું

હદ્યના પ્રેમમાંથી તો

હદ્યના પ્રેમમાંથી તો સતત તણખા ઊડે છે શા !
જરવવામાં, પચવવામાં અતિશય દોષલા છે શા !

પરંતુ પ્રેમના વિરલા વિરલ કોઈ ભક્ત પાકા જે,
ભયંકર તીવ્ર છો લાળા જરવશે ને પચવશે તે.

હદ્યનો પ્રેમનો અભિન ભયંકર શો પ્રચંડ જ છે !
ઇતાં એને પચવવામાં હદ્ય આસ્વાદ ન્યારો છે !

પ્રણયના અભિની જવાળા પચવવાનો પરિપાક
-નવા જવનનો તે કેવો, અનુભવતો પ્રણય ભક્ત !

કારિઃઅં

અનુપમ દિલ એને છે

અધીરાઈ ખરેખર તે શી હદભહાર વગરની છે !
છતાં સાથે ધીરજ પાછી અનુપમ દિલ એને છે.

હદ્ય મળવાતણો લહાવો, સહજ ગુણ પ્રેમનો શો છે !
ભળી, ગળી, દિલ અનુભવવું, અનુભવમાં જ જીવતો તે.

પળેપળ રસથી છલકાતો, છતાં કોઈ ન નીરખે છે,
હદ્યરસની ગતાગમ કંઈ ન કોઈને પડે છે તે.

ભલે રસને જીવનમાં તો ન જાણો કે ન સમજે છે,
છતાં આકર્ષણો તેના શું જેંચાતાં જ સહુ જે તે !

કારિઃકું

થતાં ખુલ્લાં રહે દિલ તે

થતાં એના હદ્યમાં જ્યાં પૂરૈપૂરાં મનાદિથી
-બધાંયે બારણાં બંધ, થતાં ખુલ્લાં રહે દિલ તે.

હદ્ય બસ મુક્ત વ્યવહાર શું છલકાતો રસે ચાલે !
પછી કંઈ ના કુકાવટ છે, બધાંયે દ્વાર ખુલ્લાં છે.

હદ્યથી વર્તવું કેમ કળા જ્યારે જીલેલી તે !
રસીલી મસ્ત ભરતીએ, બધી ત્યાં સૂજ પડતી છે.

વરેલા જ્યાં ચરણમાં છો, થયેલા એક દિલથી હો,
ચરણનો રસ પીધેલો જ્યાં, સહજ ત્યાં મોકળું છે સૌ.

કારિ: ઊં

સહજ ગુલતાન કેવું છે !

હદ્ય તો ચાહી ચાહીને હદ્ય શું ગેલ કરતું છે !
વિના ચાહ્યા હદ્યને તો કશે ના ચેન ક્યાંયે છે.

બીજાનું કાંઈ જોવાને હદ્ય નવરું જરા ના છે,
હદ્ય નિજ પ્રેમ મસ્તીમાં સહજ ગુલતાન કેવું છે !

હદ્યને ભાવતું ભોજન, હદ્યને પ્રેમનું અમૃત
-નિરંતરનું જ સેવન તે, મજાથી તો ખરેખર છે !

અખંડિત ભાવ એમાં છે, ન દિલથી તે વિખૂટો છે,
હદ્ય રમમાણ મસ્તાની અકલ્ય જ રંગમસ્તી છે.

કારિ: ઊં

હદ્ય આનંદ લૂંટે છે

નકામા ચેનચાળાને ન બરદાસ કરી લે તે,
કદી અમથાં ન બહાનાં તો હદ્યનો પ્રેમ કાઢે છે.

હદ્ય રંગતની મસ્તીમાં હદ્યની એક શી ધૂને !
સદા બસ મહાલવાકેરો હદ્ય આનંદ લૂંટે છે.

વળી વળીને, ફરી ફરીને, હદ્ય બસ એક તે વાતે
-રમ્યા કરતું રહે મનહું, લળી લળી ત્યાં જ ચોટે છે.

કુંડાળે એકના એક જ રમ્યા કરવા જ જંખે છે,
રમત આનંદની મસ્ત અનોખી ઘેલધા એને.

કારિઃઅં

સતત ચાહ્યા જ કરવામાં

હદ્યના પ્રેમને કશી પણ ન લખન છખન કોઈ છે,
છતાં નિર્બદ્ધ પૂરેપૂરી મળેલાંને જ ચાહવાને.

અવર ચાહે ન ચાહે છો, હદ્યના પ્રેમને કિંતુ
-સતત ચાહ્યા જ કરવામાં હદ્ય આનંદ ઓર જ શો !

છતાં દિલ પ્રેમનો પૂરો હદ્ય સતકાર-સ્વીકાર
-ઉમળકાથી થતો જ્યાં, તે હદ્યના પ્રેમનું પાત્ર

-ખરેખર એક બસ માત્ર જીવન તે કર્મનું ક્ષેત્ર,
કૃપાથી શો સતત તેમાં રમ્યા કરતો રહે નિત્ય !

કારિઃકુ

હદ્યનો પ્રેમ પરમેશ્વર

બહુવિધ શો હદ્યપ્રેમ ઉતે ઉતે મથાવે છે !
શું અંતર તે મથાવીને ઉંડો શો ઉતરાવે છે !

ઉતે ઉતે, હજ ઉતે, હજ અંદર ઉતે ઉતે
-પ્રવેશાતાં જતાં અંતર, રહસ્ય ગૂઢ લાધે છે.

અનંત દાણ શી સૂક્ષ્મ બહુ દૂરગામી જ્યાં ત્યાં છે !
શી પ્રસરેલી જ સર્વત્ર જગા કોઈ ન ખાલી છે !

હદ્યનો પ્રેમ પરમેશ્વર નિયંતા, ભોક્તા, કર્ત્ત છે,
વળી શો મુક્ત એ તો છે ! શું નિર્માતાય પોતે છે !

કારિઃકુ

હદ્યના પ્રેમનો પથ છે

બલિદાન, સમર્પણ ને ફનાગીરી પળેપળનાં-
જીવનનાં શાન ભક્તિથી સહજ ભાવે થતા રહેતાં.

ખુવારીથી ભર્યો ભરપૂર હદ્યના પ્રેમનો પથ છે,
ખુવાર ત્યાં થતાં દિલમાં ખુમારી ભાવ ઊમટે છે.

ભયંકર સંકટો, કાદો, કંઈક સાહસ ને જોખમને-
જીવનમાં ખેલવાં પડતાં હદ્યના પ્રેમને પણ જે.

કશાથીયે પડયો પાછો કદીયે તે ન જાણ્યો છે,
અડગા, અણનમ ખરેખર શો પરાકમી મર્દ દિલથી તે !

કારિઃકુ

સહજ ન્યારો સ્વભાવ જ છે

ખુલારીથી ભરેલો પથ ખરેખર પ્રેમનો શો તે !
ખુલારીમાં ખુમારીની જીવનમાં મહેક ઊઠે છે.

થતાં ખુલાર સંપૂર્ણ છતાં કંઈ હાથ ના'વે છે,
ખુલારીમાં રસિક ન્યારો હદ્ય ઉન્માદ કેવો છે !

થતાં થાતાં ખુલાર જ શો હદ્ય આનંદ મહાલે છે !
હદ્ય ત્યારે ખુમારીનો ચમત્કારિક રણકો છે.

ગણતરીનો સ્વભાવ જ ના, છતાં ના અલેલટઘુ છે,
વ્યવસ્થિતિથી ભરેલો તે અનુપમ ઘ્યાલવાળો છે.

જવા સંપૂર્ણ વપરાઈ અચૂક નિશાન હેતુએ,
ખરેખર પ્રેમનો એવો સહજ ન્યારો સ્વભાવ જ છે.

કારિ: ઊં

ખરો શો ગુણ એનો છે.

મુસીબતને હદ્યપ્રેમ મુસીબત દિલ ન ગણતો છે,
મુસીબતમાં હદ્યપ્રેમ વધારે મસ્ત ઝળકે છે !

નિરાશા પ્રેમ ના જાણો, હદ્યથી ચાહી ચાહીને
-હદ્ય ગળવા પૂરેપૂરો ખરો શો ગુણ એનો છે !

હદ્ય બસ એક થઈ જઈને રસાનંદે, રસાનંદે,
સહજ આનંદની છોળે રસાવાનું ગમે એને.

હદ્ય પસંદગી એની ફૂપાથી ઊતરી જ્યાં છે,
કરી નિજનું હદ્ય લેવા હદ્ય શો પ્રેમ તત્પર છે !

કાર્યિકારણાં

બધા સ્વાંગ સજે છે તે

અગનની કારમી કેવી ભયંકર તે પરીક્ષામાં
-સતત જલતા રહેવાનું, છતાં ફરિયાદ કંઈ છે ના.

કદી સંભાળવાનું ના, કશું વદવાનું ના પણ છે,
ચડીચૂપ જ ધરી મૌન, ભલો સ્વીકાર એને છે.

હદ્યનો પ્રેમ રાજ છે, છતાં રૈયત વળી પણ છે,
મુનીમ, ચાકર, વળી પોતે બધા સ્વાંગ સજે છે તે.

સતત જલવું, હદ્ય જલવું અગનની દિલ પિપાસા,
હદ્ય તડપન થતાં તેમાં લહેજત પ્રેમ મહાલે છે.

કારિઃકું

હદ્યથી રંગ બક્ષે છે

હદ્યથી પ્રાણ નિચોવી ટીપુંયે ટીપું લોહીનું
-ભરી ખઘર બધું દે તે સહજ શો પ્રેમ એવો છે !

જવું હોમાઈ સંપૂર્ણ સમર્પણ થઈ જવાનું તે,
બિરુદ્ધ શું પ્રેમનું તે છે ! અવર જન શી રીતે જાણે ?

કશો ના સ્વાર્થ એને છે, કશી જંગટ ન એને છે,
વટાઈ મેંદીની પેઠે હદ્યથી રંગ બક્ષે છે.

બધું અસ્તિત્વ પોતાનું રજેરજનું ભિટાવીને
-પ્રવેશાવા ભીતર દિલમાં, મહોબત પ્રેમની તે છે.

કારિઃકું

ગળાબૂડ શો દૂબેલો છે !

હદ્યના પ્રેમનો પંથ ખુવારીથી ભરેલો છે,
તલસતું તીવ્ર રહેવાનું હદ્ય કેવું લખાયું છે !

સતત બસ એકની એક જ હદ્યમાં ધૂન એની છે,
હદ્ય બસ એકલા એને સતત ભજવાનું ચાહે છે.

વિના એના કશી બીજી ન ચળવળ કોઈ કયાંયે છે,
ગળાબૂડ શો દૂબેલો છે, હદ્ય ચિંતવનમાં એના એ !

તપશ્ચયર્થ સહેવાથી થયા કેદેનું જીવન તે,
મહોબતની મીઠી ખુશબો થકી કેવું સુવાસિત છે !

કારિ: ઊં

સહ્યા વિના હદ્યમાં તો

સહેવાનું ઉમળકાએ હદ્યનો પ્રેમ સમજે છે,
સહેવાને તપશ્ચર્યા ખરેખર દિલ જાણો તે.

સહ્યા વિના હદ્યમાં તો, કશી ભીઠાશ ના'વે છે !
સહેવામાં મજા, રસ જે સહેવું તે હદ્યનું છે.

હદ્યના પ્રેમનાં પાસાં અનેકાનેક કેવાં છે !
થવાતું આરપાર જ તે બધી રીતે જીવનને છે !

ખરેખર ઉત્તારોત્તાર શો હદ્યનો પ્રેમ જે રીતે
-સીડી પર તે ચઢી ચઢીને, ભીતર તેમ જ પ્રવેશો છે.

કારિઃઊં

ન એને રૂપ, આકાર, નિરાકાર પૂરેપૂરો

હદ્યનો પ્રેમ તો કેવું ન નરસું, સાચું નીરબે છે,
ન એને ન્યાય, અન્યાય કશું દિલમાં જ વસતું છે.

ગમે તેવું ભલેને હો, કુપાગ, પાગ જે તે હો,
ઇતાં દિલ પ્રેમ તો સૌને હદ્યથી ચાહવું જાણો છે.

સમગ્રે જે સળંગો શો પરાત્પર તે અખંડ જ છે !
ઇતાં જે જેમ, ત્યાં ત્યાં શો જરૂર દિલ પ્રેમ તેવો છે.

ન એને રૂપ, આકાર, નિરાકાર પૂરેપૂરો,
ઇતાં સાકાર પ્રત્યક્ષ અનુભવમાં પ્રમાણોલો.

હારિઃઅં

હદ્ય ટેકો દીવેલો છે

વફાદારી પૂરેપૂરી પરતવે પ્રેમની ‘એ’ છે,
છતાં પણ જ્યાં ભુલાતાંમાં ઊભો શો પ્રેમ તત્પર તે !

પથિક ભૂલે પરંતુ શો સતત નિજ લક્ષ્યની પ્રત્યે
-રહેતો સાવધાન જ તે, શી એની સાવચેતી છે !

હદ્યની નેક દાનતથી વરેલા ઓકવાર જ છો,
પછી નિશ્ચિત સંપૂર્ણ હદ્યમાં તો રહેવાનું.

જ્યહીં આવ્યાં જ અંધારાં અને ચક્કર ચઢેલાં છે,
દીવાથી પાડી અજવાળાં હદ્ય ટેકો દીવેલો છે.

હારિઃ અં

ખુવાર છો થવાતું હો

અનુભવી પ્રેમનો જે છે, જીવનમાં મહાલી શકતો તે,
હદ્યના પ્રેમની ખુશબો, કરી દે તરબતર દિલને.

ખુમારી પ્રેમની કોઈ ગજબની મસ્ત જગ્બર છે,
અનુભવતાં નશો જેનો રગેરગ ઓર વ્યાપે છે.

ઇતાં પાછો ખુવારીથી ભર્યો ભરપૂર પથ તે છે,
ખુવાર છો થવાતું હો, ઇતાં રસ પ્રેમને ત્યાં છે.

શી હરકોઈ પરિસ્થિતિ વિશે પણ પ્રેમને રસ છે !
વિના રસ પ્રેમનું જીવન કદી સંભવતું તે નવ છે.

કારિઃકું

હદ્યનો પ્રેમ આપે છે

ગમે તેવું ભલે છોને છતાંથે સ્પર્શતાં તેને,
હદ્યના પ્રેમને વાર જરા સરખી ન લાગે છે.

ન આભડછેટ એને છે, અપાપી, પાપી ના એને,
ગમે તે કોઈ વળગે જે બધાંને તે સ્વીકારે છે.

ન કોઈને જ ધૂતકારે, ન કોઈને જ હડસેલે,
તિરસ્કારે ન કોઈને, હદ્યનો પ્રેમ ઓવો છે.

મળ્યાં તેને જ પડખાંમાં અડોઅડ પાસ રાખે છે,
મુલાયમ હુંફ શી એને હદ્યનો પ્રેમ આપે છે !

કારિઃકુ

સનાતન ધર્મ એનો તે

હદ્યના પ્રેમને કોઈ ન મર્યાદા કશી પૂણ છે,
અસ્ખલિત જે વહેતો છે, અમર્યાદિતપણે શો જે !

સતત આનંદની ઝડીઓ હદ્યના પ્રેમને હદ્યે
-ઉછળતી શી સહજ રહે છે ! સનાતન ધર્મ એનો તે.

કશો ખચકાટ એને ના, તુકાવટ ક્યાંય એને ના,
ન જ્યાં તે હો સ્વીકારાતો, છતાં લાગે જતો શો ત્યાં !

કશી પરિણામની ચિંતા હદ્યપ્રેમ ધરે છે ના,
હદ્ય હરિને ધરી ધરી શો ખરેખર પ્રેમ રાચે ત્યાં !

કારિઃકુ

પ્રકાશિત આપ પોતે છે

જીવનમાં પ્રેમનો ધર્મ સહજ પ્રગટ્યા જવાનો છે,
સતત અસ્તિત્વ એનું છે, છતાં એને ન કો મીછે !

બધાંનામાં રહેલો છે, બધાંમાં આપ વર્તે તે,
બધાંની સાથ શો તે છે ! છતાં ના કોઈ તે સાથે.

પ્રવેશેલો હૃદય તે છે, ન છાનોમાનો કંઈ તે છે,
જીવનના સર્વ વ્યવહારે પ્રકાશિત આપ પોતે છે.

હૃદયના પ્રેમને ભાષા ન કોઈ પણ પ્રકારે છે,
અવ્યક્ત શો ! છતાં વ્યક્ત સતત કેવો થતો રહે છે !

કારિઃઅં

જીવન તો ધન્ય બનતું છે !

જીવન તાસીર બદલાઈ જવાને, યજ્ઞ માંડ્યો છે,
અને તે યજ્ઞ જ્વાળામાં, જવું હોમાઈ પડેલું છે.

પડ્યા જે માંહી તે કેવું મહાસુખ દિલ પામે છે,
હદ્યનો પ્રેમ તેવાને થતો જાગૃત જીવનમાં છે.

નિરંતર પ્રેમ અમૃત તો, જીવન અજ્વાળીને કેવું
-જીવન નવતર, નૂતન, નવલું રસિક ઉધાન બનવે છે !

જીવનમાં શાંતિ ને શાતા, હદ્ય પ્રસન્નતા પમરે,
હદ્યના પ્રેમથી કેવું જીવન તો ધન્ય બનતું છે !

કારિઃકું

હદ્યનો પ્રેમ ખીલે છે

જીવનમાં ચાહતાં શીખતાં, હદ્યનો ભાવ બઢતો છે,
બઢે છે ભાવ જ્યાં દિલનો હદ્યનો પ્રેમ ખીલે છે.

હદ્યનો પ્રેમ જ્યાં ખીલતો, જીવનમાં હોય છે જ્યારે
-મડાગાંઠો, બધી ગ્રંથિ તૂટી કેવી જતી લાગે !

હદ્યના પ્રેમના યજાતણી જવાળા શી પ્રસરીને !
બધો તળિયાતણો કચરો, પૂરો સ્વચ્છ કરી દે છે.

બધે જ્યાં ત્યાં ઉપર નીચે, વળી ચોપાસ સહુ દિશે
-પ્રસારી નિજનો અર્જિન, બધું જે તે પ્રકાશાવે.

કારિઃઅં

ઉભય ગતિ પ્રેમની એવી

હરિનાં વ્યક્ત રૂપો તો અનેકાનેક કેવાં છે !
હદ્યનો પ્રેમ તેમાંનું હરિનું એક દર્શન છે.

હદ્યનો પ્રેમ અવતરતો શું આરોહણ થવા કાજે !
ઉભય ગતિ પ્રેમની એવી પળેપળની જ સંગાથે.

ઉભય ગતિ એકબીજાથી પરસ્પર સંકળાઈ છે,
પરસ્પરથી ન તે ભિન્ન કશા કોઈ પ્રકારે છે.

હદ્યના પ્રેમની સૂક્ષ્મ થતી જે પ્રક્રિયા રહે છે,
ભલે તે સ્થૂળ પરની હો છતાં સર્જન નૂતન અર્થે.

હરિ:ઓ

ખંડ - ૪

પ્રેમરૂપ

હદ્યના પ્રેમનું એવું ખરું રસનું જ ભોજન તે,
હદ્ય મળતાં, હદ્ય ગળતાં, શું રસનો સ્વાદ એનો છે !

કારિ: ઊં

ખરું અદ્ભુત તે તર્પણ !

હદ્યથી ભીસ દઈ દઈને, અડોઅડ છેક થઈ થઈને,
શું દિલ દિલને મિલાવીને હદ્યરસ પ્રેમ પીવે છે !

ન સાંસારિક દુઃખો ત્યાયે, કશી ના વાસના ત્યાં છે,
હદ્યને સ્થૂળ હદ્ય ના છે, હદ્ય તે સૂક્ષ્મથી પર છે.

ગમેયે તેટલું છોને નજીક હો છેક પણ પાસે,
ઇતાંયે પ્રેમને તો શું હજારો ગાઉ દૂર દૂર છે !

હદ્યથી જે હદ્યમાં તે હદ્યનું દિલ સંપૂર્ણ
-થઈ જઈને ગળે છે જે, ખરું અદ્ભુત તે તર્પણ !

હદ્યના પ્રેમનું એવું ખરું રસનું જ ભોજન તે,
હદ્ય મળતાં, હદ્ય ગળતાં, શું રસનો સ્વાદ એનો છે !

કારિ: ઊં

સહજ ગુણધર્મ સ્વાભાવિક

સહજ ગુણધર્મ સ્વાભાવિક જીવનમાં પ્રેમનો તે છે,
સતત પાછળ પડી પડીને હૃદયમાં એક ગળવાનો.

જાઝૂમીને ઝુકાવે છે, ઊરી ડૂબકી લગાવે છે,
શું અંતરના જ અંતરની ઊરી તે મોજ માણે છે !

ન મર્યાદા, ન સંકોચ, કશી ના આડખીલી છે,
બધું જે તે જ ઓળંગી બધાંની પાર પહોંચે છે.

કશા સંકલ્પ વિકલ્પ, કશી વિચારસરણીયે
-કશા કંઈ જ પરત્વેનાં, હૃદયના પ્રેમને ના છે.

પડી પાછળ હૃદયમાં ને હૃદયથી એક હોવાનો
-અનુભવ માત્ર હૈયાનો સહજ તે પ્રેમનો છે શો !

કારિઃકુ

આણુ આણુમાં ભળેલો છે

સહજ ઉત્સુકતા એની શી અપરંપાર દિલમાં છે !
શું ઠંડોગાર પોતે છે છતાં મિલન ગતિમાં તે !

હદ્યમાં સાવ સંપૂર્ણ બિરાજેલો પ્રતિષ્ઠિત છે,
છતાં પરખે ન કો એને મહા અચરજ ખરેખર છે !

ભળેલો છે પૂરેપૂરો, છતાં અસ્તિત્વ જેનું તે
-પિછાણી કોઈ ના શકતું, નવાઈની નવાઈ તે !

આણુ આણુમાં ભળેલો છે, જગા કોઈ ન ખાલી છે,
પૂરો વ્યક્ત છતાં કેવો ન દેખાતો જરા પણ છે !

કારિઃકું

પ્રગટ ચેતનનું રૂપ તે છે

હદ્યના પ્રેમની હકીકત જુદી કોઈ જાતની શી છે !
નિરાળી તે હકીકત શી મૂળે રસની ભરેલી છે !

ભલે રસ, પ્રેમ એ બંને જુદા જુદા શું લાગે છે !
ઇતાં બંનેતણાં મૂળમાં પ્રવર્તેલું જ ચેતન છે.

ઉભય રસ, પ્રેમ સાકાર પ્રગટ ચેતનનું રૂપ તે છે,
હદ્યના પ્રેમના રસની બલિહારી શી અદ્ભુત છે !

જીવનનું એ જ સર્વોત્તમ શું ભોજન ઉત્તમોત્તમ છે !
મનાદિ સર્વ પળપળ તે હરિમાં વિલસેલાં છે.

કારિઃઅં

જવાંમદ્ ખરેખર છે

હદ્યના પ્રેમનો જુસ્સો અવર્ણનીય જબ્બર છે,
કહીંથી કહીંક શા કૂદકા ઊણા મસ્ત મારે છે !

દીવાલોયે કૂદી કૂદીને કહીંનો કહી પ્રવેશે છે,
કશું અંતર ન એને છે, જવાંમદ્ ખરેખર છે.

મલાજો કંઈ કશાનોયે જરા સરખો ન પાળે છે,
મલાજ બહારની એની મજા રંગત અનેરી છે !

બધાં શાં આવરણ ખુલ્ખાં કરી દેવા જ તત્પર છે !
કશા કોઈ જાતના પડા કદી સહી ના જ તે લે છે.

હારિઃ ઊં

રહેલો ગૂઢરૂપે શો !

હદ્યના પ્રેમનો કેવો બધે જ્યાં ત્યાં પસારો છે !
કંઈ એના વિનાનું તો ન અસ્તિત્વ કશે પણ છે.

બધે સચરાચરે પ્રેમ અણુમાં ને અણુમાં જે,
રહેલો ગૂઢરૂપે શો ! નર્યો તે શક્તિરૂપે છે.

હદ્યના પ્રેમનો સ્પર્શ ઝરંતા શક્તિ તણખાને,
જવંતી પ્રેમની ભક્તિ હદ્ય જે તે અનુભવશે.

ન જન્મ કે ન સર્જન છે, કશું લય પામતું ના છે,
સતત અસ્તિત્વ જે તે-નું ખરેખર પ્રેમ પ્રત્યક્ષે.

હંટિઃકું

સદા યૌવન ખીલેલું છે

હદ્યના પ્રેમને કોઈ કશી ઉમ્મર ન ક્યાંયે છે,
સદા યૌવન ખીલેલું છે, ભર્યું ભરપૂર જીવનમાં જે.

કદીક તે શો ભભૂકે છે ! કદીક ગૂઢ શો નર્યો રહે તે !
કદીક શાંત પડ્યો રહે છે, કદીક ગતિશીલ પ્રવર્તે છે.

જીવનમાં સૂક્ષ્મ અણસારે બધો વ્યવહાર ચાલે છે,
ઈશારાને હદ્ય સમજ જીલે જે ધન્ય થાયે છે.

ઈશારામાં ભરેલી છે, શી શી જે શક્યતાઓ તે !
ન સંસારી કદી સમજે, હદ્યનો પ્રેમ એવો છે.

હદ્યના પ્રેમનો દિવ્ય બધો સંસાર ન્યારો છે,
વરેલા પ્રેમને જે છે, બધું તેવા જ સમજે છે.

કારિઃઅં

પ્રેમ એ જ સદ્ગુરુ

હદ્યના પ્રેમના જેવો ન સદ્ગુરુ કોઈ બીજો છે,
કદીક તંડા શું મારીને કંઈક કંઈ શિખવાડચું છે.

થતાં ભૂલ ચુપકીદીથી, છૂપા અણસારથી મુજને
-નજીક આવી, ધીમા ધીમા અવાજે કાન ફૂંક્યો છે.

કળા શિખવાડવાકેરી ખરેખર કેવી અદ્ભુત તે !
વિહંગાવલોકને તેનું હવે દર્શન થયેલું છે.

કદીક છંછેડીને કેવો પરેશાન જ કીધેલો છે,
પરંતુ શો નૂતન પાઠ તહીં શીખવા મળેલો છે !

કારિઃઊં

અચળ એનું અસલ રૂપ છે

સ્મરણ કરતાં, સ્મરણ કરતાં, હદ્યમાં ભાવ મોર્યો છે,
અને એ ભાવ જીવનનો મુખ્યત્વાર બનેલો છે.

હદ્યના પ્રેમને કોઈ ન પ્રાકૃતિક ગણતરી છે,
સદા તે ભાવમાં વહેતો અચળ એનું અસલ રૂપ છે.

અતિશાય તે રિબામણમાં ચુકાઈ જ્યાં જવાયું છે,
હરિનું માત્ર ત્યાં સ્મરણ ખરું ખપમાં જ લાગ્યું છે.

જીવનના પ્રાકૃતિક ક્ષોત્રો કસોટી ને પરીક્ષાયે
-થતાં શો ત્યાં જબરજસ્ત ટકોરાબંધ જીવતો તે !

કારિ: ઊં

સ્વતંત્ર પૂર્ણ પાછો તે

રસીલા પ્રેમને અડચણા, મુસીબત, વિઘ્ન પથમાં છે,
છતાં એણે ન ગાણકાર્યા, કૂદી જે તે ગયેલો છે.

બધી જંજળ કંઈ હોવા છતાં એને કશી ના છે.
કશું વળગણ ન એને છે, સહજ શો મુક્ત એવો તે !

ન એને છિલચાલ જ છે, રિવાજ કોઈ ન એને છે,
કશી ના ચાલ એને છે, છતાં શી ચાલ પાછી છે !

શું નખરાંબાજ પોતે છે, ન જેની કોઈ સીમા છે !
સીમાબદ્ધ છતાં શો તે ! સ્વતંત્ર પૂર્ણ પાછો તે.

કારિઃકુ

સ્વયંભૂ શો સહજ પોતે !

ન સંઘર્ષણ કશાં એને, અશાંતિ ના કશી એને,
કશો ના ફૂલેશ એને છે, સદા શાંતિ જ શાંતિ છે.

ન સંકડામણ કંઈ એને, ન લમણાજીક એને છે,
વિરોધાત્મક વલણ છો હો, છતાં અવતરતો ત્યાં પણ તે.

ખડાં સામે જ છો વિધનો, વિપત્તિ, પ્રશ્ન, મુશ્કેલી
-ભલે પડકારતાં લાગે, છતાં આણનમ અડગ શો તે !

સ્વયંભૂ શો સહજ પોતે ન જેનું મૂળ કયાંયે છે !
નિરાકાર જ શું સાકાર, ખરેખર પ્રેમ એવો તે !

કારિઃઅં

શું રેલમછેલ રસ એને !

કશી તડ ના પડે એને, કશી રકજક ન એને છે,
કશી તડજોડ ના એને, શું સમરસ તે બધાંમાં છે !

ઉધામા ના કશા એને, કશી સગડગ ન એને છે,
હદ્ય નિશ્ચિતતા એને, શું રેલમછેલ રસ એને !

ન કંઈ પંચાત એને છે, બધી વાતે જ ધરપત છે,
નિરાંતે સોડ તાણીને સૂવાનું પ્રેમ જાણે છે !

રમત રમી જાણવા વિશે કશી ના આવડત એને,
ઇતાં પાણું રમ્યા વિના ઘરીક પણ ચાલતું ના છે.

કારિઃઅં

અજબ શો મહેકતો રહે છે !

શરમ, સંકોચ, મર્યાદા, કશાં પણ પ્રેમને ના છે,
જતો શો વારી વારી તે ! કદીક અક્કડ વળી શો તે !

વળી જેમ વાળવો હોય, મુલાયમ પ્રેમ એવો છે,
ખુમારીની શી ખુશબોથી અજબ શો મહેકતો રહે છે !

બધાંયે ફૂલની ખુશબો હૃદયના પ્રેમ આગળ તે
-કશા છિસાબમાં ના છે, નર્યો ખુશબોથી મશગૂલ તે !

અહા શો તોર એનો છે ! મિજજ પ્રેમ કેવો છે !
ઇતાં જે ભક્ત નિજનો છે, ચહી પદમાં શું લોટે તે !

કારિઃકું

અકલ્ય જ શો અગોચર છે !

શું નૈસર્જિકપણે સઘળું સહજ ધોરણ બધી રીતમાં
-બધું ખુલ્લે જ ખુલ્લું છે, છતાં પાછું અગમ્ય જ ત્યાં !

ભળેલો એકરસ સહુમાં પૂરેપૂરો શું લાગે છે !
છતાં પાછો જ તે સૌથી શી અદ્ભુત રીત જુદ્ધો છે !

કળા, કૌશલ્ય, કુનેહ, હૃદયના પ્રેમનાં જે છે,
સમજમાં બુદ્ધિની કંઈ તે કદી ના આવવાનાં છે.

અકલ્ય જ શો અગોચર છે ! શું અદ્વિતીય પોતે છે !
છતાં ના તેમ વર્તાતો, શી ગોઠડી એની સૌ સાથે !

કારિઃઅં

હદ્ય ઉદાર રાજા છે !

મળ્યા સામે જ પથ્થર જો, બધાં પડ કોરી કોરીને
-નીકળવું સોસરું પાર, કળા તે પ્રેમ જાણો છે.

રુકાવટ હો ભવે તોયે, રુકાવટ તે ન જાણો છે,
હદ્યના જોશની માત્રા તહીં શી ઓર ફોરે છે!

હદ્યના પ્રેમના કેવા નૂતન, નૂતન પ્રદેશો છે !
ન જાણીતા કશા તે છે, છતાં ના પ્રેમ થડકે છે.

અભય સંપૂર્ણ સૌ વાતે, હદ્ય નિશ્ચિત શો તે છે !
દિલાવર દિલનો કેવો હદ્ય ઉદાર રાજા છે.

કારિઃઅઁ

અનંતાનંત વિસ્તાર

ન આગળ પાછળો કંઈ છે, ધરાળ જ ના ઉલાળ ન છે,
કદી પાછળ જુએ ના તે, ચિરંજવ પ્રેમ એવો છે.

બધે સામ્રાજ્ય એનું છે, વિના એના કશું ના છે,
બધું જે તે શું પોતે છે! જુદું પછી કોણ કોણથી છે ?

બધું નિજરૂપ જે તે છે, છતાં માયા હરિની જે
-બધાંને આવરી લઈને ભમાવે મોહમાં એને.

અનંતાનંત વિસ્તાર સહજ મૂળ પ્રેમનો શો છે !
બધે જ્યાં ત્યાં શું પ્રસરેલો કશું બાકી ન જેથી છે !

કારિઃઅં

રમતનું તે વલોણું શું !

હદ્યના પ્રેમની દુનિયા અલોકિક ને શી મૌલિક છે !
હદ્યના પ્રેમને મહોબતતાણી સંગત શી ગમતી છે !

હદ્ય-રસ-રંગની મસ્તી ભરતીની શી લહર પેઠે,
સતત એકધારી ચઢતી છે, ન તેમાં ઓટ ક્યાંયે છે.

કદીક શી ઓછીવતી ત્યાં લહર માત્રા થતી રહે છે !
ઇતાં આનંદનો સાગર શું મોજાં ઓર ઉછાળે !

સતત રમવું, હદ્ય રમવું પળેપળ મસ્ત રમવાનું,
હદ્યના પ્રેમનું ગાણું રમતનું તે વલોણું શું !

કારિઃકુ

કરુણા પણ ભળેલી છે

કદીક શો વજ જેવો છે ! કદીક શો પુષ્પ જેવો છે !
કરુણાનુ જ સંપૂર્ણ, છતાં પાછો શો ન્યાયી છે !

અદલ ઈન્સાફની સાથે કરુણા પણ ભળેલી છે,
અદલ જો ન્યાય હો માત્ર ન જીવવાનું બની શકતે.

કરુણા ગુણના જેવો વહેવાનો સ્વભાવ જ શો !
સતત તે એકધારો શો વહેતો છે ગતિમાં તો !

કરુણાસિધુનું નામ, હજારો નામમાંથી જે-
હરિનું જે પડેલું છે, ખરું સાર્થક ખરેખર છે.

કારિ: ઊં

શી ન્યારી મસ્તી એની છે !

ન માથાકૂટ એને છે, ન જંઝાવાત એને છે,
કશી પંચાત ના એને, સરળ વ્યવહાર એનો છે.

દગ્ગોફટકો કશો કરવો કંઈ ના પ્રેમ જાણો છે,
મળી, ભળી, દિલ ગળવામાં શી ન્યારી મસ્તી એની છે !

હંદુયના પ્રેમની દુનિયા ન સંસારી સમી કયાંયે,
કશો ના સ્વાર્થ એને છે, હંદુય થવું એક જાણો જે.

ખુમારીનો નશો એને, ખુવારી પથ ચઢેલાને,
ખુવાર રહે થતો કેવો ! છતાં આનંદ એને છે.

કારિઃઅં

છતાં પાસાં બધાં એને

કશી ખટપટ ન એને છે, ન ખટપટ કંઈ જ જાણે છે !
ખરેખર પ્રેમનો પથ શો સીધોસટ એકસરખો છે !

ન રોકાવાનું સમજે તે, ઝપાટાભેર દોડે છે,
નિશાન જ તાકવા પ્રત્યે નજર વૃત્તિ શું એની છે !

શું ફાંસીએ જ ચઢવાનું નસીબ એને લખાયું છે !
જવનમાં કોસ પર એને શું ચઢવાનું જ આવે છે !

ગિધુંચતું ન એને છે, સીધેસીધું વળી એને,
ન ચણચણાટ એને છે, ન ચિંતા, ના ફિકર કંઈ છે.

ન ગણકારે જ મુશ્કેલી, વિપત્તિમાં શું મર્દ જ છે !
ન એને કોઈ પાસું છે, છતાં પાસાં બધાં એને.

કારિ: ઊં

હદ્ય મસ્તાન મસ્તાનો !

કંઈ બબડાટ એને ના, ન એને ગણગણાટ જ છે,
ન બકવાટ કશો એને સદા રાજ પ્રસન્ન જ છે.

પ્રભાતની ખુશબો જેવો શું ખુશખુશાલ કેવો તે !
ઉધાની લાલિમા જેવું કળા સૌંદર્ય એનું છે.

કશું બીજું ન જાણે તે, સ્વરૂપ નિજનું બધું જે તે,
હદ્ય નિજનું લહી મહાલે સદા નિજમાંહી નિજરૂપે.

જગત પછીથી કઈ રીતે શકે સમજે શું એવાને ?
હદ્ય મસ્તાન મસ્તાનો રમત નિજમાં જ મશગૂલ જે !

કારિ: ઊં

પ્રેમનું રૂપવૈવિધ્ય

કદીક શો પ્રેમ રાજ છે ! કદીક બિખારી જેવો છે,
કદીક મુફ્ફલિસ સરખો છે, છતાં શો કેફ એનો છે !

કદીક શો નભ્રમાં નભ્ર, કદીક કેવો ભભૂકે છે !
નયનને મુખથી ન્યારો કદીક કેવો જભૂકે છે !

નશો અલમસ્ત દીવાનો સહજ શો પ્રેમનો તે છે !
નજર હિલનીય આગળ તે કહીનો કહીં જ વહેતો છે.

સીમાડા પ્રેમને કોઈ ન કંઈ બ્રહ્માંડમાંયે છે,
ઉંડે નિભે શું અવતરવા હદ્ય સંબંધ સેવે તે !

કારિ: ઊં

હદ્યના પ્રેમ પાસે છે

જગતભરની બધી હકીકત હદ્યના પ્રેમ પાસે છે,
છતાં કેવો સરળ ભોળો ખરેખર પ્રેમ લાગે છે !

હદ્ય આકર્ષણે કેવો સતત ખેંચાયેલો રહે છે !
છતાં કશી તાણ ના એને, કશી ના ખેંચ એને છે.

રટણ બસ એકનું એક જ, મનન પણ મસ્ત તેનું તે,
બીજુ દુનિયાનું અસ્તિત્વ કશું કંઈ પ્રેમને ના છે.

મળે તેને હદ્ય મળવા, હદ્ય ભળવા શું ગળવાને !
હદ્યના પ્રેમને નિસ્બત રસીલી શી અનોખી છે !

કારિ: ઊં

બધાં કેવાં શું ડોલે છે !

હદ્યનો પ્રેમ એકલ છે, છતાં સર્વગ્રા પ્રસર્યો છે,
અજાણ્યું ક્યાંય ના એને, બધાંમાં પ્રીત એની છે.

આણુ આણુમાં ભરેલો છે, છતાં એકાકી પોતે છે,
છતાં શો સંગ સહુનો છે ! વળી સંપૂર્ણ નિઃસંગ છે.

કશી કોઈનીય તે પરવા હદ્યના પ્રેમને ના છે.
શું નિઃસ્પૃહી સાવ સંપૂર્ણ ખરેખર પ્રેમ એવો છે !

હદ્યનો પ્રેમ દીવાનો નશો એનો જબરજસ્ત,
બધાં કેવાં શું ડોલે છે ! નિશાનેબાજ અલમસ્ત !

કારિ: ઊં

જીવનને મસ્ત મહાલે તે

બધું તે જાણતો હોવા છતાં, ના જાણતો કંઈ છે,
કશાથી ના અનભિજ્ઞ હૃદયનો પ્રેમ એવો છે.

કળા, કારીગરી, વિદ્યા બધીયે જાતની જે તે
-પૂરી શી આવડે એને ! ખબરદારી શી એની છે !

હૃદય જેમાં અને તેમાં શું સર્વોપરી ખરેખર છે !
કળાબાજ પૂરો શો તે ! ન ધોકાબાજ કિંતુ છે.

જીવનનો ઓલિયો મસ્ત ફકીર કેવો દીવાનો છે !
જીવનની ભસ્મ ચોળીને જીવનને મસ્ત મહાલે તે.

કારિ: ઊં

મનાદિને પરોવીને

હૃદયના પ્રેમની લગની વહેલી એકખારી છે,
અખંડિત અસ્ખાલિત તે શી ! સતત પોતે ગતિશીલ છે.

કદી પણ તૂટતી ના તે, કશાથી તે ન છટકે છે,
જીવનમાં લક્ષ્યવેધી શી ! સતત બસ એ જ ચિંતવન છે.

જીવનની સર્વ સર્કિયતા વિશે એની ગતિ તે જે
-શી એકની એક એની એ ! કદી તોલી જતી ના તે.

કદી વિહ્લવળ થતી ના તે અચલ શી નેમ એની છે !
મનાદિને પરોવીને શું નિજ વિશે રખાવે છે !

કારિઃકુ

હજેલો ને ભજેલો છે

હદ્યનાં પ્રેમ ને મહોબત હદ્યની સાથ કરવાને,
શી તાલાવેલી, તત્પરતા અહર્નિશ ઓર દિલ રહે છે !

શરમ, સંકોચ, મર્યાદા કશાં ના પ્રેમને તો છે !
ગતકડાં પ્રેમનાં તો શાં ઉઘાડેછોગ ખુલ્લાં છે !

ઇટેચોક બધે જ્યાં ત્યાં નજર દિલથી પસારે તે,
થવા તાદાત્મ્યથી એક સ્વર્ધર્મ પ્રેમનો શો તે !

જગતજન પ્રેમને સાચા સ્વરૂપમાં કંઈ ન પ્રીછે છે,
બધાં સાથે છતાં પ્રેમ હજેલો ને ભજેલો છે.

કારિઃકું

હદ્યના પ્રેમનો ધર્મ

હદ્યના પ્રેમની લગની શી એકની એક થઈ ગઈ છે !
નશીલી ધૂન તો એની હદ્ય લાગુ પડેલી છે.

હદ્યમાં તાન ભરપૂર છે, હદ્ય મસ્તી ચઢેલી છે,
ઉછળતી ભરતીની છોળો, હદ્ય જ્યાં પ્રેમ સ્પર્શો છે.

પ્રવેશી અંતરે એક જ થવા દિલ પ્રેમ જંખે છે,
હદ્યના પ્રેમનો ધર્મ થવાનો ઐક્ય, સાચો તે.

પ્રવેશાવા જતાં એને હદ્ય સહકાર સંપૂર્ણ
-સરળ જ્યાં ના મળે તોયે, છતાં ના પ્રેમ ઠંડો ત્યાં !

કારિ: ઊં

જવા હોમાઈ યજો તે

ખરેખર પ્રેમને નિસ્બત હૃદયના ભાવ સાથે છે,
કશું ખપનું ન એને છે, ન જેમાં ભાવ જીવતો છે.

ઉમળકા ને ખુમારીનું ભરેલું બિંદુ બિંદુ તે,
શું એવું એનું ભોજન તો બલિદાન જ સમર્પણ છે !

ભળી, ગળી એક બનવાનો સહજ એનો સ્વભાવ જ છે,
અનાદિનો સતત ચાલ્યા કરંતો યજો એવો છે.

પળેપળી, સમર્પણની શી રમજટ આહુતિની છે !
બધું સર્જયેલું જે તે જવા હોમાઈ યજો તે.

કારિઃકું

સતત ચાહવાતણો ધંધો

હદ્યના પ્રેમનો ધંધો સતત ચાહવાતણો શો છે !
કશી ઊણાપ ન તેમાં છે, પૂરો નિષ્ણાત તે વિશે.

કળા, કુનેહ, કૌશલ્ય બધી વાતે નિપુણ જ તે,
બધી યુક્તિ પ્રયુક્તિઓ નજર એને ચઢે છે જે.

હદ્ય સતકાર, સહકાર ઉમળકાથી શું દેખાતાં !
ઝૂલે, ઝાલે અનેરો શો અનેકેવિધ દિશામાં !

અજાણ્યું કયાંય ના એને, પરિચય શો બધાંનોયે !
મળે તેને શું જાણી લે ! કશું અદભુત ન રાખે છે.

કારિઃકુ

હદ્યની ઘેલછા એની

તુમાખીથી ભરેલો શો ! મિજાજ ઓર વળી શો તે !
નશો એનો ખરેખર શો ! ખુમારીથી ભરેલો છે.

કદીક ચુલામ પણ થાયે, કદીક શો શહેનશાહ જ તે !
કદીક મેંદીની પેઠે શો વટાઈ તે જ જાયે છે !

મળી, ભળી તે હદ્ય ગળવા સ્વભાવ જ પ્રેમનો શો છે !
તલપ બસ એકની એક જ નિરંતરની લગન દિલને.

હદ્યની ઘેલછા એની શી ગાંડીતૂર લાગે છે !
વળી વળીને, લળી લળીને હદ્યનો પ્રેમ ચાહે છે.

વફાદાર શું સંપૂર્ણ છતાં ના એકસરખો તે !
કદીક પોતાનું ધાર્યું તે કળે કરીને કરાવે છે.

કારિ: ઊં

હરિ દરબારની ચાવી

હરિ દરબારની ચાવી હદયના પ્રેમ પાસે છે,
બધો રુઆબ દરબારી અને શો ઠાઈ એનો છે !

બધું ખેદાનમેદાન ઊલટપાલટ કરી દે તે !
કશું પક્વ્યા વિના બાકી રહેવા પ્રેમ ના દે છે.

૨જે ૨જનું સમર્પણ તે અધૂરું લાગતું એને,
શું ઈશ્કી પ્રેમની રગરગ સમર્પણથી ભરેલી છે !

જવન નવજ્યોત પ્રગટાવા શી શક્તિ પ્રેમની તે છે !
પ્રકાશી પ્રેમ પ્રજ્વલિત થૈ પસારો પ્રેમનો શો છે !

કારિઃઅં

હદ્યની ગોલમસ્તી છે !

ઉછળી તોઝાન કરવાની, હદ્યથી ગોલ કરવાની,
ખરેખર પ્રેમની કેવી હદ્યની ગોલમસ્તી છે !

સતત રમવું, રિસાવાનું, મનાવાનું, પજવવાનું,
ધમાચકડી મચવવાનું અતિશય પ્રેમને ગમતું.

ચઢી ઉછેંગમાં કૂદી, કૂદીને ભેટવાકેરી,
રસીલી ભાવ ઊર્ભિની ઊણાયુક્ત મસ્તી શી !

કળા મસ્તી જુદી જુદી રમત રમવા જ આનંદે,
હદ્યના પ્રેમને ભરતી ઘડી ઘડી કેવી ચઢતી છે !

કારિ: ઊં

કદીક પ્રેમ ભભૂકે છે

કદીક અધીરો થતાં પ્રેમ બને છે આકરો શો તે !
અને પદ્ધી જંગલી જેવું ખરેખર કેવું વર્તે તે !

જગતજન તે ન સમજે છે, સ્વરૂપ મૂળ પ્રેમનું જે તે,
કરે રંજાડ દેખીતા, ન કેં ઠેકાણું જેનું છે.

ઉછળી ઉછળી, કૂદી કૂદી, ફરી ફરી ઓર જુસ્સાથી,
વિખેરી સર્વ દેવા શો થતો તત્પર ખરા હિલથી !

બધું ખેદાનમેદાન ઊંઘુંચતું કરી દેવા,
ભયંકર રૌદ્ર સ્વરૂપે શો કદીક પ્રેમ ભભૂકે છે !

કારિઃઅં

રસે કેવા ગળેલા છે !

ન માથું દેખીતું એને, નયન ના દેખીતાં એને,
નયન, મુખ તે છતાં એને રસીલાં ભવ્ય કેવાં છે !

કંઈ ના વ્યક્ત વાણી છે, છતાં અણસાર જગ્બર છે,
બધું ચાલે જ અણસારે, ઈશારો ગૂઢ કાણી છે.

કશો અણસાર, ઈશારો ભલે ના હો, છતાંયે તે
-હદ્ય છૂપી રીતે સૂક્ષ્મ, બધું પરખી જ લેતો છે.

હદ્યના પ્રેમને વ્યક્ત થતાં અડયણ કશી ના છે,
છતાં સહકાર સામેથી હદ્ય હોતાં વહે રસ જે.

રસિક તે પ્રેમના રસની રસીલી કથની છાની છે,
ભગીરથ કંઈક મોટા શા રસે કેવા ગળેલા છે !

છાનિઃકું

મહાસાગર ભર્યો રસનો

ઘડીક પળમાં નજર એની કરોડો ગાઉ પહોંચે છે,
ન એની કોઈ સીમા છે, કશાથી બદ્ધ તે ના છે.

ગતિવાળો સહજ પોતે, છતાં એને ગતિ ના છે,
સ્થગિત તોયે ન તે ક્યાંયે, સ્વયંભૂ રીત સધળે છે.

નજીકમાં સાવ નજીદીક છે, હૃદયથી સાવ પાસે છે,
છતાં એને જ કોઈયે ન ઓળખતું જરા પણ છે.

હૃદયનાં કેંદ્રબિંદુમાં સહજ સૂક્ષ્મ જ રહેલો છે,
મહાસાગર ભર્યો રસનો, છતાં શાં લોક તરસ્યાં છે !

કારિ: ઊં

નયનના ઈશ્કને લટકે

સ્વતંત્ર એ મિજાજી છે, ગતિ બસ ભાગ એક જ છે,
મળી, ભળીને, ગળી હદયે થવાની શી લગન એને !

હદય મૌન ચડીચૂપ જ સહજ કેવો રહેતો છે !
ઈશારા તે છતાં એના ન છાના તે કદી રહે છે.

નયન સૂક્ષ્મ વળી ગૂઢ શું લટકામાં રહે એના !
નયનના ઈશ્કને લટકે બધા જે તે જ છે મોહ્યા.

કશો પણ કોઈ અપવાદ હદયના પ્રેમને ના છે,
સહજ આકર્ષણો એના બધા પીગળી ગયેલા છે.

કારિ: ઊં

જીવન અલગારી વેશ જ છે

અલખ જે પ્રેમ જીવનનો મળી, ભળી ને ગળી જઈને
-અનોખો વેશધારીને, અજાયબ રીત વર્તે છે !

મિજાજુ દોર એનો છે, સ્વતંત્ર જ મૂળમાંથી તે,
કહ્યામાં માત્ર પોતાના, જીવન અલગારી વેશ જ છે.

ભરોંસા પર સદા એનો જીવન વ્યવહાર ચાલે છે,
સહજ દિલ આત્મવિશાસે હદ્ય નિબ્રાંત શો રહે છે !

હદ્ય પ્રિય કાજ એને શા ઉમળકા, કોડ ઊઠે છે !
થવા દિલ આત્મસંતોષ સમર્પી દે જીવન નિજ તે.

કારિ: ઊં

સ્વરૂપ અદ્ભુત ન્યારું છે !

સતત બસ એકની એક જ રમત રમવા વિશે દિલને
-હદ્ય આહ્લાદ આનંદ અનેરો શો સ્ફુરંતો છે !

હદ્ય આહ્લાદ આનંદ હદ્યના પ્રેમનું તો જે
-સહજમેળે પ્રગટું છે, સ્વરૂપ પ્રત્યક્ષ દિલથી તે.

હદ્યના પ્રેમનાં કેવાં બહુ પાસાં બહુવિધ છે !
વળી પ્રત્યેક પાસાનું સ્વરૂપ અદ્ભુત ન્યારું છે !

બધાં સંસારી જે રમતાં નરી સંસારી વૃત્તિમાં,
સમજવા ના અધિકારી હદ્યના પ્રેમને સાચા.

કારિઃઅં

હદ્યનો પ્રેમ શો મસ્ત !

સતત ચાલ્યા જ કરવાની પડી ગઈ ટેવ દિલને છે,
હદ્યથી તે રમત વિશે સદા ગુલતાન ત્યાં મન છે.

હદ્યના પ્રેમને કોઈ પ્રીછે કે ના પ્રીછે તેની
-કશી દરકાર કે ચિંતા ધરે છે ના જરા સરખી.

હદ્યનો પ્રેમ શો મસ્ત શું એકાકાર સરખો છે !
સતત બસ રસમહીં એનો નિરંતર વાસ તો શો છે !

હદ્યના પ્રેમને ધંધો સહજ રસનો જીવનમાં છે,
સતત શું મહાલવા તેમાં સહજ તત્પર રહેતો છે !

કારિઃઅં

પ્રભુ સાક્ષાત્ પોતે છે

શી દિલમાંની મહત અદ્ભુત ખરેખર ખુશબો જે છે !
જવન સમૃદ્ધ થતું જઈને શું નવપત્રલિવિત બનતું છે !

હદ્યના પ્રેમની ઉન્મત્ત ખૂબી શી શી નિરાળી છે !
જવન તે ઊર્ધ્વમાં ઊર્ધ્વ ચઢાવી અવતરાવે છે.

પ્રકૃતિમાં રમે પોતે રહી અસ્પૃશ્ય સંપૂર્ણ,
ઇતાં પોતે થઈ તદ્વાપ ધરે અનંતનાં રૂપ.

કશું પણ એક્યે રૂપ, વળી પાછું ન તેને છે,
હદ્યનો પ્રેમ એવો તો પ્રભુ સાક્ષાત્ પોતે છે.

કારિઃકું

અખૂટ શો પ્રેમ દિલનો છે !

હદ્ય ના માત્ર જાણ્યો તે, હદ્યથી મહાલી જાણ્યો છે,
જીવનમાં મસ્ત ઉપયોગ કૃપાથી શો થયેલો છે !

ખમીર ખુમારીનો કેવો નશો ચેતન ભરેલો જે !
જીવનને થનગનાવીને બનાવે છે રસીલું તે.

પળેપળનો જ આનંદ ભર્યો રસથી નીતરતો જે,
હરિપદ મૂળ અસ્તિત્વ જીવન પ્રત્યક્ષ કરી દે તે.

ભલે વપરાય અઠળક તે છતાંયે તેટલો રહે છે,
ઘટે કે ના વધે એવો અખૂટ શો પ્રેમ દિલનો છે !

કારિ: ઊં

કરામત તે હરિની છે

જીવનમાં તો હદ્ય સોબત સતત તે પ્રેમની શી છે !
સહજ દિલ ભાવ સંવેદન થકી જીવવું ગમેલું છે.

હદ્ય ના ક્યાંય જુદાં છે, સહજ એક ભાવમાં શાં તે !
થવા જુદાપણું ક્યાંયે હદ્યને ના જીવનમાં છે.

ઇતાં કેવું કળા ગૂઢથી થયેલું છે જુદું તે તે !
હદ્ય ઐક્ય અનુભવવા કરામત તે હરિની છે.

હદ્ય પાસે હજી પાસે, નિકટ પાસે હદ્યમાં તે,
પ્રવેશી અંતરે એક જ અનુભવવાની રંગત છે.

કારિઃઅં

દર્શન

બહુ ઉત્કટ અભિલાષા હદ્ય દર્શનની શી રહે છે !
વિના દર્શન મજા દિલની કશી ના ફોરતી રહે છે.

થતાં દર્શન, હદ્ય રસમાં શું એકાકાર તલ્લીન છે !
વિના રસ કંઈ જ અસ્તિત્વ કશાનું દિલ ન ત્યાં રહે છે.

બધું ભરપૂર રસથી છે, રગેરગમાં શું પ્રસર્યો છે !
તદાકાર પૂરેપૂરો રસામૃત પાનથી શો તે !

જવન સાથે વણાયેલી બધી મૂળનીય પ્રકૃતિ જે,
હદ્યનો પ્રેમ શો એને નૂતન દર્શન કરાવે છે !

હદ્યનો પ્રેમ જબ્બર શો અનંતાનંત પોતે છે !
બધાંમાં છે છતાં પાછો શું એકાકી જ પોતે છે !

ਹਰਿ:ਤੱ

ਖੰਡ - ੫

ਪ੍ਰੇਮਰਸ

ਖਰੇਖਰ ਪ੍ਰੇਮ ਏ ਤੋ ਸ਼ੁੰ ਹਰਿਨੁੰ ਲਾਡਲੁੰ ਰੂਪ ਛੇ !
ਹਰਿ ਪ੍ਰਤਿਕਾ ਸਾਕਾਰ ਥਧਾ ਛੇ ਪ੍ਰੇਮਰੂਪ ਜ ਤੇ.

હરિઃઓ

હરિનું લાડલું રૂપ છે

હદ્યના પ્રેમનો અજિન હદ્ય ધગધગતો જલતો છે,
શી અજિનની મહાશક્તિ સફાયટ સ્વચ્છ કરી સૌ દે !

પ્રચંડ જ આગનો તાપ થવો અધરો સહન દિલ તે,
મનાદિમાં ભરેલો હો નિરંતર ભાવ, અમૃત જે.

ખરેખર પ્રેમ એ તો શું હરિનું લાડલું રૂપ છે !
હરિ પ્રત્યક્ષ સાકાર થયા છે પ્રેમરૂપ જ તે.

હદ્યમાં ને હદ્યથી તે હદ્યની ગેલ કરવાની,
અનેરી મોજ આનંદ હરિની સાથ મહોબતની.

હારિઃ ઊં

સુજાડીને જ પ્રેરાવ્યો

હદ્યથી રસ પીવા કાજે શું તલપાપડ થયેલાં સૌ
-મનાદિમાં શું પ્રજ્વલતો ઊંડો તલસાટ જાગેલો !

હદ્યના તે જ તલસાટે બધું સમર્પવાનું જે
-સુજાડીને જ પ્રેરાવ્યો ચરણ સૌ અર્પા દેવાને.

બધો સંસાર ને માયા મમત્વ સૌ પ્રકારે જે,
હદ્ય તુજ ભક્તિ પ્રેરાવી બધું મુકાવી દીધું છે.

ભગીરથ, ભવ્ય ને ભારે સમર્પણ તે થવા કાજે,
નહોતી શક્તિ મુજ એવી, કૃપાથી સૌ થયેલું જે.

કારિઃકુ

ખુમારી બાદશાહીથી

ચમત્કારિક ભંડાર, ખજાનો પ્રેમનો શો છે !
ખૂટ્યો કેમે ખૂટે છે ના, ભર્યો ભરપૂર ભરચક છે.

હદ્યના પ્રેમની મસ્ત ખુમારી શી નશીલી છે !
ખુમારી બાદશાહીથી ચઢિયાતી ખરેખર તે !

ખીલેલા પ્રેમના ભાવે પરિણામ જ ખુમારી છે,
હરિના ભાવની ખુશબો, સુરખી, સુરભિ રસીલી છે.

વિસ્કુરિત પ્રેમની લાલીભરી ખુમારી ભભકે છે,
ખુમારી પ્રેમની ભક્તિ થકી પ્રસરેલ જ્યાં ત્યાં છે.

ખુમારી એવીનો પ્રેમ સમર્પિત થઈ જતો શો તે !
હદ્યનો પ્રેમ તો કેવો સદા ખાલી જ ખાલી છે.

કારિઃકુ

હદ્યના પ્રેમનું કેવું

ઘડી પળના જ જીવનનું શું મૂલ્યાંકન ખરું જે છે !
હદ્યના પ્રેમનું કેવું મહત્વ જ્યાં ભરેલું છે !

હરિનો ભાવ પ્રત્યક્ષ જીવન સાકાર પ્રગટે જે,
હદ્યના પ્રેમના રૂપે પ્રકાશે છે જીવનમાં તે.

હદ્યના પ્રેમની ઉત્કટ શી તાલાવેલી લાગે છે !
ઉડે ઉડે જીવનમાં તે શી અવતરવાની લાગે છે !

હદ્યના પ્રેમને ક્યાંય કશી નિસ્બત ન કોઈ છે,
જીવનમાં ઝંખતો ભળવા થવા નિજ કર્મ નિજરૂપે.

હાર્દિક અંણા

ખરેખર પ્રેમ જાણો છે !

હૃદયના પ્રેમ તો જંખે જીવનને એક કરવાને,
પરંતુ અધવચે કેવા પહાડો કંઈક ઊભા છે !

દીવાલો દુર્ગાની કેવી, જીવન વર્ષે ખડી થઈને
-હૃદયના પ્રેમને કેવો બહુ જ થડકાવી મારે છે !

પરંતુ વજ જેવો તે કશાથી કેં ન ધૂજે છે,
અડીખમ પહાડના જેવો નશે તરબોળ ઊભો છે.

કશાથી તે નથી ઉરતો અભયમાં શો શિરોમણિ તે !
શું ન્યોધાવર થવાનું તો ખરેખર પ્રેમ જાણો છે !

હાર્દિક અંનુભૂતિ

હદ્યના પ્રેમનું જરણું

જરવવો પ્રેમ હૈયાનો ન સહેલો કોઈ રીતે છે,
પચવવો તો પછી એને કઈ રીતે જવનમાં તે ?

જવનની ઊર્ધ્વતમ કોઈ ભૂમિકા જે પરિપક્વ
-થતાં, તેમાંથી ઉદ્ભવતો, હદ્યના પ્રેમનો ઝોત.

હદ્યના પ્રેમનું જરણું વધ્યા કરતું સતત રહે છે,
પલાળીને, ભીજાવીને મૃદુ જે તે બનાવે છે.

જવનમાં પ્રેમવર્ષથી શું ગાંડાતૂર થવાયું છે !
નશે ચકચૂર શું મશગૂલ ખરે ઉન્મત થવાયું છે !

કારિઃકુ

અભેદ જ પ્રેમનું રૂપ છે

હદ્યનો પ્રેમ સમજે છે જવાનું આરપાર જ તે,
પથે ખચકાઈ અધવચ કંઈ રહેવાનું ન જાણે છે.

સતત એકીટશે દાણિ ખસ્યા વિના જ પળવાર
-રહે છે લક્ષ્ય વેધંતી, ખરેખર ચેતનાપ્રેરક

ભૂસી દેવા પૂરેપૂરો બધોયે ભેદ તત્પર તે,
બધાયે ભેદ ભેદાતાં અભેદ જ પ્રેમનું રૂપ છે.

કશું છેટુંય તલભાર ન સાંખી લે જરા પણ તે,
અભેદ જ માર્ગનો ગૂઢ જીવનનો તે પ્રવાસી છે.

કારિઃકુ

જીવનમોક્ષો અનેરો તે

બધુંયે દ્વૈત જે જે છે અનુભવવા જ અદ્વૈત તે,
હદ્યના પ્રેમનું એવું ખરું કર્તવ્ય માગ જ તે !

વિવિધતાથી ભરેલો જે નર્યો વિસ્તાર ભાગ્યો છે,
જુદું જુદું બધું રૂપ પણ અરૂપી પ્રેમનું તે છે.

જુદાં જુદાં પરસ્પર હો, છતાં જો પ્રેમ લાગ્યો છે,
પરસ્પર સંકળાઈને પરસ્પર ઔદ્ઘાત અનુભવશે.

અનુભવમાં શું એકત્વ જીવન જીવવા મળે જેને
-જીવનમાં મહાલવા અનહદ જીવનમોક્ષો અનેરો તે !

હારિઃ ઊં

રસીલું રૂપ ધારે છે

ન ચણાચણાટ એને છે, કશો બબડાટ ના એને,
કશો ખચકાટ ના એને, રુકાવટ ના કશી એને.

હદ્ય સત્કાર જ્યાં એનો થતો જ્યાં દિલ ઉમળકાનો
-નીરખવા રૂપ, રસ અદ્ભુત મળે શાં પ્રેમનાં ત્યાં જે !

ભૂમિકા જેવી જેની છે, ભૂમિકારૂપ બનતો તે,
હદ્ય પ્રવેશવા એવી શી ગૂઢ તરકીબ એની છે !

ખરેખર પ્રકૃતિમાં તે, થઈ જઈ પ્રકૃતિરૂપે
-પ્રવેશી તે વિશે પૂરું રસીલું રૂપ ધારે છે.

ભળે તે પ્રકૃતિ વિશે, પ્રકૃતિને વિષય ઊધ્વે
-અનુભવના પ્રદેશે જે પ્રવેશાવાનો હેતુ છે.

હારિઃ અં

રમત રમતો શી લાગે છે !

હદ્યના પ્રેમનો દાવો કશા પર કંઈ ન કરતો છે,
વટાઈ જઈ જ સંપૂર્ણ બને છે એકરસ શો જે !

થયેલા એકરસમાંથી જરે છે રંગ ત્યારે જે,
જવન તે રંગથી કેવું સુશોભિત ભવ્ય બનતું છે !

કદી ગાજ વગાડીને ન પોતાને ગાઢાવે તે,
છુપાઈ છાનુંમાનું શું રમત રમવાનું જાણો છે !

ન એને કોઈ પડદો છે, છતાં પડદાની પાછળ તે
-લપાઈને છૂપી છૂપી, રમત રમતો શી લાગે છે !

કાર્યાલાય
કાર્યાલાય

કદી ગણકારતો ના તે

કળાલીલા હદ્યપ્રેમતણી ગૂઢ અજબ શી છે !
કશી તાકાત કોઈની સમજવાની ન તેને છે.

નશીલી ને રસીલી છે, ગજબની દિલ રંગત તે,
હદ્ય વિશે પ્રવેશીને મહોબત, મોજ માણો તે.

કશી અડયણ, કશું નડતર કદી ગણકારતો ના તે,
જીવનમાં મહાલવા રસથી મહદ આનંદ શો એને !

હદ્યના પ્રેમનું મિલન ભલે સ્થૂળ લાગતું તે છે,
પરંતુ હેતુ ત્યાં કોઈ રસીલો ગૂઢ ન્યારો છે.

કારિઃકુ

થવા તે એક તલસે છે

હદ્યના પ્રેમને રસ, રસ, વિના રસ કંઈ ન સૂઝે છે,
સતત ગુલતાન મસ્તાન, હદ્ય રસમાં વિરાજે છે.

ખરેખર પ્રેમનું વ્યક્ત જીવંતું ચેતતું લક્ષણ,
પ્રગટતાં રસ વહેતો જે ખરેખરનું જ તે જીવન !

વિના રસ જીવવું પળ પણ બની શકતું કદી ના તે,
રસીલું પ્રેમથી જીવવું ઊછળતે રસ મધુરું તે.

હદ્યને પ્રેમ જ્યાં લાગે નસેનસને રગેરગને,
શું આકર્ષણ રસીલું તે બધે કેવું જમાવે છે !

શી તલભરની જુદાઈ કેં ન સાંખી પ્રેમ તે લે છે !
થવા તે એક તલસે છે, થતાંમાં ઔક્ય જંપે છે.

હારિઃ ઊં

પળોપળ રસતણો દરિયો

હદ્યના પ્રેમ ઉદ્રેકે થતું છે ખુશનુમા જીવન,
રગેરગ ને નસેનસમાં રસે છલકાતું નવચેતન.

પૂરું તળિયેથી પરિવર્તન થયા કરતું અલૌકિક શું !
છતાં ઉપરથી તો એવું અને એવું જ લાગે છે.

બધી ઠંડિયના વિષયે નૂતન રસનો અનુભવ છે,
પળોપળ રસતણો દરિયો શું ઊભરાતો જ મદથી છે !

જીવન, જીવન વિશે મૂળે થયેલું ઓતપ્રોત જ છે,
જૂની આંખે નવાં ચશમાં રસે પહેરાવી દીધાં છે.

કારિઃઅં

ધુપાયેલો જ રસ શો છે !

સહજ આનંદ રસહેલી સતત જીવનમાં વરસે છે,
કશું ભંગાણ એમાં તો કશાથી પણ ન પડતું છે,

અડોઅડ સર્વ જે તે છે, રસે લદબદ થયેલું છે,
બધું રસથી છવાયું છે, રસે જે તે રસાયું છે.

પવન, આકાશ, જળ, પૃથ્વી, પ્રકાશ પાંચ તત્ત્વોયે
-બધાંયે ઉદ્ભબેલાં છે, ખરેખર રસ થકી તે તે.

જુદું જુદું ભલે જે તે બધું દેખાતું લાગે છે,
પરંતુ મૂળમાં તેના ધુપાયેલો જ રસ શો છે !

કારિઃઊં

સતત બસ રસ અને રસ છે

ન કંઈ લઘુન, ન છઘુન છે, સતત બસ રસ અને રસ છે !
હદ્ય આનંદના રસમાં છલોછલ દૂબી નાહે છે.

હદ્યના પ્રેમને કેવું રસાનંદ એ જ ભોજન છે !
રસાનંદ ભસ્મ એને છે, અવરને કાચો પારો તે.

હદ્યનો પ્રેમ સંસાર થકી કૂદી બહાર પડિયો છે,
કશી જંજીર ન એને છે, નર્યો શો મુક્ત સૌ રીતે !

કશીયે આળપંપાળ ન સ્વખનીમાંય એને છે,
ન અમથું, અમથું કંઈ એને , બધું જીવંત જે તે છે.

કારિઃકુ

બધું વિગલિત થયેલું છે

હદ્યના પ્રેમની કેવી ભયંકર ઘાસ જબરી છે !
પીવામાં રસહદ્ય મસ્ત છતાં ના તે છિપાતી છે.

પળેપળમાં સતત દિલનો સહજ રસ યજ્ઞ જલતો છે,
વિના અટક્યા જ આહુતિ સમર્પાઈ જતી સૌ છે.

થઈ થઈ દિલ ન્યોછાવર લળી લળી વારી જઈ જઈને,
અવતરણ આરોહણની શી હદ્ય રસ હેલી વર્ષ છે !

પળેપળ દિલ વિલીનતા છે, પળેપળ મન સભાન જ છે,
પરસ્પરનું કંઈ જ ભાન, પરસ્પરમાં ન ત્યાં રહે છે.

પરસ્પરનું હદ્ય ઔક્ય બનેલું ચેતનાત્મક છે,
હદ્ય રસમાં ભીજાઈને બધું વિગલિત થયેલું છે.

કારિઃઊં

રસામૃત એ જ જીવન છે

ફરી ફરી એકનું એક જ કૂપાથી જે ઊગેલું છે,
પ્રભુપ્રીત્યર્થ તે ને તે ભજવવાનું જીવનમાં છે.

નીરખવું એકનું એક જ ધરાવો કેં ન થાયે છે,
ચરણ અમૃતના રસને પીતાં, રસ શો જીવનનો તે !

હૃદય તલસાટ તીવ્ર જ છે, હૃદય બસ રસ અને રસ છે,
બધું જે તે રસાયેલું ખરેખર રસથી અદ્ભુત છે !

રસામૃત એ જ જીવન છે, બીજું જીવન ન જાણ્યું છે,
હરિનાં તે ચરણકેરી કૂપાની શી પ્રસાદી છે !

કારિઃકું

હરિના દિલની ગાદી

હદ્યપ્રેમ વિરલ વીર ખરે ધનભાગ્ય જેનાં છે,
ખરા બડભાગી એવા જે હદ્યથી તે સ્વીકારે છે.

હરિનો પ્રેમ વરવાને, હરિચરણે ફના જેણે
-સમપી જઈ જીવન કીધું, ખરે તે પાત્ર શ્રેષ્ઠ જ છે !

હરિની દિવ્ય લીલાની રમત રમવા ખરેખર છે,
હદ્યનો પ્રેમ સાર્થક તે હરિનું ભવ્ય સાધન છે.

હદ્યપ્રેમ હરિકેરી રમત રમવાની કેડી છે,
હરિના દિલની ગાદી હદ્યના પ્રેમ પર શી છે !

કારિઃઅં

હદ્ય તલસાટ એને છે

હદ્યના પ્રેમને કાંઈ ન સારું કે ન નરતું છે,
નિમિત્તો ભેટવા પોતે મળેલાંને શું ઉત્સુક તે !

ન કોઈને વિશે કાંઈ કશોયે ભેદ એને છે,
થવા કલ્યાણમાં રાજુ ખુશાલી પ્રેમને શી છે !

પ્રવેશાવા મળેલાંમાં શું તલપાપડ થયેલો તે !
વહે ધસમસતો સંપૂર્ણ ગતિ એની ગજબની છે !

અજબ દુનિયા નિરાળી છે હદ્યના પ્રેમની શી તે !
ગજબ સૂક્ષ્મ હકીકત તે શી ન્યારી પ્રેમની તે છે !

શી ઈતેજારી ભડભડતી હદ્ય ભળવા જ બળતી છે !
સમો જવાળામુખી ઉત્કટ હદ્ય તલસાટ એને છે.

કારિઃકુ

શરણ વળગોલ છે તેને

પતિતમાંથે પતિત જનને હદ્યપ્રેમ સ્વીકારે છે,
સ્વીકારીને હદ્ય તેને થવા ઉન્નત ચગાવે છે.

સહાનુભૂતિ, હૂંફ, ઓથ, હદ્યમાં પ્રેરણા સાથ,
શરણ વળગોલ છે તેને જરૂર બખો હદ્યપ્રેમ !

હદ્યનો પ્રેમ લઈ બથમાં અનેરું વહાલ પેરે છે !
હદ્ય ઉખા જીવન પેરી જીવનદિષ્ટ શી ખીલવે છે !

સમર્પણ, ત્યાગ, બલિદાન, ફનારીરી સહજ લક્ષણ,
હદ્યના પ્રેમનાં શાં છે ! થતો પળપળ શું ન્યોછાવર !

કારિ: ઊં

ઇતાં પ્રસરી જતો તે છે

હદ્ય પ્રવેશવાકેરી કળા બસ પ્રેમ પાસે છે,
મધુરમાં શી મધુર તે છે, કળાતીત શી કરામત તે !

મધુર શો સૂક્ષ્મ રીતે તે અજાણ્યામાંય ઘૂસે છે !
અજાણ્યાનેય, જાણીતું ધીમે ધીમે કરી દે તે.

કંઈ પણ કોઈ વાતે તે કશાથી ના અજાણ્યો છે,
બધીયે આવડતકેરી કળા સહુ પ્રેમ જાણો છે.

નસેનસ રોમરોમે શો જણાઈ તે શકાયે ના,
ઇતાં પ્રસરી જતો તે છે, મૂદુ પગલે શું અણાઈ ત્યાં !

કારિઃકુ

ચૂકે કર્તવ્ય નિજ ના તે

વળગવાની હદ્યથી શી સતત બસ પ્રેમને લત છે !
સ્વીકારાતાં ન તે પાછો છતાં પડતો કદી ના છે.

ચઢવવાને કંઈક ઉપર હદ્યની નેમ એની છે,
સહજ એના પ્રયત્નોને ન કંઈ સહકાર દિલનો છે.

હદ્યનો પ્રેમ તોયે શો ચૂકે કર્તવ્ય નિજ ના તે,
ગમે કે ના ગમે તોયે છતાં નિજ ધર્મ પાળે તે.

ગળી જઈને પૂરેપૂરું ચિરંજીવ છાપ પાડે તે,
અસર ક્યારે શી તેની તે ઊળી નીકળે ન નિશ્ચિત છે !

કારિઃકું

બલિહારી રસીલી છે

હદ્યના પ્રેમની છો તે ભલે પ્રકૃતિ માધ્યમ છે,
સવાર થઈ જ બેઠેલી ન માથે પ્રકૃતિ તે છે.

હદ્યના પ્રેમની ઓર બલિહારી રસીલી છે !
હદ્યથી ચાહવાની શી મહોભત દિલ એની છે !

સતત નોભત મહોભતની વગર અટક્યા શી બઢતી છે !
અનાહત નાદથી તેના ચઢ્યાં રંગો મનાદિ છે.

શું અવતરી રોમરોમે શો સતત તે ગેલ કરતો છે !
રમ્યા વિના ઘડી પળ્યે જરા એને ન ચાલે છે.

કરિઓ

ખંડ - ૬

જાંખી

નયન તે એકલાં માત્ર ન તે મોહી પડેલાં છે,
મનાદિને નયનકેરો થઈ સ્પર્શ ગયેલો છે.

કારિઃઊં

અવસ્થા વાસ્તવિક જે છે

સહજ મૌલિક શી ચેતનની અવસ્થા વાસ્તવિક જે છે !
ખરે એવી ભૂમિકાનું સ્વરૂપ જે વ્યક્ત પ્રેમ જ છે.

થતી એવી અવસ્થા તે શી સ્વાભાવિક ભૂમિકા છે !
જીવન પલટાયેલાકેરું ખરે ! પ્રત્યક્ષ લક્ષણ તે.

થતી ચેતનની ઝાંખી તે અલોકિક દિવ્ય રૂપની જે,
ખરેખર એથીયે મૌલિક શી નૈસર્જિકપણે વળી તે.

જીવનમાં ગુણધર્મો જે થતા પ્રાગટ્ય ચેતનના
-થવા જે માંડવાકેરી ભૂમિકા ‘ઝાંખી’ તે પણ છે.

કારિ: ઊં

થતાં જાંખી જીવનમાં તે

ભરી ભરી દિલ, નયન, મનથી પીધાં જાંખી કરેલી છે,
રસીલું ભાન જાંખીનું હરિમાં દિલ પલાણે છે.

થતાં જાંખીનાં દર્શનથી પ્રવર્તે છે ચમત્કાર,
શકે ના ઓગળી એવાં મનાદિ પીગળે પદ શાં !

હદ્યમાં જંખના ઉત્કટ, ભયંકર તીવ્રમાં તીવ્ર
-થતી જાંખીની શી રહે છે ! ચિરંજીવ તેથી હરિ દિલ.

શી પળની માગ જાંખીએ હદ્ય મનને હરિપદમાં
-દરાવી, શો સ્મરાવ્યો છે અકળ દિલ વેદનાથી ત્યાં !

થતાં જાંખી જીવનમાં તે પરત્વેની સહજ સતતે,
હદ્યની ધારણા મૌલિક જીવંતી શી વહે છે જે !

કરિઃઊ

નીરખવામાં જ છે લુબ્ધ

નીરખતામાં નયન ચોંટી જતાં કેવાં થઈ મુંઘ !
નયન ટગર ટગર ભાવે થતાં અનિમિષ ને સ્તબ્ધ !

ન પલકારોય ઉઠે છે, સતત બસ દશ્ય રમણીય જે
-નીરખવામાં જ છે લુબ્ધ, નયન મોહી પડેલાં છે.

નયન શાં એકલાં માગ ન તે મોહી પડેલાં છે !
મનાદિને નયનકેરો થઈ સ્પર્શ ગયેલો છે.

નયનને ઝાંખીની કેવી મનોહર લગની લાગી છે !
હદ્ય તે લગનીના તાને સતત બસ નાચી ઉઠે છે !

કારિઃકુ

નયન તે સાવ ન્યારાં છે

નયન આધારનાં કેવાં જુદાં જુદાં બહુ રીત છે !
મનાદિનાં નયન તે તે જુદા જુદા પ્રકારે છે.

નયન જે તે બધું દેખે નયનની વાત તે ના છે,
નયન અંતરતણાં જે છે, નયન તે સાવ ન્યારાં છે.

હદ્ય ચેતનની ભૂમિકાતણાં નયનો ખીલેલાં જે,
ખૂલેલાં વ્યાપી સંપૂર્ણ બધે પ્રસરેલ જ્યાં ત્યાં છે.

જવનના પ્રેમનાં એવાં નયન જે સર્વવ્યાપક છે,
નયન એવાંતણી ખૂબી કળાને કોણ પ્રીષે છે ?

કારિ: ઊં

પ્રતિષ્ઠિત દિલ થતી શી છે !

હદ્ય જેના પરત્વેનો ઊંડો જ્યાં પ્રેમ લાગ્યો છે,
હદ્યમાં ઝાંખીનું તેવો ખરેખરું મૂલ્ય પ્રીષે છે.

થયેલી માગ પળવાર, ચિરંજવી છતાં શી તે
-જીવનમાં સ્થાન પામીને, પ્રતિષ્ઠિત દિલ થતી શી છે !

હદ્યના પ્રેમનો ભક્ત થયેલો જે ખરેખર છે,
હદ્ય તે માગ ઝાંખીનું રહસ્ય મૂળ સમજે છે.

પ્રવેશાવા હદ્ય વિશે ઊંદું, ઊંડે જ અંતરમાં,
અનુભવ ઝાંખીનો દિલમાં થયેલો કામ લાગે ત્યાં.

કારિઃકુ

થતી જાંખી શી તેવાને !

નિરંતરથી, નિરંતરનો હરિને જે વરેલો છે,
હરિ જેનાં મનાદિમાં ચહી હદ્યે વસેલો છે.

નિરંતરનો હદ્ય જેને હરિમાં ભાવ ચોંટચો છે,
ખરેખર માત્ર તેવો જ શું પાત્ર જાંખી અર્થે છે !

અનુગ્રહ એમનો એમ હરિ પણ ના કરી દે છે,
હરિના રાજ્યા વિશે જીવે ત્યાં આવવું પડશે.

જગતના સર્વ વ્યવહાર થકી વહાલો હરિ જેને,
હરિ જેના પરે રાજુ, થતી જાંખી શી તેવાને !

કારિઃકું

અનુગ્રહથી હરિજાંખી

કનાગીરી સમર્પણાની શી વર્ષા હેલી વર્ષો છે !
નિરંતરનાં સ્મરણા, કીર્તન, ભજનભાવ નિરંતર છે.

નિરંતરનો ભજનભાવ ચઢે ઉચ્ચોચ્ચ જ્યાં શિખરે,
તપ, ત્યાગ, બલિદાન થતાં મેળે રહે ત્યારે !

પછી ભક્તિતણો કેવો ઝુવારો રંગ ઊડે છે !
અનુગ્રહથી હરિજાંખી થતી કોઈ ભાગ્યશાળીને !

‘હરિની ઝાંખી લાયકની થયા વિના ભૂમિકા તે
-થવી ઝાંખી મહા દુર્લભ’, અનુભવી, તેથી ગાયું છે.

કારિઃઅં

નિરંતર ભક્તિથી દિલમાં

સમરણ દિલ જાંખીનું ઊડા હદ્ય પાતાળમાંથી તે
-નીકળી સોંસરવું કેવુંયે જતું છે આરપાર જ જે !

થતી ના એમની એમ હરિની જાંખી ખાલી તે,
તપશ્ચય્યિ, તપ, ત્યાગ હદ્યની ભક્તિ માગી લે.

નિરંતર ભક્તિથી દિલમાં રમ્યા કરતો રહે જ્યાં તે,
થતાં અનુગ્રહ હરિનો જ્યાં થતી જાંખી કૃપાથી જે !

મહા બડભાગી એવો જે થયેલી જાંખી જેને છે,
હદ્ય તલસાટનો કેવો પછી ઉન્માદ વ્યાપે છે !

કારિઃકું

મનાદિ શાં નિરંતર રહે !

ગાહન ઊંડી તપશ્ચયર્ચ અને તપથી વળ્યાં ના જે
-ઘડી પળની શી ઝાંખીએ વળાવી પદ દીધેલાં છે !

અવળચંડાઈ કેવી કંઈ મનાદિની જીવનમાં જે
-જરીક સરખી શું ઝાંખીએ શી પાડી દીધી ઠેકાણે !

ઘડી પળ જે ન દરતાં'તાં , પળેપળ શાં ભટકતાં'તાં !
બધે જ્યાં ત્યાં જ નર્તતાં, શી ઝાંખીએ વળાવ્યાં શાં !

મનોહર મુંધ ઝાંખીએ નયન દિલ મોહી લીધાં છે,
હવે હઠતી ન પળવાર હરિવરની જ ઝાંખી તે.

ચહી ચહી ઝાંખીનું દર્શન જીવનમાં એનું એ સહજે,
થતાં આકર્ષણે મુંધ, મનાદિ શાં નિરંતર રહે !

કારિઃઅં

સતત બસ જંખના તે છે

થયેલી ઝાંખીએ મૂળથી જીવનને ફેરવાયું છે,
કરી દઈ મુંધ સંપૂર્ણ હરિપદમાં ઠરાયું છે.

હદ્યમાં એક લગની છે, હદ્યમાં ભાન એક જ છે,
શી ઝાંખી માત્ર જીવન તે ! સતત બસ જંખના તે છે.

શી વારંવાર ત્યાં ને ત્યાં નજર, મન ઠેરવાયે છે !
નયન પલકારમાં પણ શી મધુર ઝાંખી ઠરંતી છે !

હદ્યને મુંધ રસનારી શી સંજીવની અમૃત તે !
મરેલાંને જિવાડીને, નવું જીવન શું બક્ષો છે !

અલૌકિક દિવ્ય દર્શન તે ન સરખાવા જ ઉપમા છે,
થઈ ઝાંખી શું ઉન્મત્ત સકળ જીવન રસાતું છે !

કારિઃઅં

જાંખીની કેવી અસર

હદ્યમાં જાંખીની કેવી અસર ઊડી પડે છે જે
-ગરકાવ જાંખીમાં મનાદિ શાં રહે છે તે !

તદાકાર જ પૂરેપૂરું થઈ કેવું જવાયે છે !
રસાતું જાય આકર્ષણ વડે કેવું જીવન ઊડે !

પરાકાણ હદ્ય લગનીતણી ટોચે પહોંચે છે,
અખંડ જ ભાવનો શો ત્યાં પ્રવાહ મસ્ત વહેતો છે !

હદ્ય આનંદ સંપૂર્ણ, છતાં તેમાંય તે દિલનો
-હરિમાં પૂર્ણ તાદાત્મ્યતણા સુખનો અજંપો શો !

કારિ: ઊં

સતત દિલ આગ બાળો છે

થઈ એકવાર જે ઝાંખી સતત દિલ આગ બાળો છે,
સહજ બસ એ જ ચિંતવનમાં મનાદિને પલાણે છે.

શી પળવાર થઈ ઝાંખી છતાં ગજબ જબરજસ્ત
-શું આકર્ષણ જમાવ્યું છે ! હદ્યમાં તે હદ્યથી જે !

ફરી ફરીને, વળી વળીને હદ્ય તે ઝાંખી જંખે છે,
ચહી ચહીને જ લબકારા સડાકા મારતું મન જે.

ઘડી વાર જ હદ્યમાં જે થયેલી માત્ર ઝાંખી જે,
છતાં એણે ગજાવી, શું ઉથલપાથલ મચાવી છે !

કારિ: ઊં

કળા જાહુ શું ઝાંખીનું !

શી ઝાંખી માત્ર પળવાર થયેલી, દિલને તેણે
-હલાવી હચમચાવીને શું ઝાંખીમાં પરોવ્યું છે !

નયનની આગળે કેવી મધુરી ઝાંખી તરતી છે !
સતત બસ ઝાંખી ને ઝાંખી વિશે મન ડોલતું તે છે.

વિચારો ને વિચારો તે વિશેના દિલ જાગીને,
હદ્ય રમમાણ તેમાં ને સતત તેમાં રખાવે છે.

જગત વ્યવહારનું જે તે ભલે હો, તે છતાં તેમાં
-મનાદિ ના પરોવાયે કળા જાહુ શું ઝાંખીનું !

કારિઃઅં

કૃપા જાંખીની અદ્ભુત તે !

હદ્યમાં જાંખીએ કેવું સ્મરણ જબકાવી દીધું છે !
હદ્યમાં જાંખીએ જીવતો હરિને દિલ કરેલો છે.

ઘડી પળ ના સૂવા દે છે, ન નવરો સહેજ પડવા દે,
મનાદિમાં શી જાંખીએ હરિવર શો નચાવ્યો છે !

તળેઉપર સમૂળું સૌ કરી નાખી દીધેલું છે,
થયેલી જાંખીએ મુખને સમૂળગું ફેરવાવ્યું છે.

અભિમુખતાનું સાતત્ય થયેલી જાંખીએ હદ્યે !
-શું જન્માવી દીધેલું છે ! કૃપા જાંખીની અદ્ભુત તે !

કારિઃઅં

શું આકર્ષણ ગજબનું છે !

અહાહા ! ઝાંખીનું જબ્બર શું આકર્ષણ ગજબનું છે !
અતિશય લગની શી એની કશું ઓદ્ધું થતું ના છે !

સતત બસ જંખના એક જ વળી વળી તે પરત્વે દિલ
-મૂક્યા કરતું રહે દોટ, ન આકંક્ષા અવર કંઈ દિલ.

લપેટાયેલ લાગે છે લપસણામાં, છતાં મનથી
-અસર છાયા ન એની છે, ચમત્કારિક ઝાંખી શી !

પ્રતિષ્ઠા ઝાંખીની અંતર વિશે પ્રતિષ્ઠિત થયેલી જે,
ગમે તે કારણે છોને, પરંતુ ના ભૂંસાતી તે.

મનાદિ ઝાંખીમાં કેવાં પૂરાં તરબોળ રહેતાં છે !
થયા કેકે હુદય ઝાંખી, સહજ રીતે વિકસવું તે.

કારિઃકુ

અજબનું ગૂઢ આકર્ષણ !

નીરખવું એકનું એક જ વળી વળીને, ફરી ફરીને,
ચહી ચહીને જ ઉલટથી શું વારંવાર એનું એ !

હદ્ય જાંખી થતાં કેવું અજબનું ગૂઢ આકર્ષણ !
જતું જામી ગજબનું શું ! વિભૂટું ના પડે પળ મન.

શું કાઢે માર્ગ સોંસરવો નીકળી જઈ પાર જે તેની !
પછી પોતે બિરાજે ત્યાં બધું સામ્રાજ્ય નિજ સ્થાપી.

કળા શી કામણગારી તે ! પમાડે મોહ જે તે-ને,
ભલભલા મહારથી કેવા થયા શા મુંઘ શ્રીચરણે !

હરિ: ઊં

ચમત્કારિક નશો કેવો !

નયનથી જાંખીનું દર્શન થતાં શી મસ્તી ફોરે છે !
નદીનાં પૂરની પેરે બધે જ્યાં ત્યાં જ પ્રસરે છે.

ભવે પળવારની જાંખી પરંતુ દિલમાં તેણે,
સિહાસન શું બિધાવીને, તહીં સતા જમાવી છે !

થયેલી જાંખીની પ્રત્યે બધા આધારનું જે તે
-સતત આકર્ષણે તેના શું લુભ્ય, મુગ્ધ શાં રહે છે !

ચમત્કારિક નશો કેવો ! ચડસ તેનો અનુપમ છે,
વિના એના મનાદિ તો બીજે ક્યાંયે ન ફરકે છે.

કારિઃ ઊં

શી ઉત્કટ જંખના દિલ છે !

હદ્ય મનને ખરેખર તે શું લોભાવી દીઘેલાં છે !
રટણ બસ માત્ર એક જ છે, બીજું કંઈ ભાવતું ના છે.

ખૂબી જાંખીની અદ્ભુત શી ! કળા રસીલી નશીલી છે,
રમાડી નિજમાં કેવા નચાવ્યા ભલભલા દિલ છે !

થયેલી જાંખીની તીવ્ર શી ઉત્કટ જંખના દિલ છે !
હદ્યની વેદના તેની ન સહેવાતી જરી પણ છે.

થયેલી પળની જાંખીએ શું ગાંડોતૂર બનાવ્યો છે !
હદ્ય બસ જાંખી ને જાંખી નજર પળપળ પ્રવર્તે છે !

કરિ: ઊં

મનાદિને ખૂંપાવ્યાં છે

થયેલી પળની ઝાંખી તે નજરમાંથી ખસે છે ના,
મહીં દિલ જબકોળાતું તે પ્રતિષ્ઠા પામી અંતરમાં.

થયેલી ઝાંખીએ કેવાં મનાદિને ખૂંપાવ્યાં છે !
મનાદિમાંથી પળ વાર કદી ઝાંખી હઠે ના તે.

મનાદિને શું ઝાંખીએ નજરબંધી કરેલી છે !
સતત બસ એકની એક જ લઢણમાં તે પડેલાં છે.

શી લાગેલી સતત રફ છે ! ન બીજું કંઈ જ સૂઝે છે,
પરોવાયેલ ઝાંખીમાં પળેપળ શાં મનાદિ છે !

કારિઃકુ

જાંખીનો ચમત્કાર

હૃદયમાં જાંખીનો કેવો ચમત્કાર થયેલો છે !
 ‘નવીન કોઈ ચેતનાકેરો થતો હોય સ્પર્શ’ લાગે છે.

નૂતન આનંદનો ધોધ ઉછળતો શો જઈ તઈ તે !
 બધા આધારમાં ખૂણે ખૂણે મસ્તીથી વહેતો છે !

નયન એકીટશે નીરખ્યા કરે સુરખી રસીલી જે ,
 કુમાશ, સ્નિંધ, કોમળતા, મધુરપ દિવ્ય લાગે છે !

ભર્યુ ભર્યુ દિલ લાગે છે. શરીર રોમાંચ પ્રગટ્યા છે,
 અકલ્ય સુખનો વારો જીર્વતાં દિલ નાચે છે.

નૂતન કાયાપલટ, જૂનું જીવન તો ફેરવાયે છે,
 જૂની આંખે નવાં ચશ્માં અનન્ય જ ભૂમિકાનાં છે.

કારિઃકું

નવો અવતાર લીધો છે

જીવનને ઝાંખીએ કેવું રસિક અમૃત રસાયું છે !
રગેરગમાં, નસેનસમાં, આણુ આણુમાં શું ફાયું જે !

શરીરનો ખાસ ગુણધર્મ સમૂળો જડ સમો જે છે,
તહી રણકાર, ધબકાર, જીવંતા ઊપસાવ્યા છે.

જીવનમાં ઝાંખીએ કેવો ચમત્કાર શું સજ્ઞો છે !
લીલાંકુર ધરતીએ કેવો નવો અવતાર લીધો છે !

પળેપળનું જીવન મુખ વળેલું ઝાંખીથી ચરણે,
જીવનની બોલબાલા છે, નૂતન દર્શન શું ઝાંખીએ !

કારિઃઅં

અનુભવથી હું સમજ્યો છું

બલિહારી હું જાંખીની હદ્ય ગાતાં ન થાકું છું,
અનુભવથી હું સમજ્યો છું, ‘ખરું શું મૂલ્ય જાંખીનું’ !

ચરણના પ્રેમ અમૃતનાં ટીપાંનું પાન રસ મુંધ
-કરાવ્યું જાંખીએ મુજને બનાવી તે વિશે લુબ્ધ !

વળી વળીને સતત મનહું વળ્યા કરતું જ ત્યાં ને ત્યાં,
લઢણ બસ એકની એક જ સતત જેની શી જાંખીમાં !

શું શાસોશાસ જાંખીના હવે તે આ જવનના છે !
પીછો શાશ્વત જવનમાં મુજ લીધેલો છે જ જાંખીએ !

કારિ: ઊં

કૃપાથી ઝાંખીનું દર્શન

મહિમા, માણાત્ય ઝાંખીનાં કંઈ અમથાં ન ગાયાં છે,
નિચોડ શો અનુભવનો થયો જે દિલથી ગાયો છે !

ખરેખર ભક્તિથી દિલનો થયેલો યોગ્ય વૈષ્ણવ જે !
રસીલી યોગ્યતા પૂર્ણ સમજશે ઝાંખી ના દિલ તે.

ચરણમાં મુગ્ધ બનવા, બસ નયન લટકું હરિ તુજ છે,
જીવનમાં ઝાંખીએ તેવો અનુભવ દિલ કરાવ્યો છે.

કંઈક જન્મોની ભક્તિથી પડેલા દિલ સંસ્કાર,
ઉદ્યવર્તમાનથી પ્રાપ્ત કૃપાથી ઝાંખીનું દર્શન.

કરિઓ

ખંડ - ૭

દિલ

ધબકતું દિલ જેમાં છે, ઉછળતું દિલ જેનું છે,
ન પરખાયા વિના રહે તે શી દિલની વાત ન્યારી છે !

કરિ: ઊં

શી દિલની વાત ન્યારી છે !

હદયના પ્રેમમાં પૂર્જ સહજ દિલ તો ગળેલું છે,
બધાંનામાં બધું દિલ છે, બધે દિલ, દિલ પ્રવર્તે છે.

વિના દિલ કોઈ સહકાર કશાનો શક્ય કંઈ ના છે,
બધાં દિલની કરે વાતો, પરંતુ સર્વ મિથ્યા છે.

ધબકતું દિલ જેમાં છે, ઉછળતું દિલ જેનું છે,
ન પરખાયા વિના રહે તે શી દિલની વાત ન્યારી છે !

પ્રવર્તતું ખરેખર દિલ જીવનમાં મોખરે જ્યારે !
પછી જેમાં અને તેમાં નર્યો રસ, રસ, ભર્યો રસ છે !

કારિ: ઊં

યમતકાર જ ખરે દિલ છે !

જીવન જીવવાતણો રસ જે, જીવનમાં સ્વાદ લાગે છે,
જીવન આંનંદનો સ્પર્શ બધું દિલને જ લાધે તે.

હદ્ય રળિયામણું લાગે, મધુરું ને મધુરું તે,
શી અદ્ભુતતા જીવનકેરી બધું દિલને લીધે તે છે !

જીવન સુખ ભવ્ય ને દિવ્ય મહોબત દિલ જે મહાલે,
હદ્યનો પ્રેમ સાકાર થયેલો દિલરૂપે છે.

જીવનમાં દિલ જો છે તો, બધું જે તે રસીલું છે,
હદ્યના પ્રેમનો અદ્ભુત યમતકાર જ ખરે દિલ છે !

કારિ: ઊં

હદ્યના પ્રેમનું દિલ તો

હદ્યના પ્રેમનું દિલ તો ભર્યું અલમસ્ત ભાવુક છે,
ખરેખર કોઈ સંગાથે ન સરખાવાય તે દિલને.

ભર્યું ભરપૂર છલકાતું નૂતન રસથી પળેપળ જે,
પળેપળનો જુદો જુદો નૂતન અવતાર દિલનો છે.

હરિનાં પ્રેમરસ ભક્તિ થકી ભરપૂર દિલ જ્યારે,
મગતરાના સમું દિલ પણ બને છે તે હિમાલય શું !

રમંતું પ્રેમમાં જ્યાં તે ન દુનિયાનું જ તે દિલ છે,
ગરીબડી ગાય સરખું દિલ બને છે વજ સરખુંયે.

કારિ: ઊં

વળી દિલ જુદું જુદું છે

કશાનામાં મજા દિલથી વિના દિલ કંઈ પડે છે ના,
પ્રમાણિકતા, વફાદારી વિના દિલ સંભવે છે ના !

બધા હુગુણ ને ગુણ બધું અસ્તિત્વ દિલથી છે,
વિના દિલ કંઈ કશાનામાં પ્રવેશી ના શકતું છે.

જુદા જુદા પ્રકારોનું જુદું જુદું શું દિલ તે છે !
જુદી જુદી ભૂમિકાનું વળી દિલ જુદું જુદું છે.

જુદાં જુદાં જીવનકેરા તબક્કાનું જુદું દિલ છે,
બધી મીઠાશ મધુરપ છે ભળેલું સાથ દિલ જો છે.

કારિઃઅં

અનુગ્રહ, સાચું તે દિલ છે !

ખરેખરું દિલ જીવનમાં પ્રવર્તતું જવંતું છે,
જીવન જીવવાતણી લહેજત પછીથી ઓર લાગે છે !

ખીલેલાં પુષ્પના જેવી સુવાસ દિલની ફોરમ જે,
આશુ આશુ સ્પર્શી આધારે પરમ પમરાટ મહોરે છે !

સહસ્ર પાંખડીએ શું જહીં તે દિલ ખીલે છે !
પછી ત્યાં પ્રેમનો કેવો મધુર આસ્વાદ અદ્ભુત છે !

ખીલેલું દિલ પરિણામ જીવનની ભક્તિનું તે છે,
ચરણ રજની પ્રસાદીનો અનુગ્રહ, સાચું તે દિલ છે !

કારિ: ઊં

મળેલાં દિલનું અમૃત

જીવનમાં દિલના સગપણ સમું ના કોઈ સગપણ છે,
મળેલાં દિલના જેવું અમર જોડાણ ના કો છે !

મળેલાં દિલનું અમૃત જગે પીનાર કોક જ છે ,
ખરા શા મરજીવા તેવા જીવનમાં કોક પાક્યા છે !

રસામૃત પાન દિલ વિના કશાથી ના મળી શકશે,
વિસંવાદી ભલે છો હો છતાં જો દિલ સરળ શાં છે.

ખરેખરી દિલની કિંમત જીવનમાં કોણ પ્રીછે છે ?
વિના દિલનું જીવન જીવવું નર્ધૂ તે સાવ ફોકટ છે !

કરિ: ઊં

જીવન બદલાઈ જાયે છે

વિના દિલ તો જીવનમાં કંઈ ન રોનક ને ન રંગત છે,
વિના પ્રગટ્યા હદ્યપ્રેમ ન અસ્તિત્વ કશું દિલ છે.

જીવનમાં દિલને લીધે જીવન બદલાઈ જાયે છે,
જીવનમાં ફેરફારો પણ થતા છે દિલને લીધે !

જીવનમાં દિલ છે તેથી જીવન મધુરું શું લાગે છે !
મધુરી મુંધ મીઠાશ જીવનમાં દિલથી લાગે છે !

ખરેખરું દિલ છાનું તે કદી બેસી ન રહેતું છે,
ચઢીને છેક મોભારે બુલાંદે સાદ પોકારે.

કારિઃકું

પ્રગટતાં ‘દિલ’ મળતું છે

અખંડિત ભાવ જીવનમાં પ્રગટતાં ‘દિલ’ મળતું છે,
હદ્યના પ્રેમનું વ્યક્ત સ્વરૂપ પ્રત્યક્ષ તે ‘દિલ’ છે.

શી પ્રત્યેક ભૂમિકાનો બધો વ્યવહાર દિલથી છે !
‘ન સાંદું કે ન ઠારું ના’ કશું એવું જ દિલને છે.

ભજો છે જે વિશે તેમાં થતું તરૂપ ત્યાં ત્યાં તે,
બધા રસનું જ વિજ્ઞાન ખરેખર દિલ પ્રીણે છે !

શું એકાકાર સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ દિલ મૂળ છે !
ભજેલું ને ગજેલું છે, શી ભાવની વ્યક્તતા દિલ તે !

કરિઓ

તે નૂપુરઝંકાર પદના છે !

અડોઅડ દિલ દિલ દિલથી હદ્યભાવે થવાયું છે,
‘અભેદ જ દિલ થવાતાં પદ’ ખરી શરણાગતિ તે છે.

પછીથી દિલ હરિપદમાં નર્યુ તરબોળ રસથી છે,
‘હરિનો ભાવ’ એ દિલનું નિરંતરનું જ ભોજન છે.

હરિની ભાવના દિલને સતત જ્યતી શી પચતી છે !
શું શાસોશાસ દિલના તે નૂપુરઝંકાર પદના છે !

હરિનાં પદકમળ પાછળ સતત દિલ આ પડેલું છે,
જરી પળવાર પણ હરિનો ન દિલ કેડો જ મૂકે છે.

કારિ: ઊં

શું ભાવાતીત દિલ પ્રેમ !

હરિના દિલ તાળાંની કૂંચી તો પ્રેમ પાસે છે,
હદ્યના પ્રેમને વ્યક્ત થવાને ભક્તિ સાધન છે.

ગુણાતીત, પૂજી દ્વંદ્વાતીત હદ્ય પ્રતિબિંબ પાડે છે,
હદ્યના પ્રેમનું સાચું ખરું ઠરવાનું તે સ્થળ છે.

શું ભાવાતીત દિલ પ્રેમ હરિ ચરણો બિરાજે છે !
હદ્ય હરિને પ્રવેશાવા હદ્યનો પ્રેમ સાધન છે.

કળા જે સૂક્ષ્મ ને દિવ્ય હરિની ચેતનાની છે,
હદ્યના પ્રેમથી માત્ર થતી છે વ્યક્ત પોતે જે.

કરિઓ

બલિહારી કૃપાની તે

જીવનમાં દિલને મોટું મહત્ત્વ આપી આપીને,
તકેદારી ધરાવીને, ઉમળકે દિલ પરોવ્યું છે.

કદીક તે નેમ ચૂક્યું છે, કદીક તે ઘેય ભૂલ્યું છે,
છતાં દિલથી જીવનનિષા ન કંઈ છટકી ગયેલી છે.

મથામણ ને મથામણમાં પરોવાઈ જતાં સતતે,
થતાં ઝાંખી ઉધાની દિલ, શું દિલને હર્ષ વાયો છે !

મથામણમાં સતત દિલની ટકેલી જાગૃતિએ તે
-ચુકાવા લક્ષ ના દીધું , બલિહારી કૃપાની તે.

કારિ: ઊં

ભર્યું ભર્યું દિલ લાધ્યું છે

જવનમાં દિલ વિના ખપનું કશું કાઈ ન બીજું છે,
જવનને શોધી લેવાનું કરેલું દિલ વડે શું તે !

જવનમાં દિલને પ્રાપ્ત થવા કાજે મથાયું છે,
અગીરથ યત્ન તે અર્થે કૃપાથી શા થયેલા છે !

પ્રચંડ અજિન હૈયામાં અનુભવવા જ દિલને તે,
શું ભડભડતો જ પ્રગટીને ભયંકર શો મથાવ્યો છે !

મથામણમાંથી નવનીતનું ભર્યું ભર્યું દિલ લાધ્યું છે,
કૃપા એ તો હરિવરની શી અણમોલી ખરેખર તે !

કારિઃઅં

‘હરિરસ’ એ જ કર્તવ્ય

હરિનાં પદકમળ રસમાં ભીજાવાને સતત દિલને,
ફરી ફરીને, વળી વળીને, ઊલટથી શું મથાવું છે !

થતા રહેતા પ્રયત્નોથી, હદ્ય અભ્યાસથી તેવા,
વલણ દિલનું થતાં તેવું પ્રગટવા માંડિયો રસ ત્યાં !

પઢ્યો છે દિલને રસ જ્યાં, થતા રહેતા પ્રયત્નોમાં,
-પછી શા પ્રાણ પ્રગટ્યા છે ! મળે જેનો ન જોટો ક્યાં !

‘હરિરસ’ એ જ કર્તવ્ય પછીથી માની દિલનું તે,
વિના રસ દિલને કંઈ પણ બીજું જચતું કશું ના છે.

કારિ: ઊં

અમે શું શું કરેલું છે !

જીવનમાં દિલ મેળવવા અમે શું શું કરેલું છે !
શી તે ઈતિહાસની ગાથા અજાણી સૌ થકી તો છે !

બધું આકાશ પાતાળ કરીને એક જીવનમાં,
કૃપાથી શા મથેલા જે કઢી કેમે ન ત્યાં થાક્યા !

ભરોંસો સૌ હરિ પરનો ધરીને જંપલાવીને,
જુકાવેલું પૂરેપૂરું તહીં હરિ હાથ મળિયા છે.

બધુંયે આપતાં પૂરું ન તે સંતોષ પામે છે,
મળંતાં દિલ સંપૂર્ણ પછી પેટ જ ભરાતું છે !

કારિઃકુ

મચક આપી કેમે નથી

પહેલાં પ્રકૃતિ ક્ષોત્રો હતું રહેઠાણ દિલનું જે,
પરંતુ એકધારું ત્યાં, ટકાતું નહોતું આનંદે.

સતત આનંદ હીંચોળે જૂલ્યા કરવાનું દિલ, દિલનો
-પ્રચંડ જ વેગ જે ઊગતાં, મથાવાનું દિશામાં તે.

તહીં શા પ્રકૃતિ વેશ, લઈ પલટા જુદા જુદા
-પકડી નિજ રાખવા ચાલે, મથ્યા કેવું કરીને ત્યાં !

કદીક તો ભોળવાયેલા મચક તોયે ન આપેલી,
'હતી શ્રી લગની ત્યાં ઉત્કટ !' શકાયું જાડી માત્ર જ તે !

કારિઃકુ

જીવન આદર્શ જો દિલમાં !

ઘણી ગુંચો, મુસીબત ને દુઃખો, આપત્તિ ને સંકટ
-જીવનમાં ફૂટીને કેવાં શું ઉત્પાત મચાવ્યો છે !

પરંતુ દિલનું કૌવત, ધીરજ સમતાતણી ત્યારે,
'કસોટીની ખરી પળ તે' સમજ રહેવાયું મક્કમ છે.

જીવન આદર્શ જો દિલમાં થઈ અંડિત ગયેલો છે,
પછી ચસવાનું તેમાંથી કદી પણ ના થવાનું છે.

ભણે છે દિલ જે કર્મ થતાં તે કર્મને વિશે
-ઝરંતો દિલ થકી રસ જે, ન ખચકાવા કહીં પણ દે !

કરિ: ઊં

જવનમાં દિલ મળેલું છે

હરિ સામર્થ્યની જવતી ઊડી બેઠેલ શ્રદ્ધા જે,
જવતી શ્રદ્ધા પરે તેવી, મથાવાનું થયેલું છે.

હિમાલય જેવડાં વિઘ્નો, નડ્યાં પથમાં કરેલાં છે,
ઇતાં વિશ્વાસ ને હિંમત ટકેલાં તે, કૃપા તુજ છે.

હરિએ કેટલી વાર પૂરી સંભાળ લીધી છે,
અખંડિત ભાવ પ્રગાંતાં જવનમાં દિલ મળેલું છે.

મળંતાં દિલ, જવન સઘળું, ઝીલેલું સર્વ બાજુએ,
જવન તેવાતણો કેવા સહજ આનંદ સ્કુરતો છે !

કારિઃઅં

કટિબદ્ધ થઈને તે

ભયંકર હુમલાઓ શા જીવનમાં પ્રગાઠી પ્રગાઠીને
-કરી બેફામ મૂક્યો છે ! કદીક બેભાન બનવ્યો છે.

પરંતુ દિલ જે જાગેલું ન છાનુંમાનું કંઈ ત્યારે
-પડી તે એમનું એમ કદી પણ ના રહેતું છે.

મચેલું સામનો કરવા કટિબદ્ધ થઈને તે,
કદીક હાર થતાં, પાછું ઉઠી બેહું થતું પોતે.

નિરાશાની પળે દિલ જે કશું ના હચમચેલું છે,
અડગા, અણનમ ધરી ટેક, ટકેલું વજ જેવું તે !

કરિઓ

બધું તે દિલ પિછાને છે

જીવનમાં મસ્તી શી દિલની બલિહારી રૂડી શી છે !
મળેલા દિલની મહોબત શી માથાસાટ મોધી છે !

ઉગેલાં દિલનાં ક્રૌવત, પરાક્રમ, હામ, ધીરજ જે,
કશુંધે કોઈનું બળ પણ ન જેની તોલ આવે છે.

નવા અવતારના દિલનો હદ્ય જે ભાવ પ્રગટે છે,
જીવન ચેતનની શક્તિનો પૂરો પરચો બતાવી દે.

નૂતન દેશ, નૂતન ભૂમિકા બધું તે દિલ પિછાને છે,
પ્રસંગે દિલ તો કેવું બધું નિજ હોડ મૂકે છે !

કારિઃઅં

મળેલા દિલનું લક્ષણ

જીવનમાં દિલને મળતાં ધીરજની અવધી આવી છે,
છતાં મેળવવા દિલ અર્થ થયું તે તે કરેલું છે.

નિરાશા પાર વિનાની કંઈક વાર મળેલી છે,
છતાં હિમત ન તૂટી છે, કૃપા એ તો હરિની છે.

‘થયા જે જે ગયું તેમાં હતું દિલ’ તે પ્રમાણયું છે,
વિના દિલ કંઈ કશો ક્યાંયે ન શુક્કરવાર વળતો છે.

હુવારો ભાવનો ઉડતો જહીં સ્કુર્યો અનુભવમાં,
મળેલા દિલનું લક્ષણ અનુભવથી હું સમજ્યો જે !

કરિ: ઊં

શી દિલની જાગૃતિ ત્યાં છે !

ટકોરાબંધ ને અકબંધ શી દિલની જાગૃતિ ત્યાં છે !
જવનનું સુતરું, સુતરું બધું તેથી જ ચાલે છે.

જવનનું પ્રેમ આનંદ અસ્ખલિત વહેતું જરણું જે,
હદ્યના પ્રેમના દિલનું સ્વરૂપ જ વ્યક્ત તે તે છે.

થતી જે લાગડી, વૂતી, સ્હુરંતી ભાવના ઊધર્એ,
રમંતું દિલ તે વિશેતણું પ્રતિબિંબ તે તે છે.

હદ્યના પ્રેમનું માધ્યમ થવા સાકાર તો દિલ છે,
બધે જેમાં અને તેમાં જિવાતું દિલથી નિશે.

કારિ: ઊં

શું પરખાયું કૃપાબળ ત્યાં !

‘કૃપાશક્તિથી હરિ તારી પૂરું સાચવવું દિલને તે’,
જવનમાં એકલું માત્ર કરેલું કર્મ સાચું જે.

જવનમાં દિલથી જે તે સધાતું હોય છે નિશ્ચે,
વિના દિલના પ્રયત્નોમાં ન કંઈ ભલીવાર પ્રગટે છે.

પરોવાવા સતત દિલને મળેલાં કર્મમાં જવને
-પ્રભુપ્રીત્યર્થ ધારીને, કૃપાથી ધત્ન કીધા છે.

‘ફવાતું કે ફવાતું ના’ કદી વિચાર તેવામાં
-પરોવા દિલ ન દીધું છે, શું પરખાયું કૃપાબળ ત્યાં !

કારિ: ઊં

દિલાવર દિલનો દરિયો

દિલાવર દિલનો દરિયો ઊછળી ઊછળી શું સ્પર્શે છે !
ભીજાવી નાંખવા, યજ્ઞ સતત એનો શું ચાલે છે !

વફાદારી, હદ્યનિષ્ઠા, શી જિંદાદિલી સક્રિય જે,
હદ્યના પ્રેમમાં ઊંડી ન જેનો કંઈ સુમાર જ છે !

પળેપળ દિલ જતું વારી સમર્પણ થઈ જતું સહેજે,
સતત દિલ, દિલમાં ગળવાતણો શો યજ્ઞ ચલવે છે !

તપશ્ચયર્ સતત દિલની જીવનમાં ત્યાગ ને તપથી
-જીવંતી ચેતનાત્મક શી સતત જલતી રહે તેથી.

છાનિઃકુ

જીવનનું મૂલ્ય દિલથી છે

જીવનમાં દિલની મહોબત છે, જીવનમાં દિલથી રંગત છે,
જીવનમાં દિલની રોનક છે, જીવન શોભા શી દિલથી છે !

જીવનનું મૂલ્ય દિલથી છે, જીવન સર્વસ્વ દિલમાં છે,
રહસ્ય ઊંડું જીવનનું મળે છે દિલ વડે નિશ્ચે.

ફનારી, બલિદાનો, સમર્પણથીય છલકાતી
-ભલે નદીઓ વહે તોયે ન કિંમત દિલની અંકાતી !

અમે સોદો પૂરેપૂરો અમારા દિલનો પ્રેમે,
હદ્યના પ્રેમનાં ચરણે કરી દીધેલ નિરાંતે.

કરિ: ઊં

હવે દિલનાં ગીતો ગાતાં

હવે દિલનાં ગીતો ગાતાં નયન શી રોશની પ્રગટે !
જલક મુખ પર શી લાલીની તહીં મલકાતી છલકાયે !

મધુસું ઓર સ્વાદિષ્ટ બધું દિલથી જ લાગે છે,
શું નંદનવન જીવન લાગે હદ્ય જો સાંપડેલું છે !

સમારાતું ગયું કેવું જીવન દિલથી બધી કોરે !
તપશ્ચર્યા થતાં ઉગ્ર શું દિલ તેમાંથી ફૂટવું છે !

જીવનમાં ગુણ ને ભાવ બધા તે દિલ લીધે છે,
જીવનનું સર્વ ગૌરવ જે ખરેખર દિલ વડે સૌ છે !

કારિ: ઊં

હદ્ય ગૂઠ સાંપડેલું છે !

હદ્યથી યાદ કરી કરીને હદ્ય સંભારવાનું છે,
હદ્ય સંભારી દિલ ભાવ સળગતો ધારવાનો છે.

જીવનમાં ભાવને દિલનું પરસ્પરનું જ સગપણ છે,
જીવનમાં દિલને તેથી મહત્વ જ ખાસ અર્થું છે.

હદ્ય સંભારવામાંયે હદ્ય ઊછળતું કેવું છે !
હદ્ય તે ભાવનામાં શો જીવંતો પ્રાણ ફૂટે છે !

જીવનમાં દિલ, દિલથી જ્યાં હદ્ય ગૂઠ સાંપડેલું છે,
જીવનની ધન્યતા દિલ અનુભવમાં સ્કુરંતી છે.

કરિઓ

જવનમાં દિલનો મહિમા

જવનમાં દિલની પરવા છે, જવનમાં દિલથી નિસ્ભત છે,
જવન સંબંધ દિલનો છે, જવન અસ્તિત્વ દિલથી છે.

જવનમાં પ્રેમ અમૃતનો, અનુભવ જે થતો રહે છે,
ખીલેલા દિલને લીધે, અનુભવમાં પ્રકાશો છે.

જવન જે બીજ વાવેલાં, ઊગો છે દિલને લીધે,
ખરેખર દિલ જળ, ખાતર, જમીન, ને ખેડ સૌ પણ તે.

જવનમાં દિલ જેવું છે, પ્રમાણે એ જ દુનિયા છે,
જવનમાં દિલનો મહિમા, મથ્યો ઉપસાવવાને તે.

કારિઃઅં

અમારે ‘દિલ’ એ જીવન છે

અમારે દિલથી ભળવું છે, અમારે દિલથી ભળવું છે,
અમારે દિલથી ગળવું છે, અમારે ‘દિલ’ એ જીવન છે.

અમારે દિલમાં દિલથી જીવન આખું સમાવું છે,
અમારા દિલનો ભાવ ન મર્યાદા કશી સમજે.

જીવનમાં દિલનો ભાવ છૂપો સર્વગ વ્યાપે છે,
હદ્યમાં સૂક્ષ્મ તે હોવા છતાં ના કોઈ પરખે છે.

અમે પણ દિલની ભક્તિ જીવનમાં શી કરેલી છે !
અમે શી દિલને માટે ફનાગીરી વહોરી છે !

કારિ: ઊં

અનુભવીનું બધું ત્યમ છે

કરાવા દિલની કિંમત અમારે ના જવું કયાંયે !
પૂરેપૂરી દિલની કિંમત જીવનમાં કોણ જાણે છે ?

મહોબત સાથ સંબંધ સતત દિલને અનેરો છે,
મહોબતનું કશું મૂલ્ય ન આંકી કંઈ શકાતું છે !

મહોબતથી ભર્યું દિલ તો ચાહવું માત્ર સમજે છે,
હદ્યથી ચાહવામાં તો ચડસ એને અનેરો છે.

સમર્પી શું સતત કરવાતણો દિલનો જ ધંધો છે !
ખપી તેમાં જવાતાંમાં થઈ જતું શૂન્ય દિલ પોતે.

પરંતુ કોણ જાણે છે, સમર્પિયા જતું દિલ જે !
હરિ જેમ છૂપો, સૂક્ષ્મ અનુભવીનું બધું ત્યમ છે.

કારિ: ઊં

વદવું તેવું નિરર્થક છે

કહે કેટલાંક તો ‘મોટા ! તમોને દિલ આપ્યું છે’,
પરંતુ વાત તે સાચી ખરેખર લાગતી ના છે.

તમે જો દિલ ‘મોટા’ને પૂરેપૂરું જ આપ્યું છે,
બિરાજેલો પછી મોટો તમારે દિલ ન કાં તે છે ?

અમથું અમથું નકામું તે વદવું તેવું નિરર્થક છે,
હદ્યના ભાવ વિનાનું જીવનમાં કંઈ ન ખપનું છે.

ઉછળતો ભાવ હૈયાનો નદીનાં પૂરના જેવો
-થતાં સૌ કર્મમાં જો ના, બધાં તે કર્મ ફોગટ છે.

હારિઃ ઓ

જીવનનું ત્રત સ્વીકાર્યું છે

મળે સંપૂર્ણ દિલ દિલ જ્યાં મહોબત રંગ ખીલે છે,
જીવન ઉધા નવલ રંગે પ્રદીપ્ત ભવ્ય લાગે છે !

પરંતુ એવું દિલ મળવું મહામુશકેલ હુર્દ્દટ છે,
હૃદયથી ચાહવું તેથી જીવનનું ત્રત સ્વીકાર્યું છે.

ખરેખર જ્યાં જીવનમાં દિલ પૂરેપૂરું ખીલેલું છે,
જીવનનું તેવું દિલ માત્ર ખરેખર ચાહવું જાણો !

વિના ચાહ્યા કશે દિલને પડે છે ચેન કયાંયે ના,
સતત રમમાણ દિલ રહે છે, સહજ ચાહવાની મસ્તીમાં.

હંટિઃકું

ભલે છોને ખપી જઈએ

પૂરેપૂરું દઈ દેશો ચહી ચહીને ભલે દિલને,
જતાં સામેથી દિલ મળશે, અપેક્ષા દિલ ન સેવો તે !

થવા આનંદ તમ દિલને ચહી ત્યો પેટ ભરીને તે,
સમર્પણ થઈ જતાં છોને, ભલે તે પણ જીવન કાજે.

કશી આશા અપેક્ષાથી ન ચાહશો દિલ ભૂલેચૂકે,
નહિતર તો નિરાશાને હદ્ય નોતરશો તે નિશ્ચે.

સહજ ચાહવાતણોયે શો હદ્ય આનંદ ન્યારો છે !
ભલે છોને ખપી જઈએ, જતાં ખપી દિલ શું મલકે છે !

કારિ: ઊં

જીવનમાં સર્વ વ્યવહાર

જીવનમાં સર્વ વ્યવહાર અમારે દિલની સાથે છે,
જીવનમાં તેથી તો દિલને પ્રથમથી દઈ જ શા દઈએ !

દઈ દિલને, ચહી ચહીને, ઉમળકે વારી વારીને,
ઇલકતા ભાવ દરિયાથી મથીએ શા ભીજવવાને !

ભીજવી નાંખવા યજા શરૂ હરિએ કરાવ્યો છે,
અમે શા તણખલા જેવા ન કંઈ સામર્થ્ય એવું છે !

વિના દિલ કોઈ સંબંધ જીવનમાં તો અમારે ના,
ન ક્યાંયે ભાવ સામર્થ્ય સમું દિલ તો હરિ વિના.

હારિઃકુ

ઉમળકો પ્રેમનો ગંગા સમો

ઉમળકો પ્રેમનો કેવો ઊછળતા ધોધના જેવો !
ભયંકર પૂરના જેવો ખરેખર પ્રેમનો છે શો !

હદ્યના પ્રેમનું સાચું ઉમળકો વ્યક્ત લક્ષણ છે,
હદ્યના પ્રેમનો સ્પર્શ ઉમળકાથી શું વતાયે !

ઉમળકા કંઈ વિનાનો જે ન હિલનો પ્રેમ સાચો તે,
હદ્યના પ્રેમની ઉખા ઉમળકાથી મપાયે છે.

ચીલેચલું સમી કોઈ કશી રીત પ્રેમમાં ના છે,
નવલ, મૌલિક, નૂતન પળપળ અનુપમ પ્રેમ નૌતમ છે !

મહોબત, પ્રેમની લિજજત ઉમળકામાં રહેલી છે,
ઉમળકો પ્રેમનો ગંગા સમો જીવન ઉજળે છે.

કરિઓ

ખંડ - ૮

૬૬

ખરેખર દર્દનો મહિમા વિના મહાત્વા ન કો જાણો !
જવનનું દર્દ એ તો શ્રીહરિની કૃપા પ્રસાદી છે.

કારિઃકું

હદ્યના પ્રેમનું દર્દ

હદ્યના પ્રેમનું દર્દ મહા કોઈ ભાગ્યશાળીને
-અનુભવવા મળે, જેથી જીવન રસ રંગ મહાલે તે.

જીવનમાં દર્દ કંઈ લાગ્યા વિના ઊંડું ઊંડું હદ્યે,
ઇપાયેલો ઊડો મર્મ કદી ના હાથ લાગે છે.

ખરેખર દર્દનો મહિમા વિના મહાલ્યા ન કો જાણો !
જીવનનું દર્દ એ તો શ્રીહરિની કૃપા પ્રસાદી છે.

જીવનનાં દર્દથી એવા ઊંડું શું ઊતરાયું છે !
અનુભવવા જીવનસત્ત્વ, જીવનનું દર્દ સાધન છે.

કારિઃકુ

અનુગ્રહથી સ્વીકાર્યો છે

ચઢેલો હોય છે પ્રેમ જીવનમાં કોસ પર નિત્યે,
સતત બસ વેદનાકેરા શું હોમાયેલ યજો તે !

હરિના ભાવની ભરતી વિશે મશગૂલ ભરપૂર છે,
જીવનના કોસને ભાવે અનુગ્રહથી સ્વીકાર્યો છે !

સતત બસ વેદનાકેરી શી રમજટ પુરબહારે છે !
ઇતાં કેવો નિરંતરનો તહીં હરિભાવ ઊછળે છે !

બલિહારી હરિભાવતણી જીવનમાં પ્રસરી છે,
જીવનના કોસની તેથી પ્રસાદી શી કૃપાની તે !

કારિઃઅં

પ્રસાદી શી મળેલી છે !

ભયંકર વેદના તીવ્ર અસહા સહેવી લાગે જે,
જીવનના કોસની ભવ્ય પ્રસાદી શી મળેલી છે !

હરિ કોઈ દૂત તારાથી ચમત્કારિક શાતા જે
-હદ્ય પ્રેરાવીને કેવી જીવનમાં તાજગી બધ્યે !

જતી પળ એક ના કોઈ ખરેખર વેદના વિના,
મહદ અચરજ, ‘ટકે તેમાં હરિની સભાનતા દિલમાં’.

ટકે ના એકલું માત્ર, પરંતુ કેટલાં સર્જન
-દશા તે વેદનાગ્રસ્ત વિશે તે શાં થતાં વ્યક્ત !

જીવનના સત્તુ, અસત્તુ વિશે, જગતનાં સુખ, દુઃખ વચ્ચે,
જીવંતો એકધારો શો વહુંતો પ્રેમ પ્રત્યક્ષે !

કારિઃકું

જવનનું દર્દ પરખાવે

વિના લાગ્યા તોંકું દર્દ મહેદિલ જે જવનની છે,
અનુભવી ના શકાતી તે, રસીલું દર્દ મર્મી છે.

મહોબતની ખરી રંગત, રસિકત્વ જવનનું જે,
અનોખી જે કળા, ગૂઢ, જવનનું દર્દ પરખાવે.

જવનના સાવ તળિયે ને ઊંડે ઊંડે પહોંચાડી
-ખૂબી સઘળી જવનની જે, બતાવી દે જ પ્રગટાવી.

જવનનું દર્દ, ભરી દિલ તે કૃપાથી મહાલી જાણ્યું છે,
ખરા દર્દી જવનના શા થયા જ્યાં ભક્તિ ફોરી છે !

કારિઃકું

અનુગ્રહ શો થયેલો છે !

જીવનનું દર્દ ભર્તિલું, જીવનનાં સર્વ પાસાંમાં
-ધૂપાયેલ મૂળનું હાર્દ બતાવે છે અનુભવમાં.

જીવનમાં દર્દ હોવા તે છતાં, ના દર્દ સાલ્યું છે,
હદ્દ્ય પ્રત્યક્ષ આગળ તો થયેલું દર્દના લીધે.

ઉંડું તારતમ્ય રસકેરું હદ્દ્ય પ્રગટેલ તે દર્દે,
અજબ નિજની શી શક્તિથી જીવનમાં તે અનુભવ્યું છે !

હરિનો કેટલો મોટો અનુગ્રહ શો થયેલો છે !
જીવનમાં દર્દ પ્રગટાવી જીવનનો મર્મ બક્ષ્યો છે.

કારિ: ઊં

હદ્યમાં દર્દ પ્રગટે છે

હદ્યનો પ્રેમ લાગતાં, હદ્યમાં દર્દ પ્રગટે છે,
હદ્યના પ્રેમનું સાચું ખરું લક્ષણ ખરેખર તે !

હદ્યનો પ્રેમ છાનો તો કદી પણ ના રહે છે તે,
છતાં શો ગૂઢનો ગૂઢ વળી પાછો શું ગુપ્ત જ છે !

કળા તે પ્રેમની કેવી નૂતન અદ્ભુત રસીલી છે !
કળામાં સાવ સંપૂર્ણ પૂરેપૂરી ન આવે તે.

કિરણ જેમ સૂરજનાં છે અનંતાનંત, તે રીતે
-જીવનનાં સર્વ પાસાંને જીવન દર્દ કળાવે છે.

કારિ: ઊં

જીવનના દર્દનો મહિમા

જીવનના દર્દનો મહિમા જીવન દર્દ જ રંગીલો
-રસાયેલો પૂરેપૂરો ખરો, તે માત્ર અનુભવશે !

જીવનનું દર્દ રસ્તિક કેવું ! હદ્ય સાચું પ્રિધાવી દે,
જીવનનો મર્મ જે ગૂઢ શું દર્દ તે કળાવી દે !

જીવનમાં ઉત્તરાવાને ઊંડું ઊંડું ગહન રીતે !
જીવનનું દર્દ કેવું તે ખબરદાર બધી રીતે !

અનુભવવા જીવનને તો જીવનદર્દ મહામૂલું,
ખરું ખપનું યથાયોગ્ય જ જીવનમાં નીવડેલું શું !

કારિ: ઊં

રસીલું દર્દ જીવનનું

રસીલું દર્દ જીવનનું હૃદય તે રસની હેલી છે,
અનુભવતાં અનુભવતાં, નશો ખુમારીનો દિલ છે.

રગેરગ ને નસેનસમાં મનાદિમાંય પ્રસરે છે,
ખુમારીનાં જ નાચંતાં ભર્યા રસ-પ્રાણ-મોજાં જે.

જહીં જહીં સ્પર્શ એનો છે, નૂતન તે વેશ બદલે છે,
જૂનામાંથી નવું કેવું અનુપમ ભવ્ય નીપજે છે !

ઉપરથી એકનું એક જ બધું એવું જ લાગે છે,
છતાં પલટાયેલું રૂપ જે, અનુભવી માત્ર મહાલે છે.

કારી: અંદુ

ખંડ - ૮

સ્પર્શ

હદ્યના પ્રેમનો સ્પર્શ જીવનને ફેરવાવીને,
અકલદ્ય ને અગોચરનું જીવન પ્રત્યક્ષા કરવે છે.

કારિ: ઊં

જૂની આંખે નવાં ચશમાં

ઘડીકભરનો હદ્ય સ્પર્શ મગજ બહેકાવી મારે છે,
જૂની આંખે નવાં ચશમાં, પહેરાવી જ તે દે છે.

જીવન હોવા છતાં પૂર્ણ પ્રકૃતિનું જ અસ્તિત્વ,
ન પ્રકૃતિનું છતાં ચાલે અખંડાકાર જ્યાં ભાવ.

હદ્યના સ્પર્શને લીધે સહજ ને શો સતત જીવને !
નિરંતર ભાવ અલબેલો વહ્યા કરતો જીવંતો તે.

મહદ સદ્ભાગ્ય જીવનનું હદ્યનો સ્પર્શ હોવો તે,
અસર એની શી મૌલિક જે, શકે મહાલી અનુભવી જે !

ખરેખર સ્પર્શ ને પ્રેમ, નિરંતર ભાવ દિલનો જે,
ભૂમિકા એક ના જુદાં છતાં તે ઓકસરખાં છે.

કારિ: ઊં

હદ્યનો સ્પર્શ જગવે છે

નૂપુરઝંકાર અનુપમ એ, હદ્યનો સ્પર્શ જગવે છે,
નવી વૃત્તિ, નવી દસ્તિ, વલણ નૂતન સ્હુરાવે છે.

હદ્યનો સ્પર્શ શાં દ્વાર બધાં ખુલ્લાં કરાવે છે !
બધાંયે આવરણ સર્વ ખસેડી તે નખાવે છે.

હદ્ય તાદાત્મ્યનો લહાવો, હદ્યના મૈક્યનો લહાવો,
શું વર્ણનથી અતીત એવું જીવન પ્રત્યક્ષ લાવે છે !

હદ્યના પ્રેમનો સ્પર્શ જીવનને ફેરવાવીને,
અકલ્ય ને અગોચરનું જીવન પ્રત્યક્ષ કરવે છે.

કારિઃકું

હદ્યનો સ્પર્શ

હદ્યનો સ્પર્શ જીવનમાં શું મોટો ભાગ ભજવે છે !
કરી નવપત્રલિખિત જીવન, જીવન ખુશબો બઢાવે છે.

રગેરગથી, નસેનસમાં, હદ્ય થનગનાટ વ્યાપીને,
કરી દે દિલ પ્રોત્સાહિત નશો કેવો લગાડે છે !

હદ્યના પ્રેમનો સ્પર્શ નદીનાં પૂરની પેરે
મજા, આનંદ, મસ્તીને જીવનમાં વહેવરાવે છે.

જરા સરખો, જરીક અમથો હદ્ય નહિવતૂ ભલે સ્પર્શ
-ઇતાં ત્યારે ખુમારીનો હદ્ય રણકાર જુદો છે !

કારિ: ઊં

હદ્યના સ્પર્શના જાહુ

જીવન આનંદનો દરિયો હદ્ય છલકાવી મારે છે,
અનુપમ દિવ્ય ભૂમિકાતણું દર્શન કરાવે છે.

હદ્યના સ્પર્શના જાહુતણો જેને અનુભવ છે,
ખરો બડભાગી જીવનનો ખરેખર પૂર્ણ એવો છે !

ઉથલપાથલ બધી વૃત્તિ હદ સ્પર્શ કરી દે છે,
અભિનવ ભાવનો જુસ્સો ધસારાબંધ સ્ફુરવે છે.

જીવનમાં જે ન જાણું'તું, જીવનમાં જે ન મહાયું છે,
હદ્યનો સ્પર્શ તેને શું જીવન પ્રત્યક્ષ કરી દે છે !

કારિ: ઊં

જીવન અમૃત બનેલું છે

હદ્યના પ્રેમનો સ્પર્શ થતાં, જીવન પુરાણું જે
-જઈ પલટાઈને, કેવો નવો અવતાર ધારે છે !

નવા ઉત્સાહનાં મોજાં, સતત ઉભરી જ ઉછળે છે,
ભીજાવી દઈ તળેઉપર, રસાર્ડ ભોંય બનવે છે.

નર્યો રસના જ દરિયામાં, રસાવાયું ગળાબૂડ છે,
રસે સોંસરવું જે તે સૌ ભરેલું આરપાર જ છે.

શું સ્પર્શનું દિવ્ય આકર્ષણ જીવન જામેલું જીવતું છે !
પળેપળમાં રસાયણનું જીવન અમૃત બનેલું છે.

કારિઃઊँ

શી અદ્ભુત પ્રેમની શક્તિ

ન ચાલે પ્રેમને સહેજે પરસ્પર ‘આપ-લે’ વિના,
પરસ્પરના અનુરાગ વિના ચાલે કદાચિ ના.

ખરેખર પ્રેમને એકય સતત દિલ દિલથી હોવા
-લઢણ બસ એકની એક જ શી ઉક્ટ જંખના દિલમાં !

ન ખાલી જંખના માગ પરંતુ પ્રેમ પ્રત્યક્ષ
-જીવન સાકાર શો હોઈ ! સ્વરૂપે સ્થૂળ ગુણધર્મ.

શી અદ્ભુત પ્રેમની શક્તિ અજબની ને ગજબની છે !
અજયબ કર્મ શાં પ્રેમે ચમત્કારિક કીધાં છે !

કારિ: ઊં

ખંડ - ૧૦

પ્રેમલીલા

હદ્યના પ્રેમથી જ્ઞાન, અતુલ સામર્થ્ય, આનંદ
-પ્રગટતાં છે જીવનમાં તે, થતું તેથી જીવન સાર્થક.

કારિ: ઊં

ચિરંજીવ નવજીવન મૌલિક

ખરેખર પ્રેમના જીવન વિશે મૃત્યુ કદી નવ છે,
ચિરંજીવ નવજીવન મૌલિક ખીલંતું પ્રેમમાં નિત છે.

બધાંને સંકળાવીને પરસ્પરમાં પરસ્પરથી
-સમગ્ર સર્વ જીવનને કરાવે એક તે દિલથી.

નૂતન ભાવો જ નિત નિત શા સ્હુરંતા રહે જીવન વિશે !
શું તેથી જીવવા જેવું જીવન લાગે મધુરું જે !

હદ્યના પ્રેમથી જ્ઞાન, અતુલ સામર્થ્ય, આનંદ
-પ્રગટાતાં છે જીવનમાં તે, થતું તેથી જીવન સાર્થક.

જરંતાં રસના જીવનથી ઊગેલો ને ઝૂટેલો છે,
હવે ધસમસતો પૂરે શો વહેવા પ્રેમ લાગ્યો છે !

કારિઃકુ

હદ્યનો પ્રેમ જાગ્યો છે

હરિની ભાવનાકેરું જીવન જીવવા હદ્ય મુજને
-તલપ લાગેલ ઊંડી જે સતત જેણે મથાવ્યો છે.

સતત બસ એકની એક જ હદ્ય લાગેલ ધૂને જે,
હરિની ભાવનામાં શો મને એણે જિવાડ્યો છે !

જરીક ખંડિત થતાં કેવો હદ્યમાં ધ્રાસકો ઊંડો
-ખરેખર તીવ્ર લાગેલો, હદ્ય તેથી જ ચેતેલો.

હદ્ય ચેતવણી એવીથી હરિની ભાવના વિશે
-પરોવાતાં લગાતાર, હદ્યનો પ્રેમ જાગ્યો છે.

કારિઃઅં

હદ્ય રસનો અનુભવ છે

સ્મરણની લાગતાં લગની, પછીથી તો પળેપળ જે-કર્યુ લેવાયા ઊલટથી, પછી દિલ રંગ લાગ્યો છે.

હદ્ય-રસ-રંગની હેલી સતત વર્ષા કરેલી છે,
હદ્યનો પ્રેમ શો જળક્યા કરેલો છે પછીથી જે !

જવન પ્રત્યે જ શો એવો ઊંડો જ્યાં પ્રેમ જબક્યો છે !
બધે જેમાં અને તેમાં હદ્ય રસનો અનુભવ છે.

બધે પ્રસરાયેલો રસ તે કશું એના વિનાનું જે,
કંઈ જ બાકી નથી ક્યાંયે, શી રેલમછેલ રસની છે !

કારિ: ઊં

હદ્યનો પ્રેમ છે મહાલ્યો

સમરણની ભાવનામાંથી જીવન અસ્તિત્વનો હેતુ,
જીવનનો મર્મ સમજાતાં મનન ચિંતવન થયેલું છે.

મનન ચિંતવન થકી તેવા હદ્યમાં ઉતરી ઊંડું,
અનુભવવા જીવનને તે કૃપાથી ત્યાં મથાયું છે.

મથામણમાંથી દિલ નવનીત અનુભવમાંથી પ્રગાટીને
-જીવનમાં પ્રેમ સક્રિય થતો પ્રત્યક્ષ લાગ્યો છે.

રસીલા તે જીવનકેરાં મહોબત, મસ્તી, આનંદ,
-લહેજત, મોજ, ભોગવતાં હદ્યનો પ્રેમ છે મહાલ્યો.

હરિ: ઓ

હદ્યનો ભાવ મોર્યો છે

હદ્યપ્રેમ હરિકેરી કૃપાથી કેળવાયો છે,
તપશ્ચર્યા શી તે અર્થે થયેલી દિલ જાણે છે !

જીવનમાં લોભ, મોહાદિ થકી મુક્ત જ થવા કાજે,
સ્મરણમાં જંપલાવાતાં ચરણની ભક્તિ લાગી છે.

જીવનમાં ભક્તિનાં પૂર ચઠંતાં સર્વ આધારે,
અખંડિત ભાવની પ્રાપ્તિ શું તેથી મેળવાઈ છે !

અખંડિત ભાવ ફૂલમાંથી હદ્યનો ભાવ મોર્યો છે,
જીવન એણ સુવાસિત સૌ મહેકાવી દીધેલું છે.

કારિઃઅં

નિરંતરનો થતાં ભાવ

જીવનના કંઈક ઉદ્ઘેગો પ્રગટી, પ્રગટી હૃદય કેવો
-કરી દઈને જ પરેશાન! મૂક્યો છે ખળભળાવી શો !

સમરણનું ભાવનાકેરું હૃદયબળ કેળવાયેલું,
હૃદય એણે અજૂમવાને ખરો ટેકો જ બક્ષોલો.

અખંડિત ભાવના હૃદયે પ્રગટતાં, ભાવ જાગ્યો છે,
નિરંતરનો થતાં ભાવ, હૃદયપ્રેમ સ્હૃંગારેલો છે.

હૃદયના પ્રેમથી જીવન પ્રકૃતિલિત ને ફૂલ્યું ફાલ્યું
-થઈને નવજીવન પૂર્ણ શું નંદનવન બનેલું છે !

કારિઃકુ

હદ્યના ભાવના બળથી

હદ્યના ભાવના બળથી મતિમાં તેજ ફાલ્યું છે,
જવનના ધર્મ કર્તવ્યે ઊંડી સમજણ ખીલેલી છે.

હદ્યની ભાવના શક્તિતણો સ્પર્શ જીવનમાંનાં
-કરણ સૌને થયેલો છે, કરણ તેથી ખૂલેલાં છે.

મનાદિ સૌ કરણ મોર્ચા, નવલ, મૌલિક થયેલાં જે,
રચાઈ તેથી ભૂમિકા હદ્યનો પ્રેમ ઠરવાને.

હદ્યના પ્રેમની શક્તિ અમર્યાદિત અગણિત છે,
બધું તારવવું જે તે કંઈ, કળા શી પ્રેમ જાણો તે !

કારિ: ઊં

જવન ખીલતાં હદ્યપ્રેમ

સ્મરણ નિશદ્ધિન લેવાયા કરાયું છે કૃપાથી જે,
સ્મરણથી તે જવન શક્તિ ખરેખર કેળવાઈ છે.

લીધા કરવાથી ઉપયોગે, જવનમાં શક્તિને પ્રેમે,
ખિલવાને જવનને તે ખરી ખપમાં જ લાગી છે.

જવન ખીલતાં હદ્યપ્રેમ થતો ખુલ્લો ગયેલો છે,
પ્રકાશ જ પ્રેમનો ત્યારે અનુભવમાં પ્રકાશ્યો છે.

જવનનો હેતુ શો સ્પષ્ટ થતો મેળે ગયેલો છે !
જવનનું ઊર્ધ્વનું દર્શન થતાં સ્પષ્ટ ખૂલેલું છે.

કારિ: ઊં

સમરણની ભાવનામાંથી

સમરણની ભાવનામાંથી વફાદારી સ્હુરેલી છે,
ચરણની ભક્તિમાં નિષા હદ્ય તેથી જ લાગી છે.

નિરંતરનો થતાં એવો હદ્યભાવ હરિ પ્રત્યે,
સ્વયંપ્રેરિત જાગેલો સ્વયંભૂ પ્રેમ પોતે તે.

સમગ્ર સર્વ જીવનને શું આચ્છાદિત કરેલું છે !
અસરથી પ્રેમની એવા પ્રકાશિત પ્રેમ પ્રત્યક્ષે !

ચિરંજીવ પ્રેમ નિરપેક્ષ, ઇતાં હોવા બધાંમાં તે
-હદ્યથી સાવ નિર્લેખ અભાધિત શો રહે છે જે !

કારિઃકું

મનન, ચિંતવન, નિદિધ્યાસન

‘હરિ પરની હદ્યમાંછી જીવંતી ધારણા હોવી’
મનન તે સાચું જીવનને ઘડાવામાં જ ઉપયોગી.

સ્થિતિ હોવા સ્વરૂપમાં તે મનાદિ સૌ કરણાથી
-થતું ચિંતવન રહેતું જે, નિદિધ્યાસન ખરેખર તે !

-હરિમાં મન પરોવાતાં હદ્ય ચિંતવન થતું રહે છે,
હરિ તાદૃશ્ય પ્રત્યક્ષ થવામાં તે મદદરૂપ છે.

મનન, ચિંતવન, નિદિધ્યાસન જુદી જુદી ભૂમિકામાં
-જુદી જુદી રીતે મેળે થતાં કેવાં રહેલાં છે !

કારિઃકું

કૃપાબળના સહારે તો

જીવનમાં કોસની તીવ્ર સતત તે વેદના વિશે
-હરિની સભાનતા હોવી, અશક્ય તે હકીકત છે.
ટકવી

જીવનમાં કેટલીક વાર અશક્ય સાવ જે લાગે,
કૃપાબળના સહારે તો થતું તે શક્ય લાગે છે.

જીવનમાં આગના જેવી તમન્નાએ મથાવીને,
પ્રચંડ જ ને ભગીરથ શો પુરુષાર્થ કરાવ્યો છે !

સતત અભ્યાસ તેવાથી જીવંતી એકધારી જે
-અખંડિત ધારણા હદયે શી બંધાઈ ગયેલી છે !

કારિઃકું

જવનમાં બાદશાહી છે

જવનની ખુશનસીધી કે સ્મૃતિ તરવરતી હરિની છે !
સ્મૃતિ તરવરતાં તરવરતાં, સ્મૃતિમાં દિલ ગળેલું છે.

ગળેલી સ્મૃતિ દિલમાંની હદ્ય સભાનતા પ્રેરે,
હદ્ય સભાનતાએ તે જવનમાં ભાવ જગવ્યો છે.

નિરંતરના સતત એવા ઝગારા મારતા ભાવે,
હદ્યના પ્રેમનું તત્ત્વ શું ચેતનવંતું સ્ફુર્યું છે !

હવે તે પ્રેમને લીધે જવનમાં બાદશાહી છે,
જવનની સર્વ ભૂમિકાતણી સંભાળ શી લે તે !

કારિ: ઊં

અનુભવી તેમ વર્તે છે

અનુભવવા જીવનતત્ત્વ થયેલી સાધના જે છે,
શી તેની વાસ્તવિકતાએ થવી પુરવાર ઘટતી છે.

ધીરજ, વિશ્વાસ ને સાહસ, શું ઉદ્યમ, ખંત, નિશ્ચય જે !
ફૂટેલાં છે થતાં કર્મ થવાં પ્રત્યક્ષ ઘટતાં છે.

વ્યવસ્થિતિ, પ્રેરણા, સ્ફૂર્તિ, સમત્વ તે થતાં કર્મ
-થતાં રહેવાં ઘટે વ્યક્ત, અનુભવ તો જ સાચો છે.

ન યદ્વાતદ્વા જીવનમાં, કશું મિથ્યા ન લાગે છે,
સ્ખલિત જે પ્રકૃતિમાંયે અચળ, આશનમ, અડગ છે તે.

થતાં શિશુવત્તુ અવશ્યા જ્યાં થતાં ઉન્મત ભૂમિકા જે,
પ્રગટતી છે જીવનમાં ત્યાં અનુભવી તેમ વર્તે છે.

કારિઃકુ

કૃપાથી સાથ દીધો છે

શી શી નબળાઈ જીવનમાં સહન કરવી પડેલી છે !
સહેતાં સર્વ ઉત્પાત શું જંજાવાત ઊઠ્યો છે !

પરંતુ પ્રેમનો ભાવ જીવનમાં જે ખીલેલો તે,
મદદ આવી, ખરી પળ ત્યાં કૃપાથી સાથ દીધો છે.

અડીઝમ છે ઊભો રહેવા વળી અભિનપરીક્ષામાં,
હદ્યના પ્રેમના જેવો મદદગાર બીજો છે ના !

બલિહારી હદ્ય તેથી વસી મારે ગયેલી છે,
હવે એ પ્રેમમાં મશગૂલ થઈ નિત ગાન ગાયાં છે.

કારિઃઅં

ખરું કર્તવ્ય ચાહવું છે

ભરી ભરી ભાવમસ્તીથી, ઊછળતા દિલ ઉમળકાથી,
સતત ચાહ્યા જ બસ કરવું, જીવનની માત્ર નિષ્ઠાત તે !

જીવનનું એકલું એક જ ખરું કર્તવ્ય ચાહવું છે,
હરિ શો તેથી તો સહુમાં છૂપો છૂપો પ્રવેશ્યો છે !

બધાંના હાઈમાં ગળીને થવું નિજરૂપ પૂરું જે,
પછી નિજરૂપથી રમવું રસીલી તે લીલા શી છે !

હદ્યના પ્રેમનાં કૌવત જવાંમદ્દી અનેરાં છે !
પરાકમથી ભર્યા સાહસ નર્યા જોખમ શું જેડે તે !

કારિઃકુ

જીવનની ખુશનસીબી

જીવનની ખુશનસીબી કે હદ્યના પ્રેમનાં ચરણે
-ધરી ભેખ ધ્યાવીને ધૂણી, બેઠેલ શા છીએ !

અમારે કાળની પરવા ન સ્વપ્નમાંય ધરવાની,
હદ્યમાં પ્રિયને નિશદિન ધરાવી, જોગ જોવાની.

નયન નીરખી, સતત નીરખ્યા કરાયે તોય ધરપત ના,
ઉંડે અંતર વળી વળીને થવાતું એકરસ તેમાં.

છતાં પૂરો ધરાવો તો થતો રહે છે કદી પણ ના,
થતો દિલ આત્મસંતોષ, છતાં અધૂરો કરે લાગ્યા.

કારિઃકુ

જીવન સદ્ગ્રાહ્ય પાકું છે !

જીવન અગન પિપાસામાં જલન જલતું રહ્યા કરીને,
બધ્યા કરીને સતત તેમાં જીવન ખાક જ થયેલું છે !

જીવનને ભસ્મ ચોળાવી જીવનનો વેશ બદલ્યો છે,
હવે લેવા ન દેવા છે, જૂના જીવન વિશે એને !

અલૌકિક, દિવ્ય, મૌલિક જે અનુપમ દેશ અનુભવનો
-હવે જે ચાખવા મળિયો, જીવન સદ્ગ્રાહ્ય પાકું છે.

જીવનમાં પાંચ આંગળીએ પૂજેલા દેવને પ્રેમે,
મળેલું લોટવાનું જે ચરણ તેથી જ સદ્ગ્રાહ્યે !

કારિઃઅં

પ્રેમીનું દઈ

હદ્યના પ્રેમનું સર્જન ખરેખર ભવ્ય દિવ્ય જ છે !
શું નીચે અવતરી પોતે પ્રમાણો તે જ બનતો છે !

ઇતાં પોતાનું મૂળતાત્વ કદી ગુમાવતો ના તે,
ભણે, ગળે છે ઇતાં પોતે અનોખો સાવ નોખો છે.

હકીકતનું બધું સ્થૂળ ભલે કિંતુ ન તેમ જ છે,
સ્વરૂપ જે મૂળ અસલનું છે શું જુદું પ્રેમનું તે છે !

સ્વજન અમને ખરેખર તો વખા કેવા પડાવે છે !
ભૂખ્યાડાંસ નર્યા નરદમ અમોને સાવ રાખે છે !

હદ્યના પ્રેમનું ભોજન જીવન અમને શું ખપનું છે !
વખા તેના પડે કેવા અમારું દિલ જાણે છે !

કારિ: ઊં

અમે જીવન જુકાવ્યું છે

હરિને દિલ રીજવવાનું કૃપાથી જે સૂર્યેલું તે
-અદા પ્રેમે કરી તેવું હરિપદમાં સમર્પ્યું છે.

વીલો પળ પણ હરિને તો કદી મૂકી ન દીધો છે !
હૃદય વળગાડી રાખીને, હરિ બથમાં જ ઘાલ્યો છે.

જીવનનો માત્ર આધાર હરિ બસ એકલો શો તે !
જિવાડે તો જિવાયે છે, શું શાસોશાસ હરિ પડા છે !

જીવનનાં મૂળ કારણમાં છુપાયેલો હરિ ગૂઢ છે,
હવે સંશોધવા એને અમે જીવન જુકાવ્યું છે.

કારિઃઅં

મહાસાગર ભરેલો છે

હરિનાં તે ચરણકમળે નયનનું સૌ સમાયું છે,
હરિમાં દિલ રંગાવા ચરણ પકડી જ ધાર્યું છે.

હરિ વિના જીવનમાં તો હવે ના ચાલવાનું છે,
હરિ શો એકલો માત્ર જીવન સ્વામી અમારો છે !

જીવન રસનું હરિ પોતે ખરેખર કેંદ્રબિંદુ છે !
હરિના રસતણો કેવો મહાસાગર ભરેલો છે !

હરિની ભૂરકી ભર્સમ કપાળે જ્યાં લગાડી છે,
વલણ, વૃત્તિ અને દંદિ પછી શાં ફેરવાયાં છે !

કારિઃઊँ

હરિ કેવો અમારો છે !

હરિની યાદ જીવનમાં અમારી સાચી શક્તિ છે,
 ‘હરિ, હરિ’ દિલ પોકારી સકળ વ્યવહાર ચાલે છે.

અમારા રંક જીવનનો હરિ શો બાદશાહ જ છે !
 જીવન હરિથી જ ઉજમાણું, જીવનના પ્રાણ પણ હરિ છે.

હરિ વિનાનું ડગ ભરવું અમારું કંઈ ગજું ના છે,
 જીવનનો સર્વ આધાર હરિ કેવો અમારો છે !

હરિ સંતોષવા દિલને અમે ચરણો વધેર્યું છે,
 હરિને વહાલ કરવાને જીવન સઘળું સમર્પ્યું છે.

કારિઃઅં

કળા લીલા અનોખી છે

રજેરજની હદ્યપ્રેમ બધી સંભાળ રાખે છે.
શરીર સગવડતણીયે શી હરિ મુજ ભાળ લેતો છે !

બધે ડેલાયેલા કેવા કૃપાળુ હાથ તારા છે !
ગુણપ ના કોઈ વાતેયે કશી પડવા મને દે છે.

હરિને તે રીતે હદ્યે શું પ્રત્યક્ષ અનુભવવા !
બધી હકીકત વિશે મુજને મદદ પ્રેરાવતો રહે છે.

મળેલાં પ્રાપ્ત કર્માની સફળતામાં હરિ તું છે !
જવન સંબંધ કેવા તે શું દીધા મેળવી હરિ તે !

રસીલા પ્રેમ હરિવરની કળા લીલા અનોખી છે !
હદ્ય નિજના થતાં એના પરખવા શી મળે છે તે !

કારિ: ઊં

હદ્યના પ્રેમ પર એવા

જરૂરિયાત પળેપળની હરિ પ્રત્યક્ષ મુજ દે છે,
શરીરની સર્વ સંભાળ કૃપાથી કેવી મુજ લે છે !

મદદ જે જે સમય યોગ્ય હરિ પ્રત્યક્ષ કરી દે છે.
કશુંધે કોઈ વાતે પણ નહિ તે ઓછું પડવા દે.

બધી સગવડ, ભલે અગવડ વિશે મુકાયેલો છોને !
-છતાં કેવી કરી દે છે, કૃપા એવી શી મુજ પર છે !

હરિ, તારો હદ્યપ્રેમ શું અઠળક નિત વરસતો છે !
હદ્યના પ્રેમ પર એવા જઉં છું વારી વારીયે.

કારિઃઅં

કૃપા અદ્ભુત હરિની શી !

ભયંકર કારમી ભારે થતી શી વેદના વિશે !
હરિ મુજને જીવનમાં તો નર્ધુ બળ પ્રેરતો રહે છે !

શરીરકેરા અણુ અણુમાં બધે વ્યાપેલ ચેતન છે,
તહી તે રૂપ ચેતન છે, બધા ગુણધર્મ એના છે.

બધું જે તે થતું રહે છે, છતાં તેમાં શું ચેતન તે
-ખરેખર સાક્ષીવત્ત પોતે ! ભલે દર્દ ભયંકર છે.

કૃપાથી પીઠ ભૂમિકાની મળી એવી થકી તેથી,
અનુભવવા મળ્યું એ તો કૃપા અદ્ભુત હરિની શી !

કારિઃઅં

હદ્યના પ્રેમના બળ પર

શરીરની દુર્દ્શા પૂરી અવ્યવસ્થિત શી થયેલી છે !
બધા બેહાલ સંપૂર્ણ શરીરના શા થયેલા છે !

શરીરનો દોષ ના તેમાં શરીર તાકાત જે કંઈ છે
-બધી તેની જ મર્યાદા, શું ઓળંગી જવાઈ છે !

ઉપરના હાલ જુદા છે, વટાવી હદ, શી બેહદ જે !
પરસ્પરની પરત્વેનો સ્વભાવ પણ અલગ શો છે !

બધા ગુણધર્મ જે જે-ના પ્રમાણે તેમ વર્તે તે,
ટકોરબંધ અકબંધ રહી સાક્ષી નિહાળે છે.

ભૂમિકા જે પ્રમાણેનું થતું જે જે બધું તે તે,
પરંતુ માંકાલો તેથી ખરેખર પ્રેમ ન્યારો છે !

હદ્યના પ્રેમના બળ પર જતું જિવાયા જીવન છે !
શું રસ અમૃતનો લહાવો હવે જીવનમાં આવ્યો છે !

કારિઃઊં

જીવનરસ પ્રેમ અમૃતને

સકળ આ જિંદગાનીનો બધો હિસાબ હરિપદ છે,
હવાલો એકું એક જ-નો પૂરો સોંપી દીધેલો છે.

હવે બસ પ્રેમની મહોબત હદ્યથી મહાલવાની છે,
જીવનરસ પ્રેમ અમૃતને સતત પીવાની લિજજત છે.

ભૂમિકા સર્વનો રસ જે અલગથી અલગ જુદો શો છે !
અલાયદો બધા રસથી શું અંતર રસ નિરાળો છે !

બધા રસ સ્વાદ ચાખે છે, છતાં નિજ રસ મહાલે તે,
બધા રસથી જ સંપૂર્ણ સ્વતંત્ર જ શો જીવન રસ છે !

કારિ: ઊં

અનુભવ થતાં

બધું જેવું હતું તેવું અને સૌ તેવું તે તે છે,
છતાં અનુભવ થતાં તેમાં નવીન અદ્ભુત રસ ઉછળે.

નૂતન વૃત્તિ, વલશ નૂતન, નવી દણ્ણ પ્રવર્તે છે,
બધો જેનો અને તેનો અભિગમ ભર્મ ન્યારો છે !

બધુંયે ચાલવું, વદવું હતું જે તેવું તેવું છે,
છતાં તેમાં વિલક્ષણ પણ ચમત્કારિક અસર શી છે !

બધા હોવા છતાં ગુણ સૌ ન આધાર કશો તેનો
-જીવન વ્યવહારમાં તેને, શું ચેતનથી પ્રવર્તે શો !

કારિઃકુ

હદ્ય ઉઘડી ગયેલું છે

બધો આહાર તેવો ને હતો તેવો જ તેને છે,
છતાં આહાર તેનો તો અલૌકિક જ પ્રકારે છે.

રહે તેવો શું સંસારે બધા સંસારીની રીતે !
છતાં સંસારમાં તેની કળા વર્તનની ન્યારી છે.

જવનની રીત રસમ તેની બધા સંસારી જેવી છે,
છતાં તેમાંય તો હેતુ અનુભવીનો નિરાળો છે.

હદ્ય ઉઘડી ગયેલું છે, અને સંપૂર્ણ ખીલ્યું છે,
જવન વ્યવહાર તેવાનો હદ્ય તેવાથી ચાલે છે.

કારિ: ઊં

જવનનો દોરી સંચાર

હદ્યની પ્રેમની મૌલિક બલિહારી નિરાળી છે,
જવનના યોગ્ય કર્તવ્યે ચઠિયાતો કુશળ શો તે !

બધું દાક્ષિણ્ય એનામાં જવન ઊગી જતું મેળે,
બધો વ્યવહાર એવાનો થતો છે, ભાવનાત્મક જે.

જવનનો દોરી સંચાર થતો ચેતનથી એનો છે,
વિના ચેતન કશું પણ કોઈ ન એનામાં ઊગી શકશે.

ગુણે-વિસ્તાર-સર્જનમાં હરિ સમ સમર્થ નિભિત્તે,
હરિ તોલે છતાં કોઈ અનુભવી આવી ના શકશે.

કારિઃકું

હરિ વહાલો જીવનમાં શો !

હરિ વહાલો જીવનમાં શો અમારો જે બનેલો છે !
ચઢાવી કોઈને ચાવી અમારું કર્મ ચલવે છે.

અમે તુચ્છ પૂરેપૂરા, સમર્થ તે છતાં શો તે !
ધણી ધીંગો અમારો છે, બધી રીતે જ જબરો તે !

જીવનમાં તો અમે ઊજળા જીવનનું આંદું અવળુંયે
-નભાવી શો હરિ લે છે ! બધુંયે સાચવી લઈને.

હરિ આગળ ઉઘાડા તો પૂરેપૂરા અમે છીએ,
હરિને માત્ર દિલ દિલથી ચહી, જીવતા થયેલા જે.

હૃદય વહાલો પૂરો માત્ર હરિ કેવો અમોને છે !
કદીક ખોળો છતાં એનો બગાડી મૂકીએ શુંયે !

કારિ: ઊં

હરિપદ ઠાલવેલી છે

અમારે તો હરિ જેવો જહી બેલી મળેલો છે,
અમે દિલની બધી પરવા હરિપદ ઠાલવેલી છે.

બધી ચિંતા, ફિકર, બોજ હરિ ચરણે મૂકેલાં છે,
શી અમયદિં મસ્તીથી અમે તો કફની પહેરી છે !

શું આખાભોલો ને તીખો સ્વભાવ જે અમારો છે,
બગાડી તેથી જતું જે કંઈ હરિ શું તે સુધારી લે !

કદીક કેવું બગાડી દઉં પૂરો અક્કલ વિનાનો જે,
હરિપદ સંઘરાયેલને હરિ નિભાવી લેતો છે !

કારિઃઅં

જુકાવી શિર દેવાનું

ગૂંઘો, આફત, દુઃખો, વિદ્ધો, મુસીબત દેખીતી જે જે
-જીવનની હાડમારીઓ અને મુશ્કેલીઓ વચ્ચે

-ખમીર, ખુમારી જીવનમાં વળી મદ્દનગી જગ્બર
-ફૂટી કેવાં નીકળતાં છે ! શું મર્યાદા અતીત જોમ !

કરી સિદ્ધ બતાવે છે જીવનમાં વર્તતાં ત્યારે,
જીવન સર્વોપરીપણું નિજનું બધાં તે તે ઉપર જે છે.

જુકાવી શિર દેવાનું કદી ના પ્રેમ સમજે છે,
રહે આશનમ ખડક જેમ ટટારીથી ઊભો રહે છે.

કારિઃકુ

‘અમોને ચાહવા આવો’

હદ્યનો પ્રેમ તો કેવા ઊડા પોકાર પાડે છે !
 ‘હદ્યથી ને હદ્યમાં કો અમોને ચાહવા આવો !’

સતત ચાહ્યા જવાકેરો જીવનમાં યજ્ઞ ચાલે છે,
 અવર ચાહે, ન ચાહે, કંઈ અપેક્ષા દિલ ન એવી છે.

હદ્યપ્રેમ તપશ્ચર્યા કર્યા કરતો રહે મેળે,
 હદ્ય ઔક્ય થવા કાજે સતત જેનો પ્રયત્ન જ છે.

હદ્ય હોવા છતાં પૂર્ણ, ન કોઈ ઓળખે જેને,
 છૂપો, ગૂઢ, સૂક્ષ્મ એવો છે હદ્યનો પ્રેમ અવિભક્ત.

કારિઃઅં

જવનનો પ્રેમ પ્રત્યક્ષ

જવનમાં કોઈક ને કોઈક મને સંભાળનારું જે,
કૃપાથી મોકલી આપી નિરાંત જ શી વળાવે છે !

અસર જાહુઈ ગૂઢ, સૂક્ષ્મ, ચમત્કારિક, અદ્ભુત જે
-હદ્ય પ્રેરાઈને, પ્રાણ અને શક્તિ શું બક્ષે છે !

ન ખાલી ખાલી અમથો તે પડી પોતે રહેતો છે,
ખરેખર પ્રેમ નિર્ઝિય અને સક્રિય પળ પળ છે.

જવનને પ્રેરનારો તે, જવનને સાંધનારો તે,
જવનને સાધનારો તે જવનને તારનારો છે.

જવનનો પ્રેમ પ્રત્યક્ષ શું સચરાચરપણો તે છે !
અરે ! બ્રહ્માંદની પાર ખરેખર પ્રેમ વ્યાપ્ત જ છે.

કારિઃકું

જવનમાં પ્રેમનું સગપણ

જવનમાં ભાવ સંબંધ હદ્યથી કેળવી લઈને,
જવનમાં પ્રેમનું સગપણ હદ્ય ચેતાવી દેવું છે.

હદ્યથી ઉછળી ઉછળીને શો ન્યોછાવર થઈ જઈને,
હદ્યથી હદ્ય મિલાવીને હદ્યમાં એકય ધરવું છે.

હદ્યથી ચાહવાકેરી શી નિસ્ખાત એકલી બસ જે,
જવંતી ચેતનાત્મક તે અમારે દિલ વસેલી છે.

જવનમાં ચાહવાકેરો જવનધંધો સ્વીકારીને,
જવનનૌકા હરિચરણો કૃપાથી જોડી દીધી છે.

કારિઃકું

જુદા જુદા બધા વેશ

જુદા જુદા બધા વેશ જીવનમાં પ્રેમ ભજવે છે,
અવતરે જે વિશે તેનું સ્વરૂપ પ્રત્યક્ષ લેતો છે.

અવતરે જે વિશે તેના બધા ગુણધર્મ આચરતો,
ખરેખર તે ભૂમિકામાં થઈ તાદાતમ્ય વર્ત્તતો.

જીવનનો હેતુ અવતરતાં કરવવા ઊધર્વ આરોહણ
-જીવનમાં સાધવા તેને અનેક જ શાં ધર્યા રૂપ !

જીવન અસ્તિત્વ જે જે છે બધું તે તે ખરેખર છે
-અસલનાં મૂળમાં પ્રેમ પ્રતિષ્ઠિત વ્યક્ત પ્રત્યક્ષે.

કારિ: ઊં

ભિખારીની મૂડી તે છે

અમારી જિંદગાનીનું હવે કર્તવ્ય એક જ છે,
મરીને જીવનું પળપળ ખરું જીવન અમારું તે !

હદ્યનો પ્રેમ જીવનની થયેલી ભર્સમાંથી જે
-કૃપાથી ઉદ્ભવેલો છે, ભિખારીની મૂડી તે છે.

હદ્યના પ્રેમને કોઈ જીવનમાં બહુ જ થોડાક
-અનુભવી તે શકેલા છે, ખરેખર વ્યક્ત તે મૌલિક.

હરિએ તો હંમેશાંને અખંડ જ ખેલ રચિયો છે !
અમે તે ખેલમાં રમવા જીવન સ્વીકાર કીધો છે.

કારિ: ઊં

જવનમાં ચાહવાકેરો

જવનમાં ચાહવાકેરો અમે ધંધો સ્વીકાર્યો છે,
હદ્ય ઉિતરી ગયેલું તે, હવે ના લક્ષ્ય બીજું છે.

પ્રથમ દણ્ઠિ, વલાશ, વૃત્તિ પૂરાં અંતર વિશે વાળી,
કરેલું ચાહવું નિજને, સ્વધર્મ તે સ્વીકાર્યો છે.

હદ્ય એકાગ્ર કેંદ્રિત થતાં એકલક્ષી તે પ્રત્યે
-કરી યાહોમ જુકાવી, સમર્પણ દિલ કરેલું છે.

જતાં ખોવાઈ સંપૂર્ણ કૂપાથી તો જડેલું છે,
હવે વિસ્તારમાં એનો બધો ઉપયોગ લીધો છે.

કારિ: ઊં

જીવન ચરણો સમર્પું છે

હદ્યથી ચાહી ચાહીને ખતમ જીવન કરી દઈને
-હદ્યના પ્રેમના ભાવે, સમાઈને જ જીવવું છે.

કમાણી માત્ર જીવનની ખરેખર હોય જો કંઈકે,
જીવન યાહોમ કરી દઈને ચરણ સંતોષ દેવો જે.

હદ્યના પ્રેમમાં જીવવું, સતત દિલ પ્રેમમાં ઠરવું,
હદ્યમાં એક દિલ દિલથી થઈ, દિલને વિરમવાનું !

હદ્ય મળતાં, મળ્યું સઘળું, જીવનનું સર્વ કંઈ પણ જે,
હદ્ય તે પ્રાપ્તિને અર્થે જીવન ચરણો સમર્પું છે.

કારિઃકુ

હદ્ય મળતાં, મળ્યું સધળું

જીવન સુધારવાનું તો ન કોઈનું સ્વીકાર્યું છે,
અમારું કર્મ તે ના છે, હદ્ય ચાહવાનું જાણ્યું છે.

અપાપી પાપી કે એવું ન જોવાનું અમારે છે,
ગમે તેવી ભલે વ્યક્તિ હદ્ય સંઘરવી જાણી છે.

અમારે વ્યક્તિના કરતાં જરૂરી વ્યક્તિનું દિલ છે,
હદ્ય મળતાં, મળ્યું સધળું ખરેખર દિલ પ્રમાણ્યું છે.

‘હદ્યના ચાહવાથી શું પરિણામ નીપજતું છે !’
-ન પરવા તે વિશે દિલને, હરિપદ સર્વ સોંઘું છે.

કારિઃઅં

હદ્યથી ચાહવાનું છે

ગમે તેવાં ભલે છો હો, ન કંઈ ચારિત્ર સાણું છે,
છતાં તેને અમારે તો હદ્યથી ચાહવાનું છે !

જીવનમાં મૂળના ધરનો ખરો ધંધો જ મૂળથી જે
-હદ્યથી રંગવાનો ને ખરેખર ચાહવાનો છે.

જીવનમાં રંગવાકેનું ન બનતું કર્મ મુજથી તે,
પરંતુ ચાહવાનું તો હદ્યથી, કર્મ મુજ કર છે.

જીવનનો લાડલો હરિ તો ન લાયક, યોગ્ય લાયક જે
-ભૂલેચૂકે ન જુએ છે, સતત ચાહ્યા કરે બસ તે.

કારિઃઊँ

અમારે ચાહવાનું છે

હદ્યના ભાવથી પૂરા ભલે સંસારીને ચાહો,
છતાં સંસારી તો પાછો ન રીત તે દિલ ચાહવાનો !

નર્યો શો સ્વાર્થ સંસારે પૂરો એને જ ભરપૂર છે,
પછીથી ચાહવા એને હદ્ય અવકાશ ક્યાંથી રહે ?

મળેલાંમાં, ભળેલાંમાં પૂરાં તન્મય ખરા દિલથી,
પછીથી અર્પવા હૈયું બીજું તે લાવવું ક્યાંથી ?

ભલે ચાહો ન ચાહો છો, અમારે ચાહવાનું છે !
જવનમાંહી ચલવવાનો ગુજરો તો અમારે તે !

કારિઃકું

કૂપાથી આપતા રે'જો

અમારો રાહ જુદો છે, તમારો રાહ જુદો છે,
છતાં મેળ ઉભય વચ્ચે હદ્યથી ધારવાનો છે.

તમે સંસારની રીતે, ચહો અમને ચલવવાને,
અમારે ભાવની રીતે, કૂપાથી વર્તવાનું છે.

મનન ચિંતવન હરિકેરા વિશે પરોવાઈ જવવું છે,
હરિની પ્રેરણાથી તો, અમારે નાચવાનું છે.

અમારી રીત વર્તતાં, હદ્યનો સાથ, સહકાર
-કૂપાથી આપતા રે'જો, કદી કરશો ન પ્રતિકાર.

કારિઃકુ

જીવન પાનાં અમારાં તો

જીવન પાનાં અમારાં તો સ્વજન સાથે પડેલાં છે,
હવે નિભાવી લેવાની તમારે હાથ ચાવી છે.

અમારું કોઈ ઠેકાણું કશું ક્યાંયે જરા ના છે,
તમારે સાચવી લેવાતણું તે કર્મ, તમ કર છે.

શું યદ્વાતદ્વા સંપૂર્ણ બધું જે તે અમારું છે !
લગાવાતાંય ત્યાં ગોથાં પડે સમજણ ન તેવું છે.

છતાં જ્યારે પનારે જ્યાં ફૂપાથી, તમ પડેલા તે
-હવે સંભાળી, સંભાળી શું લેવાના તમારે છે !

કારિ: ઊં

રસ એ જ જીવન છે

જીવન આનંદ અમૃતનો તમારી સાથ લહાવો તે
-હદ્દ્ય ભોગવવો રસથી છે, રસે તરબોળ જીવવું છે.

વિના રસ જીવવું મિથ્યા, અને રસ એ જ જીવન છે,
ખરેખર રસ પૂરો જ્યાં ત્યાં બધે પ્રસરાયેલો શો છે !

વિના રસ કોઈ પડા વિશે જીવન જીવી શકે છે ના,
જીવન જીવવાના પાયામાં મૂળે સિંચાયલો રસ ત્યાં.

બધે જેમાં અને તેમાં નર્દો રસ, રસ શું નરદમ છે !
ઇલોછલ રસથી ઇલકાઈ રસામૃતથી જ જીવવું છે.

કારિઃકું

નિમિતો જે મળેલાં છે

નિમિતો જે મળેલાં છે સ્વજન તે સાથ જીવનને
-કૃપાથી જોડી દેવાનું સહજ ને સરળ થયેલું છે.

પરસ્પરમાં પરસ્પરથી ઉિછળતા ભાવથી હદયે
-જીવન સંબંધમાં જીવતાં રહીએ ચેતનાત્મક તે.

હદયના ભાવ ઉમળકે સતત વખ્ટાવી વખ્ટાને
-પરસ્પરને ભીજાવીને હદય મળવાનું જંખીએ .

જીવન આનંદ અમૃતનો ખરેખર દિવ્ય લહાવો છે,
જીવન રસહેલીમાં રસબસ થઈને મસ્ત શા જીવીએ !

કારિઃકું

જીવન સંબંધ કાયમ છે

તમારે ને અમારે તો જીવન સંબંધ કાયમ છે,
કદીક વત્તો, કદીક ઓછો, થતો ક્યારેક લાગે છે.

કંઈક તે કાળનો એવો જીવનકમ ચાલતો આવે,
પરંતુ સ્પષ્ટ સમજણ ના કશી એની પડેલી છે !

‘કદી રીતે જીવન સાથે હૃદય જોડાયેલાં છીએ’
-ન સમજણ, તે છતાં સાથે વણાયેલાં જીવનમાં તે.

જીવનમાં સંકળાયેલાં પરસ્પરનાં જ લટિયાં છે,
હૃદય સંબંધ જીવંતો ટક્કા કરજે કૃપાથી તે.

કારિ: ઊં

કૃપાથી જે મળેલાં છે

અમારે કોઈના જીવને ન નરસું, સારું કેં જોવા-વલાણ, વૃત્તિ અને દાખિ નથી હોતાં જ અમ તેવાં.

કૃપાથી જે મળેલાં છે હદ્યના પ્રેમ ઉમળકે-હદ્યથી વારી વારીને અમારે ચાહવાનાં છે.

‘મળેલાંએ બહુ વેળા જીવનનાં ખૂન કીધાં છે’,
ન અમથું માની લીધું તે, અમે પ્રત્યક્ષ જોયું છે.

‘હદ્યથી ચાહવું તેને જીવનનો ધર્મ જાણ્યો છે’,
હદ્યના પ્રેમનો ધર્મ હદ્ય એવો જ પ્રીણ્યો છે.

કારિઃઊँ

અમારે તો સ્વજન સાથે

તમે તમને પૂરેપૂરાં ન સમજ જો શકો છો તો તો
-પછી ક્યાંથી સમજવાનાં અવરને તે કઈ રીત તો ?

તમારાયે જીવનમાં તો કંઈક કરતૂક એવાં છે
-શરમથી માથું ત્યાં કેવું નમાવી દેવું પડતું છે.

અમારે તો સ્વજન સાથે જીવનમાં તો બધી રીતે
-હળી મળીને, ભળી ગળીને સમાઈ ત્યાં જવા ઢિલ છે.

પરંતુ હુંકડે પાસે ન અમને આવવા દે છે,
અરે ! ઉલટાં જ હડસેલી સ્વજન કેવાં મૂકે અમને ?

કારિ: ઊં

વિરલ કોઈક મરજ્જવા

શું ખાલી મશકરી ઠઢા સમું જીવનને ગણતા છો ?
નકામું વેડફી મારો જીવનને હેતુ વિના તો.

મળેલી લક્ષ્મીને અમથી નિરર્થક ખર્ચી ના કો દે,
જીવન તો લક્ષ્મીથીએ છે અધિક કંઈ મૂલ્યવાળું જે.

મહામોદ્ધામૂલું જીવન કશી ગણના જ કોઈ સાથે
-કદ્દી પણ થઈ ન શકતી છે, મહત સદ્ગ્ભાગ્ય મળિયું તે.

જીવનમાં કેટલાં કેવાં છુપાયાં રત્ન મોદાં છે !
વિરલ કોઈક મરજ્જવા કૃપાથી રત્ન પામે તે.

કાર્યાલય

ખંડ - ૧૧

હરિદર્શન

હદ્દ્યમાં ચેન પડવાનું હદ્દ્યનું મુક્ત સાધન જે,
હદ્દ્યમાંછી બિરાજને હદ્દ્ય અમૃત પીવું તે.

કારિઃકું

હદ્યનો પ્રેમ ખીલ્યો છે

હદ્યનો પ્રેમ પાંગરવા હરિપદ ભક્તિ સાધન છે.
સ્મરણમાં દિલ જુકાવીને ચરણ મન ઝંપલાવ્યું છે.

અખંડિત સ્મરણ જરણું જહીં વહેતું થયેલું છે,
હરિપદ ભાવના ભક્તિ સ્વયંમેળો ખીલેલી છે.

ચરણની ભક્તિથી ભાવ સકળ આધાર સ્હુર્યો છે,
સ્હુર્યો કરતા સતત ભાવે હદ્યનો પ્રેમ ખીલ્યો છે.

હદ્યનો પ્રેમ પાંગરીને અનંતાનંત વ્યાપે છે,
સકલ બ્રહ્માંડ એકત્વ હરિરસ જે પમાડે છે.

કારિ: ઊં

રસીલી ભવ્ય તે કથની !

સતત બસ એકની એક જ લગનની ચોટ લાગી છે,
મનાદિ મસ્ત રમમાણ, હદ્ય તલ્હીન તે વિશે.

હદ્ય એકાગ્રતા પળ પણ તૂટી કેમે જતી ના છે !
હરિપદ ખેલવું, કૂદવું સતત નિજ કર્મ ‘રમવું’ તે.

થતાં જાંખી, સ્મૃતિ એની નસેનસ રગરગો પ્રગટે,
અનોખો દિવ્ય આનંદ હુવારા જેમ શો ઉછળે !

પળેપળની હદ્ય મસ્તી ઉછળી ઉછળી ચહે ભરતી,
ન જેની ઓટ ક્યાંયે છે, રસીલી ભવ્ય તે કથની !

કરિઃઊ

હરિની યાદગીરીમાં

હરિની યાદગીરીમાં જીવન આખું વિતાવ્યું છે,
હરિના સ્મરણનો રંગ બધા દિલ પર લગાડ્યો છે.

થતાં ઘેરો સ્મરણ રંગ મનાદિમાં ચઢેલો છે,
જીવન રંગાઈ જઈ પૂરું ભભકદાર શું ચમકે છે !

જીવનની સર્વ રોનક શી બધી બદલાઈ ગયેલી છે !
હવે રોનકનો ચમકારો નસેનસ મસ્ત ધબકે છે.

જીવનમાં માત્ર જળહળતો હવે હરિભાવ જળકે છે,
જીવનનો તેવો જબકારો શી વ્યાખ્યા પ્રેમની છે તે !

કારિ: ઊં

જીવન જીવવાતણો લહાવો

અભિમુખતા હરિભાવ પરત્વેની થવાકેરું
-હદ્યના પ્રેમનું કેવું ખરેખર કર્મ તે સાચું.

હદ્યના પ્રેમનો ભાવ અખંડિત ને અબાધિત છે,
જીવન ધ્યેય નિરંતરના અસ્ખલિત ભાવમાં તે છે.

જીવનમાં જ્યાં નિરંતરનો હદ્ય ભાવ વહેતો છે,
હરિભાવ જીવંતો શો બને સાકાર પ્રત્યક્ષે !

જીવન આનંદ પ્રેમામૃત થકી ભરપૂર છલોછલ છે,
જીવન જીવવાતણો લહાવો ખરે ! અદ્ભુત કેવો તે !

હદ્ય તે સ્થૂળ હદ્ય ના તે, હદ્ય ના સૂક્ષ્મ પણ તે છે,
હદ્ય તો કારણાતીત, નિરાકાર સ્વરૂપનું તે.

કાંઈ કાંઈ

કૃપા લીલા હરિની છે

બધે જેમાં અને તેમાં હરિરસ માત્ર ચાખે છે.
-પનોતો ભક્ત જીવનનો વિરલ કોઈક એવો છે.

વિપદ, મુશ્કેલી, આપત્તિ, દુઃખો, અડયાણ, ગુંચો, પ્રશ્નો
-હદ્યના પ્રેમવાળાને જીવનમાં આવી પડતા છો,

પરંતુ ભાવવાળાનું સતત મન ભાવમાં રહે છે,
હદ્ય તે ભાવને લીધે મહત્ત્વ ના કશાનું છે.

હદ્ય જો ભાવ જળહળતો જીવંતો ચેતનાત્મક છે,
ઉકેલાતું જતું સઘળું જીવન એવાનું કર્દી જે તે.

જરૂર સુતસું, સરળ, યોગ્ય જીવનમાં સર્વ લાગે છે,
જીવનની એવી બલિહારી કૃપા લીલા હરિની છે.

કારિઃકું

શું પગલાં પ્રેમનાં છે ત્યાં !

હૃદય તો પ્રેમ અમૃતનો સતત ઊછળનો દરિયો છે,
કરોડોમાંથી કોઈક તહીં રૂબકી લગાવે છે.

ડૂભ્યાં જે તે વિશે અંતર હરિપદ રસ વિશે ડૂલ્યાં,
જીવનની આરપાર જ તે જીવનમાં મસ્ત શા મહાલ્યા !

જીવન પ્રસરાયેલું જ્યાં ત્યાં જીવન અસ્તિત્વ જ્યાં ત્યાં છે,
અનંતાનંત જીવનની બધી સરહદ મહાલ્યો છે.

જીવનનાં સર્વ પાસાંમાં, જીવનનાં સર્વ ક્ષોરોમાં,
જીવનની સર્વ દિશામાં, શું પગલાં પ્રેમનાં છે ત્યાં !

કરિઃઊ

સતત તે મસ્ત ચેતનમાં

જીવનનો ભંગ જોયો છે, જીવનને તંગ નીરખ્યું છે,
જીવનનો જંગ બેલ્યો છે, જીવનનો રંગ મહાલ્યો છે.

જીવનના રંગની મસ્તીતણી લહેજત અનોખી જે,
રસીલો કો'ક બડભાગી હરિનો લાડલો મહાલે.

મહાસાગર ઉછ્વષ્ટો જે જીવનરસનો ખરેખર છે !
ચરણનો જે પરમ ભક્ત પ્રસાદી માત્ર પામે તે.

હદ્યનો પ્રેમ એવાનો જતો ઓળંગી મય્યાંદા,
જીવનમાં ને જીવન પાર, સતત તે મસ્ત ચેતનમાં.

કારિઃકું

ભરતી-હેલી ચઢેલી છે !

હદ્યના પ્રેમની મસ્તી અવધની પાર જ્યાં પહોંચે,
મહોબતનો જ મહેરામણ જીવનમાં મસ્ત ઉછળે છે.

બધે જેમાં અને તેમાં ભર્યું ભરપૂર લાગે છે,
જીવનમાં શો મદોન્મત નર્યો આનંદ ઉછળે છે !

લહર પર શી લહરિઓની ભરતી-હેલી ચઢેલી છે !
વટાવીને કિનારાને કયહીં ને કહીં જ સ્પર્શે છે !

હદ્ય જેનું અતિશય જે જબરજસ્ત શું તરસ્યું છે !
હદ્યનો પ્રેમ તે વાતે ચહી ઝાંખી હદ્ય દે છે.

કારિઃઊં

મહોબતનો જ મહેરામણ

કશું પણ દિલ ન જાણ્યું કે ‘નયન તુજ ગૂઢ અણસારે
-હદ્ય આકખને ભારે બનાવ્યો ગાંડોતૂર જ છે.’

સતત બસ નીરખ્યા કરવું વળી વળીને, ચહી ચહીને,
ફરી ફરીને હદ્ય ધંધો, હવે બસ એકલો શો તે !

તલપ ચાહવાતણી શી દિલ ! તલપ લાગેલ જાણે તે,
તલપની ન્યારી મતલબનાં નશો, ખુમારી જષબર તે.

જવનમાં ઊછળી ઊછળીને હદ્યને તરબતર કરી દે,
મહોબતનો જ મહેરામણ ઊછળતો ઓર શો રહે છે !

હરિઃઊ

હરિ શો વહાલ કરતો છે !

હરિ નજદીકમાં નજદીક છતાં હોવા, ન બોલાવે !
મહા અચરજ સમું એના બીજું કોઈ શું જીવન છે ?

જીવનમાં જ્યાં હરિ નિજનો કૃપાથી જો થયેલો છે,
પછીથી દિલ ઉમળકાથી, કરો કાં વહાલ ના એને ?

હરિ જ્યાં વળગતો આવે, હરિ દિલ ભેટવા આવે,
અણા મારી મારી જે, હરિ શો વહાલ કરતો છે !

હરિના વહાલની એવા કદર કો' જીવને ના છે,
છતાં કેવો હરિ પોતે ન ચાહવાનું જ ચૂકે છે !

કરિઃઊ

હદ્ય સગપણ હરિથી તો

પળેપળ દિલ હરિ જેને ખરેખર યાદ પ્રગટે છે,
હરિની યાદમાં જેને જીવન પોતાનું લાગે છે.

હરિને દિલ સર્વસ્વ સમર્પા દઈ જીવે છે જે,
હરિ તેને ગણી નિજનો કદીક અગ્નિમાં મૂકે છે.

શહૂર, હામ, ખમીર, ધીરજ ગુણો જીવંત કેવા તે !
પ્રસંગોથી જીવનની ત્યાં સ્થિતિ કેવી જણાયે છે !

પ્રસંગો આરસીરૂપ છે, હોઈએ જેમ તે રીતે
-બતાવી તેમ આપે તે, પ્રસંગો શા પ્રસાદી છે !

હરિની બોલબાલા છે, હરિનો જ્ય બધે શો છે !
હરિના નામથી જીવન કૃપાથી તો મળેલું છે.

હદ્ય સગપણ હરિથી તો થયું તેથી જીવન આ છે,
હવે કદી કાળ ભૂસાયું ભૂસાવાનું ન દિલથી તે !

કારિઃઅં

હરિમાં દિલ લગાડીને

હરિ પાસે જ હોવા તે છતાં ના દિલમાં એને
-ઉંડા ઉંડા હૃદયભાવે કદી પણ જંખતા કો છે !

હરિ પર લાડ ને કોડ ઉમળકો જો ન જાગે છે,
વધુટે હેત હરિ પર ના, કહેવું શું પછી તમને ?

હરિ સમ કોઈ જાદુગાર બીજે જોવાય ના મળશે,
હરિને દિલ ભરી ભરીને કરી લ્યો વહાલ ઉછળતે.

હરિમાં દિલ લગાડીને, હરિમાં ભાવ પ્રેરીને,
હરિનાં દિલથી ઘેલાં થઈ, હરિમાં દિલ મહાલોને !

કારિઃકું

અમારો દમ શું કાઢે છે

હરિ રળિયામણો સુંદર ન જેનો ક્યાંય જોટો છે,
છટા કેવી અનોખી છે ! નયન, મુખચંદ્રની શી તે !
ખરેખર મસ્ત લટકાળો, હૃદય મન સૌ ભરી હે છે,
કરાવી મુગ્ધ દઈ દિલથી પદે ચોંટાડી રાખે છે.
પછી આકર્ષણે એના પરોવાવે મનાદિને
-હૃદયમાં લહે લગાડીને, પછી ભાગી જતો શાને ?
વખા કેવા પડાવે છે ! તમાશો વેગળો રહીને
-કરે નીરબ્યા, હસી હસીને અમારો દમ શું કાઢે છે !
અમારે કોની પાસે જઈ પછી ફરિયાદ કરવાની !
હરિને પ્રાર્થના માત્ર ‘હૃદય સંતોષ તું દેજે.’
તલસતો, જે તલપતો, દિલ કહીં સુધી હૃદય અમને
-અતૃપ્ત જ રાખશે દિલમાં ! રહેમ કરજે, નિગાહ કરજે.

કારિઃઅં

થવાનું શૂન્ય તો રહે છે

હદ્ય મનનો બધો દોર હરિનાં તે ચરણકમળે
-લગાડીને જ વળગાડી ફરો પદીથી જ નિશ્ચિતે.
મધુરા માત્ર હરિના તે સ્મરણની કેવી તાકાત !
વિના અનુભવ કદ્દી પણ જે ન આવે ખ્યાલમાં સહેજે.
લઈ લઈને સ્મરણ હરિનું કંઈ પાપી તરેલા છે,
થયેલા જે હરિભક્ત કશી ના આંચ એને છે.
હરિને સોડમાં લેવો ન હાંસીખેલ વાતો છે,
શું ખંડાવું પડે રજરજ ! થવાનું શૂન્ય તો રહે છે.
તમારા જ્યાં તમે ભાવે પૂરૈપૂરા મટી જાતાં,
વધ્યા સંપૂર્ણ છો પદ જ્યાં થયા છો ત્યાં જ શા હરિના !
હરિને યાદ કરી કરીને, હરિને ચાહી ચાહીને,
સ્મરી સ્મરીને હરિ દિલથી હરિનું તત્ત્વ જાણું છે.

હરિ:ॐ

હરિ રાજ કરી ધોને

હરિને બેટી બેટીને હદ્યથી ભીસી ભીસીને,
થઈ ઓતપ્રોત દિલથી તે, હરિરસમાં ભીજાઓને !

હરિરસ ના પડ્યો રેઢો, તપશ્ચર્યા, તપ, ત્યાગ
-થતાં ભક્તિ બહુ જન્મે મળે, ત્યારે હરિપાદ.

હરિને ચાહી ચાહીને, હરિ પર મોહી મોહીને,
હરિમાં એક થઈ જઈને વ્યસન હરિનું લગાડોને !

હરિ પર વારી વારીને મનાદિને પલાળીને.
હરિને દિલ અર્પિને હરિ રાજ કરી ધોને !

કારિ: ઊં

હરિનું સૌ મધુરું છે

હરિની ગેલ ભસ્તીને નિહાળીને, નિહાળીને,
લીલા હરિના શિશુજીવનતણી શી યાદ આવે છે !

જશોદાને હરિ કેવો બેંચાંનીયાં કરી દે છે !
હરિને બાંધી ખાંડણિયે હરિને પાઠ શીખવે છે.

હરિની બાળલીલાનો મધુરરસ તો હરિનો, જે
-હદ્યથી ભક્ત સાચાં છે, પીવા આતુર કેવાં તે !

હરિનું સૌ મધુરું છે, મધુરથીયે મધુર તે છે,
હરિની વક્તા મધુરી શું સુંદર દિલ લાગે છે !

કારિઃકુ

જીવન સૌરભ ખીલંતું છે

હરિની યાદગીરીથી જીવન સૌરભ ખીલંતું છે,
હરિની યાદગીરીથી જીવન ગૌરવ બઢંતું છે.

હરિની યાદગીરીથી જીવન રોનક બદલતું છે.
હરિની યાદગીરીથી જીવન મૌલિક બનતું છે.

હરિની યાદગીરીથી વલણ, વૃત્તિ અને દષ્ટિ
-જીવનમાં ફેરવાતાં રહે, ખૂબી શી યાદગીરીની !

હરિની યાદગીરીનો નિરંતરનો હદ્ય ભાવ
-બઢંતાંમાં ખરેખર શો ઊછળતો છે હદ્યપ્રેમ !

ઊછળતા ધોધના જેવો, નદીનાં પૂરના જેવો,
હદ્યના પ્રેમનો ભાવ વહેતો રહે જીવનમાં શો !

કારિઃકુ

ગગનને આંખી દેવું છે

ગગનને આંખી દેવું છે હરિનો છેડો પકડી શો !
હરિ વિના જીવન લૂલું પૂરેપૂરું શું લાગે છે !

ટટારી દિલ ખબરદારી હરિથી કેવી અમને છે !
હૃદય જાંખી દઈ પાઇ શું સંતાઈ જતો તે છે !

શી દોયાદોટ તે અમને જ્યાહી ત્યાહી શું કરાવે છે !
હરિ હોવા છતાં પાસે ન જડતો કોઈ રીતે તે.

બધી મહેનત કરાવે છે હરિને દિલ સમજવાને,
સમર્થોમાં સમર્થ જ છે, હરિ જેવો ન બળિયો કો !

કારિઃકું

બધું ભરપૂર રસથી છે

થતાં દર્શન રસાળાં દિલ શું એકાકાર તહ્વીન છે !
વિના રસ કંઈ જ અસ્તિત્વ કશાનું દિલ ન કેં રહે છે.

બધું ભરપૂર રસથી છે, રગેરગ રસ ભરેલો છે,
તદાકાર જ પૂરેપૂરો રસામૃત પાનથી શો તે !

જવન સાથે વજાયેલી બધી મૂળ પ્રકૃતિ શી જે !
હદ્યનો પ્રેમ શો એને નૂતન દર્શન કરાવે છે !

હદ્યનો પ્રેમ જબ્બર શો અનંતાનંત પોતે છે !
બધાં સાથે છતાં પાછો શું એકાકી જ પોતે છે !

કારિઃકુ

હદ્યનો પ્રેમ મેળવતાં

બહુ મથતાં, પૂરો નાકે શું દમ આવી ગયેલો છે !
હદ્યનો પ્રેમ મેળવતાં ગગન નીચે ઉતાર્યું છે.

કદી આકાશના વિના ન બેસણું ક્યાંય એનું છે,
છતાં આકાશમાંયે તે સમાઈ ના રહેતો છે.

ખુમારી, સુરખી, ખુશબો અતુલનાત્મક રગેરગ છે,
જીવનના પ્રેમની મસ્તી અમીરી બાદશાહી છે.
(સુવાસિત ને પ્રકાશિત સૌ બનાવી પ્રેમ શો દે છે !)

રસે મધમઘનું સંપૂર્ણ જીવનને તરબતર કેવું-
ચ્યમતકારિક, અદ્ભુત બનાવી પ્રેમ શો દે છે !

અગોચર કલ્પનાતીત, અગમ્ય, અતીત વાણીથી,
શકે ઊતરી અનુભવમાં છતાં શો પ્રેમ ભક્તિથી !

હરિ:ઊં

હરિ મૂળ મોભ ઘરનો છે

હરિ શો સાવ નજીદીક છે ! છતાં એને ન કો નીરબે,
હરિનો પ્રેમ સહુની પર, છતાં હરિને ન કો ચાહે.

બધાંમાં શો હરિ છૂપો પ્રવર્તેલો રહેલો છે !
બધું જે તે જ શક્તિથી ખરેખર એની ચાલે છે !

હરિ આધાર સૌનો છે, હરિ મૂળ મોભ ઘરનો છે,
છતાં એવા હરિને તો ન કંઈ ગણકારતું કો છે.

હરિ વિનાનું જીવન સૌ નકામું વ્યર્� સઘળું છે,
હરિ વિનાની પળ એક જીવન જીવવું, જીવન ના તે.

કારિઃઊँ

પરસ્પરના મિલનમાં શી

સખાનાં દિલ, હદ્ય પ્રાણતણો મેળો જીવનમાં છે,
હદ્ય સંબોધવામાં શો હદ્યનો પ્રાણ મલકે છે !

હદ્ય જ્યારે શરૂ શરૂમાં થયું મળવાનું એને જ્યાં !
-કઈ રીતે પરસ્પરથી શું આકખ્યાઈ ગયેલા ત્યાં !

પરસ્પરના મિલનમાં શી કથા રોમાંચકારી તે !
જીવન અંતરમાં જોડાવી કરાવ્યા એક છે તેણે.

પરસ્પરના મિલન ઐક્યે સહજ આનંદ પ્રગટે જે,
સમગ્ર સર્વ જીવનને કરી કૂતકૂત્ય દે છે તે !

કારિઃકુ

શું પળ દર્શન થતાં

મરીને જીવનું પળપળ, નૂતન અવતાર પળપળ છે,
છબી એની સહજમેળે શી બદલાતી પળેપળ છે !

ન એને કોઈ ચશમાં છે, ન એને રીત રસમ કંઈ છે,
સ્વતંત્ર, મોજીલો, રસિયો, સ્વભાવે શો સહજ તે છે !

ધડીક પળમાં શું સંતાઈ છુપાઈ જાય છે શો તે !
નયનમાં પ્રગાટી પ્રત્યક્ષ છતો થાય નયન વળી તે !

શી પળવારતણી એની નજર રસમય કરી દે છે,
શું પળ દર્શન થતાં ! પાછાં થતાં શું બંધ પળમાં તે !

કારિ: ઊં

સતત તરતું રહે છે જે

મનન એક જ, હદ્ય ચિંતવન ખરેખર તેથ એક જ છે !
સતત દિલની શી લગનીમાં હદ્ય રસબસ થયેલું છે !

લગનીનાં તાણ ને ખેંચે હદ્ય આડ્લાટકારી છે,
હદ્ય તલસાટની મસ્તી ખરી ભરતીની છોળે છે.

કશું પણ મોખરે ના છે, લગની બસ એકધારી છે,
નસેનસ રોમરોમે ને વળી શી પાર તેની છે !

હવે એથીય જે આગળ બધું જે તે થતું રહે છે,
ઇતાં તે તે નજર સામે સતત તરતું રહે છે જે.

કારિઃઊँ

હદ્ય પ્રેમે નવાજે છે

શું માગ એકલો એક હરિ આધાર જીવનમાં,
બધું ઘનઘોર અંધારું હરિ વિના જ જીવનમાં.

હરિ એક એકલો શો જે જીવે છે ને જિવાડે છે !
બધાંનું બળ હરિમાં છે મદદગાર બધાંનો તે.

હરિના એકલામાં જો જીવન જીવવાનું દિલ જેને,
હરિ તેને હદ્યમાંથી હદ્ય પ્રેમે નવાજે છે.

હરિની પર પૂરેપૂરો ભરોંસો દિલ જેને છે,
હરિ તેને જ પોતાનો કરી લઈ દિલ બક્ષો છે.

કારિ: ઊં

જીવનની ધન્યતા દિવ્ય !

જીવનનું કર્મ જુદું છે, જીવનનો ધર્મ જુદો છે,
જીવનનો મર્મ જુદો છે, જીવનનું શાન જુદું છે.

હદ્યના પ્રેમની આગળ જીવનમાં કર્મ ને ધર્મ
-કશાં વિસાતનાં ના છે, જીવનાં શાન ને મર્મ.

જીવનવિકાસની સીડીતણું છેલ્લું પગથિયું જે,
હદ્યના પ્રેમકેરું તે, અનુભવથી પિછાડ્યું છે.

હદ્યનો પ્રેમ અનુભવતાં ઈતિકર્તવ્ય લાગે છે,
જીવનની ધન્યતા દિવ્ય, પછી અનુભવ શો પ્રગટે છે !

કારિઃકું

હદ્યના પ્રેમની વાચા

વિના અતિમાન, આંબર, કશા શાણગાર વિનાના,
ખરે નિર્વચ્છ શબ્દોનું અજબ સૌંદર્ય અદ્ભુત છે !

હદ્યના પ્રેમના ભાવતણી વાચા નિરાળી છે,
કદીક ત્યાં શબ્દનું કેવું ચમત્કારિક જાહુ છે !

કથેલા શબ્દની શક્તિ પૂરી પુરવાર થઈ છે જે,
કંઈક નિમાણ જીવનનાં થયેલાં શબ્દથી શાં છે !

હદ્યના પ્રેમની વાચાતણા શબ્દો વિશે શી છે,
-અગોચર ભાવના દિવ્ય ! રસીલું કોક જાણો છે.

હરિ: ઊં

અમૃત

હદ્યમાં ચેન પડવાનું હદ્યનું મુક્ત સાધન જે,
હદ્યમાંહી બિરાજને હદ્ય અમૃત પીવું તે !

બધા આધારમાં કેવું હદ્યકેરું અનુપમ જે
-અનોયું, મુક્ત, નોધાસું અલૌકિક સ્થાન મૌલિક છે !

હદ્યમાંહી હદ્ય પોતે હદ્યથી ઓતપ્રોત જ જે,
જરીક અળગું થતાં કેવું હદ્યમાં શૂળ ઉપજે છે !

હદ્ય તે તો હદ્યમાંનો પ્રસાદ જ જે હદ્યનો છે,
હદ્યના પ્રેમનો લહાવો શું જીવવું એ જ અમૃત છે !

॥હરિ: ઊં ॥

સાધનામભ

૧. મુખથી કે મનમાં જાગૃતપણે જપ, સાથે સાથે હદ્યપ્રદેશો ધ્યાન તથા ચેતનના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ.
૨. પ્રત્યેક પળે સતત સમર્પણ, સારું તેમ જ નરસું-બનેનું.
૩. સાક્ષીભાવ, જાગૃતિ, વિચારોની સાંકળ ન જોડો.
૪. બને તેટલું વધુ વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો અને ખૂબખૂબ શરણભાવ જીવનમાં ચેતનાપૂર્વકની જાગૃતિથી કેળવ્યા કરો.
૫. આગ્રહો—પ્રભુચિંતન સિવાયના સર્વ આગ્રહો છોડો, નમતા કેળવો, શૂન્ય થવાનું ધ્યેય રાખો.
૬. ખૂબ ભાવપૂર્વક હદ્યસ્થ રહીને આર્ક અને આર્તભાવથી પ્રાર્થના કરો, ભગવાનને સર્વ સુખદુઃખ જણાવતા રહો, તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો, મનમાં કશ્યુયે ઘોળાવા ન દો. ખાલી રહો.
૭. આવી પડતાં કામો પ્રભુનાં સમજો, જરાયે કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો. પ્રત્યેક પ્રસંગ-બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ધટે. પ્રત્યેક પ્રસંગ પાછળ પ્રભુનો ગૂઢ, શુભ સંકેત રહેલો છે.
૮. આત્મલક્ષી-અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંગેવવા દો નહિ.
૯. પર (પારકાંની) સેવા પ્રભુની સેવા સમજો, સેવા લેનાર, સેવા દેનાર ઉપર, સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે. રામે આખ્યું છે અને રામને દઈએ છીએ, ત્યાં ‘મારું મારું’ ક્યાં રહ્યું? તારું આ જગતમાં છે શું?
૧૦. પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત, વ્યવહાર આપણા ધ્યેયને વેગ આપે એવા ખાસ હેતુસર, હેતુનું લક્ષ જીવતું રાખીને કરવાં. વાંચતી-લખતી વખતે અને પ્રત્યેક કર્મ કરતી પળે ભાવની સ્મરણ ધારણાનો અભ્યાસ કેળવ્યા કરો.
૧૧. વૃત્તિનું મૂળ શોધો, તેનું પૃથક્કરણ કરો. તેમાં ભેળવાયા વિના તેને તટસ્થતાપૂર્વક અને સ્વસ્થતાપૂર્વક નિહાળો.
૧૨. પ્રભુની પ્રત્યેક કથા, સૌંદર્ય, રમ્યતા, વિશુદ્ધતા આદિ પ્રસાદીઓમાં રહેલા ભાવનું, તેને તેને અનુરૂપ ભાવનું, આપણામાં ત્યારે અવતરણ

થવા પ્રાર્થના કરવી.

૧૩. ઉર્મિ, આવેશઅને લાગણીને એમને એમ વહી જવાન દો, તેમજ તેમાં બેળવાઈ પણ ન જાઓ. તેનો સાધનામાં ઉપયોગ કરો, તાત્ત્વચિકિત્સા.
૧૪. જમતી વખતે અને પાણી પીતી વખતે જીવનમાં ચેતનશક્તિના અવતરણ-ભાવની પ્રાર્થના કરવી, શૌચ, પેશાબ આદિ હિયાઓ સમયે વિકારો, નબળાઈઓ ઈત્યાદિના વિસર્જનભાવની પ્રાર્થના કરવી.
૧૫. સ્થૂળનો બ્યાલ તથાને સૂક્ષ્મતત્ત્વને નજર સામે રાખો. વૃત્તિની શુદ્ધિ કરો, ભાવની વૃદ્ધિ કરો.
૧૬. પ્રભુ સચ્ચાચર છે. આત્મવત્ત સર્વભૂતેષુંની ભાવના કેળવો.
૧૭. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ગીજળી બાજુ જુઓ. કોઈનાય કાજી ન થાઓ, કશાય ઉપર ઝડપ અભિપ્રાય ન આપો, વાદવિવાદ ના કરો, પોતાનો આગ્રહ ન રાખો, બીજાઓમાં શુભ હેતુઓનું આરોપણ કરો, માનસિક અને સાર્વત્રિક ઉદારતા જીવનમાં પ્રગટાવો, ખૂબ પ્રેમભાવ કેળવો, પ્રકૃતિનું ઉપાંતર કરવાનું છે, તે લક્ષમાં રાખીને પ્રકૃતિવશ ન થતાં કર્મની ઉપરવટ વર્તો. ફળની આસક્તિ છોડો. પોતાને થતા અન્યાયો-આવી પડતાં દુઃખો-આદિનું મૂળ પોતામાં જ છે એમ દ્શાવો, ગુરુમાં પ્રેમભક્તિભાવ દદતર કર્યા કરો. અભીષ્ટા, ઈન્કાર અને સમર્પણનો ત્રિવેણીસંગમ ઉદ્ભબવાવો, સદાય પ્રસન્નતા પ્રવર્તાવો, કૂપા અને પુરુષાર્થના યુગલને જીવનમાં ઉતારો, પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો, મન નિઃસ્પંદ કરો, રાગદ્વષ નિર્મૂળ કરવાની જાગૃતિ રાખો, થયેલા આધ્યાત્મિક અનુભવો પ્રત્યક્ષ રોણિંદ્રા વહેવારમાં જીવતા કરો, ક્યાંયે કશામાંથી ભાગવાનું ના હોય, યદદ્યા જે આવી મળે તે પ્રભુપ્રસાદી ગણીને તેને વધાવી લો. ક્યાંય કોઈની સરખામણી ના કરો, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ એ મનની ભ્રમણા છે, જીવનસાધના સારુ સર્વ કંઈ સાનુકૂળ જ હોય છે, પ્રભુમધ્ય-તેના મૂક યંત્ર-થવાની જ બસ એક ઉતેજના હવે જીવનમાં રાખો.
૧૮. કર્મમાં, કર્મનું મહત્વ નથી, પરંતુ જીવનના ભાવનનું સતત એકધારું, જીવતું ચિંતન રહ્યા કરે એ સવિશેષપણે મહત્વનું છે. તેવો જીવતો અભ્યાસ કર્મ કરતી પળે કેળવવો.

- શ્રીમોટા

॥ હરિ:ઉં ॥

પૂજય શ્રીમોટાના જીવનની મહિત્યની તવારીખ

જન્મ : તા. ૪-૬-૧૮૮૮, ભાડરવા વદ ચોથ, સંવત ૧૮૫૪

સ્થળ : સાવલી, જિ. વડોદરા, નામ : ચૂનીલાલ,

માતા : સૂરજભા, પિતા : આશારામ, અટક : ભાવસાર.

૧૮૧૬ : પિતાનું અવસાન.

૧૮૦૫ થી ૧૮૧૮ : તુટક અભ્યાસ-સાથે આકરી મજૂરી.

૧૮૧૮ : મેટ્રિક પાસ.

૧૮૧૮-૨૦ : વડોદરા કોલેજમાં.

તા. ૬-૪-૧૯૨૧ : કોલેજ ત્યાગ.

૧૯૨૧ : ગૂજરાત વિદ્યાપીઠ.

૧૯૨૧ : વિદ્યાપીઠનો ત્યાગ. હરિજન સેવાનો આરંભ.

૧૯૨૨ : ફેફદુના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો
પ્રયાસ, દેવી બચાવ, ‘હરિ:ઉં’ જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ.

૧૯૨૩ : ‘તુજ ચરણે’ તથા ‘મનને’ની રચના.

૧૯૨૩ : વસંતપંચમીએ પૂ. શ્રીબાળયોગીજ દ્વારા દીક્ષા. શ્રીકેશવાનંદ ધૂણીવાળા
દાદાનાં દર્શને - સાંઈબેડા ગયા. રાત્રે સમશાનમાં સાધના અને દિવસભર
પ્રભુપ્રીત્યર્થી હરિજન સેવા.

૧૯૨૬ : લગ્ન-હસ્તમેળાપ વખતે સમાધિનો અનુભવ.

૧૯૨૭ : હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પણિષામે ‘હરિ:ઉં’ જપ અખંડ
થયો.

૧૯૨૮ : ‘તુજ ચરણે’ ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.

૧૯૨૮ : પહેલી ડિમાલય યાત્રા.

૧૯૨૮ : સાસુરીના પૂ. શ્રીઉપાસની બાબાનું નહિયાદમાં આગમન, એમના આદેશ
મુજબ સાકુરી જું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ.

૧૯૩૦ : મનની નીરવતાનો સાક્ષાત્કાર.

૧૯૩૦ થી ’૩૨ દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલમાં.
હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો. સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન
પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓને સમજાવવા વીસાપુર જેલમાં સરળ
ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિવરણ લાખ્યું-‘જીવનગીતા’

૧૯૩૪ : સંગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર.

૧૯૭૪૬થી ૧૯૭૮ દરમિયાન હિમાલયમાં અધોરી બાવા પાસે જવાનું બન્યું,
શુંગારના પોધની પાઇળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં ૨૧ છાણાંની
૨૧ ઘૂણી ધ્યાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નજી બેસીને
સાધના, શીરડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અતીમ
તબક્કાનું માર્ગદર્શન.

૧૯૭૮ : તા. ૨૮-૩-૧૯૭૮ : રામનવમી, સંવત : ૧૯૮૫ કાશીમાં નિર્જીવા
બ્રહ્માનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજનામું. 'મનને'ની પ્રથમ
આવૃત્તિનું પ્રકાશન.

૧૯૮૦ : (તા. ૮-૮-૧૯૮૦) વિમાનમાર્ગ અમદાવાદથી કરાંચી જવાનો ગૂઢ
હુકમ.

૧૯૮૧ : માતાનું અવસાન.

૧૯૮૨ : હરિજન સેવક સંઘમાંથી ધૂટા થયેલા, છતાં હરિજન કન્યાશાત્રાલય માટે
મુંબઈમાં ફાળો ઉઘરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત
અવસ્થાના પુરાવા.

૧૯૮૩ : ૨૪, ફેલ્લુઆરીમાં ગાંધીજીના પેશાબના એરી જંતુઓનું પોતાના પેશાબમાં
દર્શન. નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ.

૧૯૮૪ : હિમાલયની યાત્રા-અદ્ભુત અનુભવો.

૧૯૮૬ : હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌનઅંકાંતનો આરંભ.

૧૯૮૦ : દક્ષિણ ભારતના કુંભકોણમ્બુના કાવેરી નદીને કિનારે હરિઃ ઽં આશ્રમની
સ્થાપના.

૧૯૮૪ થી સુરતના કુંભકોનમાં એક ઓરડીમાં મૌનઅંકાંતનો આરંભ.

૧૯૮૫ : (તા. ૨૮-૪-૧૯૮૫) નહિયાંદ, શેડીનદીને કિનારે હરિઃ ઽં આશ્રમની
સ્થાપના.

૧૯૮૫ : (તા. ૨૩-૪-૧૯૮૫) સુરત, કુંભકોનમાં હરિઃ ઽં આશ્રમની સ્થાપના.

૧૯૮૬ રથી ૧૯૭૫ : શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે તેવ અધ્યાત્મ-
અનુભવ ગ્રંથોનું લેખન-પ્રકાશન.

૧૯૭૬ : ફાજલપુર-મહીનદીના કિનારે શ્રી રમાશભાઈ અમીનના ફર્મ હાઉસમાં
તા. ૨૩-૭-૧૯૭૬ના રોજ માત્ર છ જણાની હાજરીમાં આનંદપૂર્વક
દેહત્યાગ. પોતાનું 'ઈટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ' અને આ
નિમિતે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પણત ગામોમાં પ્રાથમિક
શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળમાં કરવાની સૂચના.

॥ હરિઃ ઽં ॥

॥ હરિઃઓ ॥

આરતી

ॐ શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો,
પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો. ... ઓં શરણ.

મનવાળીના ભાવો, કર્મ વિષે ઊતરો, પ્રભુ (૨)
મન, વાળી ને દિલને (૨) કૃપાથી એક કરો. ... ઓં શરણ.

સર્વ મળેલાં સાથે, દિલ સદ્ગ્રાવ ઊગો, પ્રભુ (૨)
છો અપમાન થયાં હો (૨) ત્યાંથે ભાવ બઠો. ... ઓં શરણ.

નિભ પ્રકારની વૃત્તિ, ઊર્ધ્વગમન કરવા, પ્રભુ (૨)
પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા. ... ઓં શરણ.

મનના સકળ વિચારો, પ્રાણતણી વૃત્તિ, પ્રભુ (૨)
બુદ્ધિતણી સૌ શંકા (૨) ચરણકમળ ગળજો. ... ઓં શરણ.

જેવા દિલ હોઈએ પ્રભુ, તેવા દેખાવા, પ્રભુ (૨)
મતિ મુજ ખુલ્લી રે'જો (૨) સ્પષ્ટ જ પરખાવા. ... ઓં શરણ.

દિલમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું ઊલદું, પ્રભુ (૨)
કદી પણ મુજથી ન બનજો (૨) એવી મતિ દેજો. ... ઓં શરણ.

જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (૨)
ગુણ ને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો. ... ઓં શરણ.

મન, મતિ, પ્રાણ પ્રભુ ! તુજ ભાવ થકી ગળજો, પ્રભુ (૨)
દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઊછળજો. ... ઓં શરણ.

ખૂબ શ્રીમોહાનાં પુસ્તકો

૧. ભાગને (પદ્ધ)	૨૨. છુટનપુરીકર (પત્રો)	૪૪. છુટનસોરીલાં (પદ્ધ)	૬૭. કર્મઉપસના (પદ્ધ)
૨. ફુલ ચરણો (પદ્ધ)	૨૩. આપાટીપોકર (પ્રાથીના)	૪૫. છુટનસુરેશાં સાધના (પદ્ધ)	૬૮. મૌનએકંતાની તૈયારો (પ્રવચન)
૩. ફિરપુરીકર (પદ્ધ)	૨૪. લિટિજન સંતો (પદ્ધ-પદ્ધ)	૪૬. છુટનરંગનાં (પદ્ધ)	૬૯. મૌનમદિદ્દિનું હાર્દિકિરણ (પ્રવચન)
૪. જીવનપુરી (પદ્ધ)	૨૫. Life's Struggles ('જીવનસેક્ષણમાંનો અનુવાદ')	૪૭. છુટનમન્થાશું (પદ્ધ)	૭૦. મૌનમદિદ્દિસું મૂર્ખ (પ્રવચન)
૫. શ્રીગંગોવેલુ (પદ્ધ)	૨૬. છુટનમન્થાન (પત્રો)	૪૮. કૃપાં (પદ્ધ)	૭૧. મૌનમદિરિસું મૂર્ખ (પ્રવચન)
૬. ક્રીસ્ટબ્રાહ્મકર્માની (પદ્ધ)	૨૭. છુટનસુરેશાંન (પત્રો)	૪૯. કૃપાંશ (પદ્ધ)	૭૨. મૌનમદિરિસું મૂર્ખપુરિણા (પ્રવચન)
૭. ક્રીસ્ટાથા (પદ્ધ)	૨૮. નમદિપદ (પદ્ધ)	૫૦. ક્રીસ્ટસુરુદુ (પદ્ધ)	૭૩. શૈખ વિશેષ (સાંસ્કૃતિક)
૮. ગ્રામપલાપ (પદ્ધ)	૨૯. નમદિપદ (પત્રો)	૫૧. છુટનકથાની (પદ્ધ)	૭૪. જન્મ-પુનર્જન્મ (સાંસ્કૃતિક)
૯. પુસ્તિ મુખાખા (પદ્ધ)	૩૦. છુટનદર્શન (પત્રો)	૫૨. પ્રેમ (પદ્ધ)	૭૫. તદ્વારીદર્શન (સાંસ્કૃતિક)
૧૦. જીવનસેક્ષણમાં (પત્રો)	૩૧. અનાસ્ક્રીની (પદ્ધ)	૫૩. છુટનસંદર્ભન (પદ્ધ)	૭૬. આન્દ્રા-એક્સપ્રૈસ (સાંસ્કૃતિક)
૧૧. જીવનસેક્ષણ (પત્રો)	૩૨. જિયાસા (પદ્ધ)	૫૪. મેલ (પદ્ધ)	૭૭. ઝડપલે (સાંસ્કૃતિક)
૧૨. જીવનપુરીથી (પત્રો)	૩૩. જીવન અનુભવ ગીત (પદ્ધ)	૫૫. ગુજરામશી (પદ્ધ)	૭૮. અન્યાન્યાન્ય (સાંસ્કૃતિક)
૧૩. AT THY LOTUS FEET ('હૃદ ચરણોનો અનુવાદ')	૩૪. જીવનાંકર (પદ્ધ)	૫૬. જીવનપાર્દ્દ (પદ્ધ)	૭૯. ગ્રાહક પગલે પ્રકાશ (પત્રો)
૧૪. જીવનધેરણ (પત્રો)	૩૫. જીવનાંકરિ (પદ્ધ)	૫૭. જીવનચાંશતર (પદ્ધ)	૮૦. ક્રિસ્ટની સર્વે (પત્રો)
૧૫. TO THE MIND ('મનનેનો અનુવાદ')	૩૬. જીવનસુરેશાં (પદ્ધ)	૫૮. જીવનધારતર (પદ્ધ)	૮૧. ધનનો યોગ
૧૬. જીવનપુરેશ (પત્રો)	૩૭. શ્રીદ્વા (પદ્ધ)	૫૯. ભાવદેશુ (પદ્ધ)	૮૨. મુક્તાલાની પ્રેમસર્વ (પત્રો)
૧૭. જીવનપુરાધી (પત્રો)	૩૮. ભ્રાવ (પદ્ધ)	૬૦. ભાવદ્વોતિ (પદ્ધ)	૮૩. સમ્ય સથે સમાધિન (પત્રો)
૧૮. જીવનપુરાધી (પત્રો)	૩૯. જીવનસુરેશાં (પદ્ધ)	૬૧. ભાવદ્વેષ (પદ્ધ)	૮૪. ઉપરંત ઊરનાં પુરસ્ક્રીમંથી
૧૯. જીવનપુરેશ (પત્રો)	૪૦. નિમિત (પદ્ધ)	૬૨. ભાવદ્વોતિ (પદ્ધ)	૮૫. ધ્યેયાં ૧૫ સંકલની.
૨૦. જીવનપુરેશ (પત્રો)	૪૧. રાગદેશ (પદ્ધ)	૬૩. ભાવદ્વુદ્ધ (પદ્ધ)	
૨૧. જીવનપુરેશ (પત્રો)	૪૨. જીવનસુરેશાં (પદ્ધ)	૬૪. જીવનસુરેશાં (પદ્ધ)	
૨૨. જીવનપુરીઠા (પદ્ધ-પદ્ધ)	૪૩. જીવનતપ (પદ્ધ)	૬૫. જીવનગુપાલ (પદ્ધ)	